



યજમાન જાપાનના વિજય સાથે ટોક્યો ગેમ્સનો પ્રારંભ

PAGE NO. 18



ચીનના હેનાનમાં 24 કલાકમાં 18 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર

PAGE NO. 17

ટોક્યોમાં કોરોનાના એકસાથે 1979 કેસ

ઓલિમ્પિકમાં વિધના અંધાણ

ટોક્યોમાં ઈમરજન્સીની અવધી લંબાવાઈ, ચેપગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ



ટોક્યો

ટોક્યો ઓલિમ્પિકનો શુભારંભ 23 જુલાઈ (શુક્રવાર) થી થઈ રહ્યો છે. આના એક દિવસ પહેલા જ ગુરુવારે જાપાનની રાજધાની ટોક્યોમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 1979 કેસ નોંધાયા હતા. આ કેસો છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. આ પહેલા 15 જાન્યુઆરીએ ટોક્યોમાં કોરોનાનાં 2044 કેસ નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ટોક્યોમાં કોરોનાનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે, કોરોના વાયરસના 1832 નવા કેસ નોંધાયા હતા.

જાપાનમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા સાડા આઠ લાખને વટાવી ગઈ છે. જ્યારે, રોગચાળાને કારણે 15 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. નોંધપાત્ર બાબત એ છે કે, 12 જુલાઈએ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ ટોક્યોમાં કોરોના ઈમરજન્સી જાહેર કરી હતી. આ ઈમરજન્સી 22 ઓગસ્ટ સુધી શહેરમાં લાગુ રહેશે. કોરોના ઈમરજન્સી હોવા છતાં વાયરસના કેસો સતત વધી રહ્યા છે. ગુરુવારે ચેક રિપબ્લિકની વોલીબોલ ખેલાડી

માર્કેતા નૌશયુ અને નેધરલેન્ડનાં તાઈકવાંડો ખેલાડી રેશમી આગિંકને કોરોના ચેપને કારણે ટોક્યો ઓલિમ્પિકમાંથી ખસી જવું પડ્યું હતું. આ બેની સાથે, ઓલિમ્પિક વિલેજમાં ચેપગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ હતી. આગામી દિવસોમાં કોરોનાને કારણે ઓલિમ્પિકમાં વિઘ્ન આવી શકે છે.

બીજી તરફ ખ્રિસબેનને 2023માં યોજનારી ઓલિમ્પિકની યજમાનીના અધિકારો સુપરત કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમય પહેલાંથી આ અટકળો કરવામાં આવતી પરંતુ બુધવારે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ (આઈઓસી) બુધવારે વોટિંગ બાદ ખ્રિસબેનને યજમાન તરીકે જાહેર કર્યું હતું. ઓલિમ્પિક ઈવેન્ટ્સનું પૂરું આયોજન ક્રિવન્સલેન્ડ સ્ટેટમાં કરવામાં આવશે જેમાં ગોલ્ડ કોસ્ટ સિટી પણ સામેલ છે જેણે 2017ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. 2023ની ઓલિમ્પિકની યજમાની મેળવવા માટે કતાર, હંગેરી તથા જર્મની પણ સામેલ હતા. 2023માં પેરિસ અને 2024માં લોસ એન્જલસ ઓલિમ્પિકની યજમાની કરશે. ભારતે પણ 2023ની ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ તે ઘણું પાછળ રહી ગયું હતું. હવે ભારત 2023ની ઓલિમ્પિકની યજમાની માટેનો દાવો રજૂ કરે તેવી સંભાવના છે.

Amazon જેવી વિશ્વની અનેક વેબસાઈટ-એપ ઠપ થતા હડકંપ

45 મિનિટ સુધી યુઝર્સને મુશ્કેલી થઈ, સમસ્યા નિવારવા કવાયત

ન્યૂયોર્ક

આજે વિશ્વની ઘણી મોટી વેબસાઈટ્સ અને એપ્લિકેશનો લગભગ 45 મિનિટ માટે ડાઉન રહી હતી. આમાં એમેઝોન, પેટીએમથી લઈને અમેરિકન બેંકો અને ડેલ્ટા એરલાઈન્સની વેબસાઈટ્સ સામેલ છે. આ માટેનું કારણ Akamaiના ડીએનએસમાં આવેલી સમસ્યા છે. કંપનીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે હવે તેને ઠીક કરી લેવામાં આવ્યું છે. વેબસાઈટ્સ અને એપ્લિકેશન્સ હવે સામાન્યની જેમ કાર્ય કરી રહી છે. નોંધનીય છે કે આ વર્ષે આ બીજી વખત છે જ્યારે વિશ્વની ઘણી વેબસાઈટ્સ એક સાથે ડાઉન થઈ ગઈ છે.

આ વખતે DNS નો મુદ્દો જણાવાઈ રહ્યો છે. ખરેખર આ સમસ્યા Akamaiની છે જેણે વેબસાઈટ્સને અસર કરી છે. આ વેબસાઈટ્સમાં પ્લે સ્ટેશન નેટવર્ક, સ્ટીમ અને યુપીએસ સામેલ છે. રિપોર્ટ અનુસાર, આ મુદ્દો Akamai એજની DNS સેવામાં છે. ભારતીય એપ બેસડ પેમેન્ટ કંપની Paytm પર પણ મુશ્કેલી



આવી હતી. કંપનીએ કહ્યું છે કે હવે લાગે છે કે વેબસાઈટ્સ સામાન્ય રીતે કામ કરી રહી છે. Akamai એ કહ્યું છે કે ભવિષ્યમાં પણ આ અસરને ધ્યાનમાં રાખીને, તેનું નિરીક્ષણ સતત કરવામાં આવશે. ડેલ્ટા એરલાઈન્સ, એમેઝોન અમેરિકા, કોલ ઓફ ક્યુટી, એચબીઓ મેક્સથી લઈને ઘણી બેંક વેબસાઈટ્સ પણ ડાઉન રહી છે. Akamai તરફથી નિવેદન આવી ગયું છે. કંપની સર્વિસ ડિસરપ્શનનો સામનો કરી રહી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને કંપની આગામી કેટલાક દિવસોમાં એક અપડેટ લાવશે.

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada
bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069
Serving Greater Toronto Region Fax: 416-253-9461

ABOWATH REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપનો અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph.: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુઆમાં યાદ રાખશે
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office: 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email: patelzakir82@gmail.com

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

Avni Shah
B.A., JD
Barrister & Solicitor

ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002



નવેમ્બરથી કુઝ શીપને મંજૂરી આપવા કેનેડાની તૈયારી

ફેબ્રુઆરીમાં મુકાયેલો પ્રતિબંધ હવે કોરોનાની સ્થિતિ હળવી બનતા ઉઠાવી લેવાશે: ગુનાહિત ઇતિહાસ ધરાવનારને કેનેડામાં પ્રવેશ નહીં મળે

ઓન્ટેરિયો : જે કુઝશીપ કેનેડીયન સરકારના જાહેર આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરશે, તેમને કેનેડામાં પ્રવેશની મંજૂરી આ વર્ષની પહેલી નવેમ્બરથી મળી શકશે. આ જાહેરાત કેનેડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઓમર અલ્લાબાએ કરી હતી. આ વર્ષે જ ૪થી ફેબ્રુઆરીએ કેનેડાએ કુઝ શીપના પ્રવેશ ઉપર ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીનો પ્રતિબંધ જાહેર કર્યો હતો. જેનો આશય કેનેડીયનોને કોવિડ-૧૯થી બચાવવાનો જ હતો. હવે કેનેડામાં

કેનેડાએ ભારતની ફ્લાઈટ પરનો પ્રતિબંધ 21 ઑગસ્ટ સુધી લંબાવ્યો

ટોરોન્ટો : કેનેડામાં રહેતા કે ભારતથી જવા ઇચ્છતા ભારતીયોને મોટો ઝાટકો લાગ્યો છે. કેનેડાએ ભારતમાંથી ઉડાનોને 21 ઑગસ્ટ સુધી સસ્પેન્ડ કરી દીધી છે. કેનેડા સત્તાધીશોએ જારી કરેલી સત્તાવાર નોટિસમાં કહ્યું કે ભારતથી કોઈ ત્રીજા દેશના રસ્તે કેનેડા જનારા લોકોને કોઈ ત્રીજા દેશમાં કોરોના વાયરસ મોલેક્યુલર ટેસ્ટ કરાવો પડશે. તેમાં નેગેટિવ હોવા પર જ કેનેડામાં પ્રવેશવાની મંજૂરી મળશે. જો પ્રવાસ કરનાર લોકો પહેલાં જ કોરોના વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે તો તેમને પોતાના પ્રવાસથી 14થી લઈ 90 દિવસ પહેલાં ટેસ્ટ કરાવો પડશે. તેને પણ કોઈ ત્રીજા દેશમાં જ કરાવો પડશે. જો કે, જરૂરી વસ્તુ જેવી કે રસી અને ખાનગી સુરક્ષાના સાધનોની અવલગનતા માટે કાર્ગો વિમાનોને મંજૂરી આપવામાં આવી છે.

કોરોના વાઈરસની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાથી કેનેડાની સરકારે પ્રતિબંધ વહેલો હટાવી લેવાનો નિર્ણય લીધો છે.

જેથી દેશના સૌથી વધુ અસર પામેલા ટુરિઝમ સેક્ટરને થોડી રાહત મળી શકે અને વર્ષ ૨૦૨૨ની કુઝની સિઝન સારી

બની શકે. માર્ચ માસથી પ્રતિબંધો હળવા કરવાની શરૂઆત થઈ છે. જૂલાઈથી એમાં વધારો થયો છે. અત્યારે પણ

બિનઆવશ્યક પ્રવાસ માટે મંજૂરી નથી. એ રીતે જ અમેરિકા-કેનેડાની સરહદ પણ બિનઆવશ્યક પ્રવાસીઓ માટે બંધ જ છે અને ભારતથી આવનારી ફ્લાઈટસ પર પણ પ્રતિબંધ છે. કુઝ શીપના પ્રવાસીઓએ એક વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે, જો તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ હશે તો તેમને કેનેડામાં પ્રવેશ નહીં મળી શકે. એટલે કેનેડીયન સમુદ્રીજળમાં પ્રવેશતા પહેલાં એ વિશે ચકાસણી કરવી જરૂરી બની રહેશે.

ગુજરાતી સીનિયર્સ સમાજ ઓફ મિસીસાગાની વર્ચ્યુઅલ મીટીંગ: ફિલ્મી ગીતો સાથે મનોરંજન

મિસીસાગા

ગુજરાતી સીનિયર્સ સમાજ ઓફ મિસીસાગાની એક મીટીંગ ગત 18મીએ ઝુમ એપ પર યોજવામાં આવી હતી. પંકજભાઈ મહેતાએ સ્વાગતવિધિ કર્યા બાદ પ્રમુખ કલાબેન પટેલે ઉપપ્રમુખ પ્રવિણભાઈ મહેતા, સેક્રેટરી મહેન્દ્ર ગોઢિયા, ઈસી સભ્ય તથા રસીલાબેન ગજેરિયાનો આભાર માન્યો હતો. સંસ્થાના પ્રમુખ કનુભાઈ તથા સવિતાબેન પટેલની 68મી એનિવર્સરીની ઉજવણી કરાઈ હતી. પ્રાર્થના તથા બાદ રસીલાબેન કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી જ્યારે પંકજભાઈએ વક્તા ડો. સ્નિગ્ધાબેનનો પરિચય આપ્યો હતો. ડોક્ટરે આ તકે પીઠ અને કમરનો દુખાવો તમારા રોજિંદા કાર્યમાં બાધક નથી થતો તે વિષય પર માર્ગદર્શન આપી સૂચનો રજૂ કર્યા હતા. સાથે જ તેમણે સ્લાઈડ થકી હાડકામાં ઉમર પ્રમાણે જે ફેરફારો થાય છે તેની વિગતો રજૂ કરી હતી. અંતે પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં તેમણે સભ્યો દ્વારા રજૂ કરાયેલી મૂંઝવણો વિશે સચોટ



નિદાન કરી સલાહ સૂચનો આપ્યા હતા. આ તકે જાહેરાત થઈ હતી કે, જેમણે ડો. સ્નિગ્ધા મહેતાનો સંપર્ક કરવો હોય તેમણે 647-669-6822 ઉપર સંપર્ક કરવો. જે બાદ ટ્રેડર જયેશ મહેતાએ સંસ્થાની કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો હતો. અનસૂયાબેન મહેતા તથા અબુભાઈએ બોલીવુડના ગીતો રજૂ કરી મનોરંજન પુરુ પાડ્યું હતું.

ટોરોન્ટોમાં અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસી મહિલાના કપડા પહેરી લીધા

ટોરોન્ટો

ડાઉન ટાઉનમાં રહેનારી એક મહિલા સોમવારની રાત્રે જ્યારે એના ઘરે પાછી ફરી ત્યારે તેણે એક અજાણ્યા વ્યક્તિને પોતાના ઘરમાં જોયો હતો. વળી તે શખ્સે આ મહિલાના કપડા પણ પહેરી લીધા હતા અને રસોઈ કરી રહ્યો હતો. મહિલાએ આ ઘટના અંગે તરત જ પોલીસને ફરિયાદ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ગ્લોસ્ટર સ્ટ્રીટ અને યોન્ગ નજીકના એપાર્ટમેન્ટમાં બની હતી. જે સાંજે પાંચ વાગ્યાની આસપાસની હોવાનું પોલીસે બુધવારની અખબારી યાદીમાં જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ૩૩

વર્ષીય મહિલાએ આ ફરિયાદ લખાવી હતી કે જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે એના એપાર્ટમેન્ટમાં અજાણ્યો માણસ હતો. જેણે તેણીના કપડા પહેર્યા હતા. અને રસોડામાં ખાવાનું બનાવી રહ્યો હતો. આ મહિલાની અંગત ચીજો લઈને તે જતો રહ્યો હતો. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી અને એ વ્યક્તિને થોડા સમયમાં જ પકડી પાડ્યો હતો. આ શખ્સની નામ રોબર્ટ એન્થોની સ્ટમ્પો હોવાનું અને તે ૩૫ વર્ષીય હોવાનું બહાર આવ્યું હતું. બિનઅધિકૃત રીતે એક મહિલાના ઘરમાં પ્રવેશવાના ગુનાસર તેને બુધવારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.

શાળા કર્મચારીઓની વેકસીનેશનની સ્થિતિ ચકાસવામાં ઘોર બેદરકારી



ટોરોન્ટો : ઓન્ટેરિયોમાં એક તરફ શાળાઓ ફરીથી શરૂ કરવા સાથે ઓફલાઈન શિક્ષણ આપવાનું આયોજન થઈ રહ્યું છે અને સંભવતઃ આગામી સપ્ટેમ્બરથી શાળાઓ શરૂ થશે. પરંતુ એ ત્યારે જ શક્ય બની શકશે જ્યારે બધા વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફનું વેકસીનેશન પૂર્ણ થયું હોય. અત્યારે તો એ વિશેનો કોઈ ડેટા ઉપલબ્ધ જ નથી. જો કે, શિક્ષણ મંત્રાલય એ વિશે કોઈ નવી માર્ગદર્શિકા ટૂંક સમયમાં બહાર પાડે એવી શક્યતા છે. જેમાં સપ્ટેમ્બર માસથી શાળાઓ કઈ રીતે શરૂ થશે તેની ગાઈડલાઈન હશે.

જો કે, એનો બધો મદાર વેકસીનેશન અને રોગપ્રતિકારકતામાં વધારા ઉપર જ રહેશે. યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના પબ્લિક હેલ્થના પ્રોફેસર બેરી પેક્સ કહે છે કે, વેકસીનેશનના ડેટાના અભાવે પ્રતિબંધો કેવી રીતે હટાવી શકાશે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. એ વાતની ચિંતા નથી કે શાળાઓમાં જવું સલામત હશે કે કેમ, પણ ચિંતા એ વાતની છે કે

શાળાઓમાં વેકસીનેશનનું કામ પૂર્ણ થયું છે કે નહીં, એના આંકડાઓ જલ્દીથી મળી જાય એની છે. જેથી જાહેર આરોગ્યને લગતા પ્રતિબંધો કેટલી હદે હટાવી શકાય એ નક્કી થઈ શકે.

ઓન્ટેરિયોની કોવેક્સ સિસ્ટમ પાસે શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓના વેકસીનેશન વિશેના આંશિક આંકડાઓ છે. પરંતુ આરોગ્ય વિભાગના પ્રવક્તા કહે છે કે, એ જાણકારીમાં જુદા જુદા વિભાગોના લાયક ગણાયેલા કર્મચારીઓનો સમાવેશ થયો છે કે નહીં એ જાણવા મળતું નથી. એ રીતે જ જુદા જુદા શાળાના બોર્ડના અધિકારીઓ પણ કહે છે કે, તેમની પાસે વેકસીનેટેડ સ્ટાફની પુરતી વિગતો નથી. આ બોર્ડસમાં ઓન્ટેરિયો એલીમેન્ટરી, સેકન્ડરી, કેથોલિક અને ફ્રેન્ચ સ્કુલ્સનો સમાવેશ થાય છે. કેનેડીયન યુનિયન ઓફ પબ્લિક એમ્પ્લોઈઝ જેમાં શાળાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે એ પણ જણાવે છે કે, તેમની પાસે પણ વેકસીનેશનનો પૂરો ડેટા ઉપલબ્ધ નથી.

ટોરોન્ટોમાં એક મકાન માટે અનેક ઓફર અંતે ૪૨૦૦૦૦ યુએસ ડોલરમાં વેચાણ થયું

ટોરોન્ટો : ટોરોન્ટો નગરની એક વ્યસ્ત શેરીમાં આવેલા એક મકાન માટે ઘણી ઓફર્સ આવી હતી અને એ એની અંદાજિત કિંમત કરતા વધુ કિંમતમાં વેચાયું હોવાના સમાચાર છે. ૪૨૦૦૦૦ યુએસ ડોલરમાં મકાન વેચાયાના આ સમાચારથી શહેરના પ્રોપર્ટી માર્કેટમાં લાલચોળ તેજના અણસાર મળી રહ્યા છે. મકાનનો સોદો કરાવનાર રીટલર ટેડેટા ગુસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ત્રણ બેડરૂમ ધરાવતા આ ટાઉન હાઉસને માટે કુલ ચાર ઓફરો મળી હતી.

આ પ્રોપર્ટી કોક્ષવેલ એવેન્યુ નોર્થ

બેંકોએ ઓછા વ્યાજની ઓફર કરતા રિઅલ એસ્ટેટમાં તેજ આવી

સ્થિત છે અને માર્કેટલ ગેરોન હોસ્પિટલ નજીક આવેલી છે. આ પ્રોપર્ટીના અમને ધારેલી કિંમતથી ૪૦ ટકા વધુ મળ્યા હતા. એ ૧.૫૨ મિલિયન યુએસ ડોલરમાં વેચાઈ હતી. આ પ્રોપર્ટીનું તાજેતરમાં જ રીનોવેશન થયું હોવાથી એની સારી કિંમત ઉપજી હતી. આ આંકડાઓ રોયલ લેપેજના

હાઉસ પ્રાઈસ સર્વેમાં જાણવા મળ્યા હતા જે દર્શાવે છે કે મહામારી બાદના સમયમાં બેંકોએ ઓછા વ્યાજની ઓફર કરીને મકાન ખરીદનારાઓને પ્રોત્સાહન આપ્યું હોવાથી બજારમાં આ સુધારો થઈ શક્યો છે. રોયલ લેપેજના અધ્યક્ષ ફિલ સોપર કહે છે કે બધા જાણે છે તેમ હવે હાઉસિંગ ઉદ્યોગમાં તેજ આવી ચૂકી છે. ખરીદનારાઓ માટે પુરતા મકાનો છે પણ હવે એના ભાવોમાં વધારો થશે એવું પણ લોકો માની રહ્યા છે. માંગમાં વધારો થતો રહેશે અને પુરવઠો ઓછો રહેશે તો ભાવોમાં સતત વધારો થતો જ રહેશે.

ઓન્ટેરિયો પ્રાંતમાં રી-ઓપનિંગ પ્રક્રિયા પહેલાં વેકસીનેશનની ઝડપ અનિવાર્ય

વેકસીન લેનારને ઝડપથી સર્ટિફિકેટ આપવાની વ્યવસ્થા કરવા માંગણી

ટોરોન્ટો : ઓન્ટેરિયો કોવિડ-૧૯ સાયન્સ એડવાઈઝરી ટેબલના જણાવ્યા મુજબ હાયર રિસ્ક સેક્ટરને ફરીથી શરૂ કરવામાં વેકસીન સર્ટિફિકેટ ઉપયોગી બની શકશે. બુધવારે પ્રકાશિત ૨૧ પાનાની નોંધમાં ટેબલ જણાવે છે કે, પ્રાંતીય સરકારો જો વેકસીનેશન સર્ટિફિકેશન પ્રોગ્રામને ઝડપથી પૂર્ણ કરે રાખેતાની સ્થિતિ માટેની તૈયારી ઝડપથી કરી શકશે.

આ ઉપરાંત વેકસીનેશન સર્ટિફિકેટને ઓન્ટેરિયોમાં ટૂંકા ગાળા માટે પણ હાયર રિસ્ક સેટોરને ફરીથી શરૂ કરવા આધાર ગણી શકાશે. જેમકે ઈનડોર ડાઈનિંગ, બાર, જીમ, સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓને ધીરે ધીરે મંજૂરી આપી શકાય. એમાં સંખ્યાની મર્યાદાને પણ ધીમે ધીમે વધારી શકાય.

લાંબા ગાળાની રીતે એ બધી પ્રવૃત્તિઓ માટે પ્રાંતના

ઈમ્યુનાઈઝેશન રેકોર્ડ્સ અને ધારાધોરણો મુજબની બાબતોને ધ્યાનમાં રાખીને શાળાઓ, કામકાજની જગ્યાઓ, ઓફિસો અને બાંધકામની સાઈટસ પણ શરૂ કરી શકાય. જેમાં પણ વેકસીનેશન સર્ટિફિકેટને મહત્વ આપી શકાય અને એવા સ્થળોએ પૂર્ણપણે વેકસીનેટેડ લોકો જ આવી શકે એવી શરત રાખી શકાય. ટેબલના સાયન્ટીફિક ડાયરેક્ટર ડો. પીટર જુનીએ ટોરોન્ટો ખાતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ રીતે વેકસીન લેનારા અને નહીં લેનારાઓ વચ્ચેના તફાવતને મહત્વ આપવાથી વેકસીનેશનની ઝડપ પણ વધી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, વેકસીનેશન પ્રોગ્રામની સફળતા જ પ્રાંતમાં સામાન્ય સ્થિતિ જલદીથી લાવવામાં ઉપયોગી બની શકશે. જેથી અર્થતંત્ર અને સમાજ બંને સાથે ચાલી શકે અને બધી પ્રવૃત્તિ પહેલાની જેમ સરળતાથી ચાલી શકે.

ઈસ્લામોફોબિયા સમિતિ પહેલા મુસ્લિમ કાઉન્સિલના 61 સૂચનો

ઓન્ટેરિયો : સમાજમાં મુસ્લિમ વિરોધી લાગણી સામે લડવાની રાષ્ટ્રીય સ્તરની રણનીતિ મુજબ કેનેડાની મુસ્લિમ કાઉન્સિલે કુલ 61 સૂચનો કર્યા છે. જે આવતા અઠવાડિયે યોજનારી ઈસ્લામોફોબિયા સમિતિ પૂર્વેની છે. સંસ્થાએ જે શહેરોમાં મુસ્લિમોને નિશાન બનાવીને હિંસક ઘટનાઓ બની હોય ત્યાં સોમવારે કાર્યક્રમો યોજીને ભોગ બનેલાઓની માહિતી એકત્ર કરી હતી. જેમાં ક્યુબેક સીટી, ધ ગ્રેટર ટોરોન્ટો એરિયા, એડમન્ટન અને લંડન ઓન્ટેરિયોનો સમાવેશ થાય છે.

જ્યાં ગયા મહિને જ એક પરિવારના ચાર સભ્યોની હત્યા થઈ હતી. જ્યારે એ લોકો

જે શહેરોમાં મુસ્લિમોને નિશાન બનાવાયા ત્યાંથી ભોગ બનનારીઓની માહિતી એકત્ર કરાઈ



ચાલવા નીકળ્યા હતા. આ ઈવેન્ટમાં 61 સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. 0જે સંસ્થા પોલીસી મેકર્સને આપશે. ગુરૂવારે નેશનલ સમિટ મળે એ પહેલા આ ભલામણો તેમના સુધી પહોંચી જશે. એનસીએમએમના ચીફ એકિઝક્યુટીવ મુસ્તફા

ફારૂકે દક્ષિણ પશ્ચિમ ઓન્ટેરિયોમાં પત્રકારોને કહ્યું હતું કે, આ ભલામણો સરકારના બધા સ્તરના અધિકારીઓએ મુસ્લિમ સમુદાય સાથે ચર્ચાઓ કરીને તૈયાર કરી હતી. હવે આપણે સરકાર શું પગલા લેશે એ જ જોવાનું રહે છે. અમને માત્ર

સરકાર આ બેઠકમાં હાજર રહે એમાં રસ નથી. પણ કેવા નક્કર પગલા લેવાની તૈયારી દર્શાવે એ વધુ મહત્વનું છે. અન્ય સૂચનોમાં કિમીનલ કોડમાં સુધારો કરી નફરત આધારિત ગુનાઓની સજા કે દંડની રકમમાં ફેરફાર કરવો જેમાં ચોરી, હુમલો, ધમકીઓ અને હત્યા જેવી ઘટનાઓને સમાવી લેવી જોઈએ. એ રીતે જ પ્રાંતોની સરકારે શાળાઓમાં આ અંગે શિક્ષણ અને જાણકારી આપવી જોઈએ એવી રજૂઆત કરવામાં આવી છે. લંડન મુસ્લિમ મસ્જીદના વાર્ડેન ચેરમેન નુસાઈબા અલ અઝીમે કહ્યું હતું કે આ બેઠકમાં કોઈ રાજકારણીની જરૂર નથી. પરંતુ ચૂંટાયેલા અધિકારીઓ જ હાજર રહેવા જોઈએ.

સંપૂર્ણ રીતે વેકસીનેટેડ પ્રવાસીઓ હવે ઓગસ્ટથી US સરહદ ઓળંગી શકશે

મેનીટોબામાં આગ બુઝાવવા ગયેલા વોટર બોમ્બરને ખાનગી ડ્રોને અટકાવ્યું

ટુડોએ અધિકારીઓ તથા મંત્રીઓ સાથે બેઠક યોજી વેકસીનેશનનો ચિતાર મેળવ્યો

ટોરોન્ટો : વડા પ્રધાન જસ્ટીન ટુડોના કાર્યાલયમાંથી કેનેડાના પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. પીએમએ તરફથી જારી એક નિવેદનમાં જણાવાયું છે કે, કેનેડા-યુએસ બોર્ડર સંપૂર્ણ રીતે વેકસીનેટેડ પ્રવાસીઓ માટે ઓગસ્ટના મધ્ય સુધી ખુલ્લી મુકાઈ શકે છે અને સપ્ટેમ્બરથી અન્ય દેશો માટે પણ ખુલ્લી મુકાઈ શકે છે.

૧૫મી જુલાઈએ વડાપ્રધાને પ્રાંતીય અધિકારીઓ અને સરકારી બાબતોના મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં કેનેડામાં વેકસીનેશનનો દર અને સરહદ ખુલ્લી મુકવાના મુદ્દા ખાસ હતા. અહેવાલ



મુજબ જો કેનેડાનો વેકસીનેશન રેટ અને જાહેર આરોગ્યની સ્થિતિ સુધરતી રહેશે તો સરકાર અન્ય દેશોના પ્રવાસીઓને પણ પ્રવેશની મંજૂરી આપી શકશે. પૂરી રીતે વેકસીનેટેડ અમેરીકન નાગરિકો અને પરમેનન્ટ રેસીડન્સ માટે કેનેડામાં પ્રવેશનું ઓગસ્ટના મધ્યભાગથી થઈ શકશે.

માર્ચ ૨૦૨૦થી બંધ રખાયેલી કેનેડા અમેરિકા સરહદને ફરીથી ખુલ્લી મુકવા અંગે કેનેડા અને અમેરિકા વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. કેનેડામાં ૮૦ ટકા લોકોને કોવિડ-૧૯ની વેકસીનનો પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે અને ૫૦ ટકાથી વધુ લોકો પૂર્ણ રીતે વેકસીનેટેડ છે.

ટુડો સરકારે અગાઉ કહ્યું હતું કે, ૭૫ ટકા લોકો વેકસીનેટેડ થાય પછી જ નિયંત્રણો ઓછા કરાશે. પાંચમી જુલાઈથી પૂર્ણ રીતે વેકસીનેટેડ પ્રવાસીઓ માટે સરહદ ખુલ્લી કરવાની શરૂઆત થઈ હતી.

મેનીટોબા : મેનીટોબાના પૂર્વીય વિસ્તારમાં આવેલા જંગલ નજીકના વ્હાઈટ શેલ પ્રોવિન્શીયલ પાર્કમાં લાગેલી આગ બુઝાવવા આવેલા વોટર બોમ્બરના માર્ગમાં એક ડ્રોન આવી જતાં બોમ્બરે પાછા ફરી જવું પડ્યું હતું. આ ઘટના શનિવારે બની હતી જ્યારે બોમ્બર વિમાનના રૂટને આગની જવાબાઓથી બચાવવા માટે બદલવામાં આવ્યો અને વેસ્ટ હોક લેક નજીકથી પસાર થતું હતું. ત્યારે અચાનક એક ડ્રોન સામે આવી જતા વિમાને પાછા ફરી જવું પડ્યું હતું. જેને કારણે ઘટના સ્થળે હાજર અગ્નીશામક દળના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

મેનીટોબા વાઈલ્ડફાયર સર્વિસના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોન હેલાટે જણાવ્યું હતું કે, અચાનક કોઈકે ડ્રોન ઉડાડતા આ ઘટના બની હતી. જો કે, સ્થળ ઉપરના ફાયર ફાઈટર્સે પોતાની કામગીરી સારી રીતે બજાવીને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. બીજા ઉપર આવનારા પ્રવાસીઓ જ ડ્રોન ઉડાડતા હોય છે. પણ એ વ્યક્તિ ઓળખાયો નહોતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, અમારા માણસોની કામગીરીને ધ્યાને લેવી જોઈએ અને જેમણે ડ્રોન ઉડાડ્યું, એની પણ નોંધ લેવાવી જોઈએ. જ્યાં આગ લાગવાની શક્યતા હોય એવી જગ્યા નજીક ડ્રોન ઉડાડનારાઓ સામે કડક પગલા લેવાવા જોઈએ અને ગુનો દાખલ કરવો જોઈએ, તો જ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય.

કથા, હવન, ગાયત્રી યજ્ઞ, વાસ્તુ પૂજન, ગ્રહશાંતિ,

શશીકાંત ભટ્ટ

૯૦૫ ૪૫૬ ૭૬૨૨

કાલસર્પે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ, વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન, બેબી શાવર, જેવા કાર્યો માટે સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622
Cell: 416-258-2750

THINKING OF INVESTING?

INVEST AS LOW AS \$50,000 IN REAL ESTATE

SECURED INVESTMENT with up to 8-12% Guaranteed Return

INVEST WITH

Sharia'h Compliant

We have multiple avenues for investment in Residential Properties, Commercial Properties or Construction Projects plus your investment is secured against the assets.

CALL 416 893 4585 TODAY!!!

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

#1

RE/MAX CROSSROADS REALTY INC. Brokerage

#SellwithABOWATH your Local REALTOR

ABOWATH.COM

*Not intended to Solicit client under contract.

LIFE INSURANCE

MORTGAGE/LINE OF CREDIT INSURANCE

Q : DO YOU HAVE MORTGAGE / LINE OF CREDIT INSURANCE WITH BANK ?
A : COMPARE & SAVE UP TO 50% LOWEST RATES GUARANTEED

AGE	\$ 250,000		\$ 500,000		\$ 1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 12.00	\$ 07.00	\$ 18.00	\$ 10.00	\$ 32.00	\$ 19.00
40 Yrs	\$ 13.00	\$ 08.00	\$ 22.00	\$ 14.00	\$ 36.00	\$ 26.00
50 Yrs	\$ 30.00	\$ 18.00	\$ 50.00	\$ 31.00	\$ 95.00	\$ 60.00
60 Yrs	\$ 85.00	\$ 56.00	\$ 146.00	\$ 103.00	\$ 271.00	\$ 190.00

ALSO AVAILABLE

- ★ NO MEDICAL TEST LIFE INSURANCE (up to age 85)
(Even if you have DIABETES, BLOOD PRESSURE, HEART ATTACK, STROKE)
CANCER OR INSURANCE declined by other companies
- ★ CORPORATION OWNED LIF / CRITICAL ILLNESS INSURANCE
(Key Person INSURANCE, BUY SELL AGREEMENT, GROUP BENEFITS)
- ★ MONEY BACK LIFE / CRITICAL ILLNESS INSURANCE, RRSP, RESP, TFSA

416.320.4614 Toll : 1866.623.0865 Call For HONEST ADVICE

Davinder Singh Chawla

MONTHLY & ANNUAL PLANS

SUPER VISA INSURANCE

HARD TO BEAT OUR PREMIUMS



તંત્રી સ્થાનેથી

પીગાસસ કાંડ : માનવાધિકારના સભ્યો, નેતા અને પત્રકારો નિશાને

ઈઝરાયેલના જાસૂસી સોફ્ટવેર પીગાસસનો ઉપયોગ કરીને જુદા જુદા દેશોની સરકારો દ્વારા પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને નેતાઓની જાસૂસી કરાઈ હોવાની ઘટના હાલ ભારત જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા કંપનીઓ, ફોરબિડન સ્ટોરી અને એમનેસ્ટી ઈન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ છાપવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિશ્વના આશરે 50,000 ફોન હેક કરવામાં આવ્યા હતા. તેમાં પત્રકાર, નેતા, મંત્રી, એક્ટિવિસ્ટ સામેલ હતા. ફોન હેકિંગ માટે ઈઝરાયેલની કંપની એનએસઓ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં આ ખુલાસાને લઈ ભારે હોબાળો મચ્યો છે. વિપક્ષ દ્વારા સંસદથી લઈને રસ્તાઓ ઉપર આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. જે લોકોની જાસૂસી થઈ તે યાદીમાં આશરે 300 ભારતીયો હતા. જેમાં રાહુલ ગાંધી, પ્રશાંત કિશોર સહિત અનેક વિપક્ષી નેતા, 40થી વધુ પત્રકારો, મંત્રીઓ અને અન્ય હસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. હવે ભારતમાં પીગાસસ જાસૂસી કાંડને લઈને વિપક્ષો ભારે આક્રમક બની ગયા છે. અને સંસદના ચોમાસા સત્રને ખોરવી રહ્યાં છે. વિપક્ષો આ મુદ્દે કેન્દ્રની મોટી સરકાર પાસે સ્પષ્ટતા માંગી રહ્યાં છે. પરંતુ સરકાર આ રિપોર્ટને પાયાહિન ગણાવી રહી છે. જો કે, વિપક્ષ હવે આ મુદ્દે એસઆઈટી તપાસની માંગ કરવા માંડ્યો છે.

ઈઝરાયેલની એનએસઓ નામની કંપની દ્વારા બનાવવામાં આવેલો પીગાસસ નામનો સ્પાયવેર અગાઉ પણ અનેક વખત ચર્ચામાં આવી ચૂક્યો છે. પીગાસસ સ્પાયવેર દ્વારા લોકોના સ્માર્ટફોનને હેક કરીને તેમની જાસૂસી થઈ શકે છે. વર્ષ ૨૦૧૬માં કેટલાંક સંશોધકોએ કહ્યું હતું કે, પીગાસસ સ્પાયવેર દ્વારા સંયુક્ત આરબ અમીરાતમાં સરકારનો વિરોધ કરતા એક કાર્યકરની જાસૂસી કરવામાં આવી હતી. એનએસઓના દાવા અનુસાર પીગાસસ સ્પાયવેર માત્ર જુદા જુદા દેશોની સરકારોને જ વેચવામાં આવે છે અને કંપનીના જણાવ્યા અનુસાર આ જાસૂસી સોફ્ટવેર અત્યાર સુધીમાં માત્ર ૩૭ દેશોની સરકારને વેચવામાં આવ્યો છે. ભારત પણ એમાં સામેલ હોવાનું કહેવાય છે. વર્ષ ૨૦૧૦માં સ્થાપવામાં આવેલી એનએસઓ કંપનીએ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે, તેઓ આ ટેકનિક માત્ર જાસૂસી અને કાનૂની એજન્સીઓને જ વેચે છે.

આ સોફ્ટવેરનો ઉદ્દેશ ગુનાખોરી અને આતંકવાદી ગતિવિધિઓથી લોકોને બચાવવાનો છે. હવે જે તે દેશની સરકાર સોફ્ટવેર ખરીદ્યા પછી શું કરે છે તે બાબતે તેની પર નિર્ભર છે. સોશિયલ મીડિયા નેટવર્કિંગ એપ વોટ્સએપે વર્ષ ૨૦૧૯માં એનએસઓ સામે કેસ કર્યો હતો. જેમાં આરોપ મુકાયો હતો કે, કંપનીની જાણ બહાર પીગાસસ દ્વારા તેના ગ્રાહકોની જાસૂસી થઈ રહી છે. સામાન્ય રીતે સ્માર્ટફોનને હેક કરવા સ્પાયવેર ફોનમાં ઘૂસણખોરી કરવી પડે છે. પીગાસસ સ્પાયવેર એટલો એડવાન્સ છે કે, તેને ફોનમાં ઘૂસવા માટે કોઈ લિંક ઉપર ક્લિક કરવાની પણ જરૂર પડતી નથી. કોઈના સ્માર્ટફોનમાં આ સ્પાયવેર ઘૂસાડવો હોય તો માત્ર એક મિસ કોલની જરૂર પડે છે. મિસ કોલનો જવાબ ન આપવામાં આવે તો પણ પીગાસસ સ્માર્ટફોનને પોતાના કાબુમાં લઈ લે છે અને વ્યક્તિની દરેક હિલચાલ પર નજર

રાખે છે. ફોનની અંદર ઘૂસણખોરી કર્યા બાદ પીગાસસ ફોન કોલ, એસએમએસ, વોટ્સએપ મેસેજ, ઈમેલ, બ્રાઉઝર હિસ્ટ્રી, પાસવર્ડ જેવી દરેક માહિતી ચોરી શકે છે. એન્ડ્રોઇડ મેસેજ પણ બચી શકતા નથી. સ્માર્ટફોનના કેમેરા અને માઈકને પણ કાબુમાં લઈને તે આસપાસ ચાલી રહેલી ગતિવિધિ પણ રેકોર્ડ કરી શકે છે. સોફ્ટવેર તમામ માહિતી વાઈફાઈ કે, મોબાઈલ ઈન્ટરનેટ દ્વારા ફોનની બહાર મોકલી શકે છે. આ સ્પાયવેર ફોનની અંદર અદૃશ્ય રહે છે અને ફોનને ધીમો પણ નથી કરતો કે જેથી કોઈને શંકા જાય. આ સ્પાયવેર વખત આવ્યે જાતે જ નષ્ટ થઈ શકવાની ક્ષમતા પણ ધરાવે છે. હકીકતમાં આ પહેલી વખત નથી કે, કોઈ સરકાર ઉપર વિરોધીઓના ફોન ટેપ કરવાના આરોપ લાગ્યા હોય. અવારનવાર દુનિયાના દેશોની સરકારો ઉપર વિરોધીઓની જાસૂસી કરવાના આરોપ મૂકવામાં આવે છે. સરકારો આવા દાવાને રદિયા આપતી રહે છે. કઠણાઈ એ છે કે, આરોપ અને પ્રત્યારોપમાં સત્ય કદી બહાર આવતું નથી. ખરેખર તો વૈશ્વિક સ્તરે એવા કોઈ સાઈબર કાયદા નથી કે, સરકારોને લોકોની જાસૂસી કરતા રોકવામાં આવે. ઈન્ટરનેટના આ આધુનિક યુગમાં કોઈની પણ પ્રાઈવસી સલામત નથી.

જેમ જેમ સાઈબર દુનિયા વિશાળ બની રહી છે તેમ તેમ સુરક્ષાની સમસ્યા પણ વધી રહી છે. આધુનિક સમયમાં સાઈબર વર્લ્ડ લોકો માટે જરૂરી બની રહ્યું છે. પરંતુ તેની સાથે જોડાયેલી બાબતોમાં જોખમો પણ વધી રહ્યા છે. એક અંદાજ અનુસાર સાઈબર કાર્ડમને કારણે દુનિયામાં દર મિનિટે ૨૯ લાખ ડોલરનું નુકસાન થાય છે. વર્ષ ૨૦૧૭ના આંકડા અનુસાર સાઈબર દુનિયામાં રોજ ૭,૮૦,૦૦૦ દસ્તાવેજો હરાફેરી અથવા ચોરી થયા હતાં. સાઈબર સિક્યોરિટી એજન્સીઓ કશું કરી શકે નહીં તેવું પણ નથી. કરોડોની સંખ્યામાં પહોંચેલી જુદી જુદી એપમાંથી રોજની આશરે ૨૪ હજાર સિદ્ધિ એપ બ્લોક કરવામાં આવે છે. પરંતુ આ આંકડો સાવ નાનો છે. વર્ષ ૨૦૧૫માં સાઈબર કાર્ડમને કારણે ત્રણ હજાર અબજનું નુકસાન થયું હતું અને વર્ષ ૨૦૨૧માં આ આંકડો છ હજાર અબજ પહોંચવાનું અનુમાન છે.

જે ઝડપે સાઈબર વર્લ્ડ વિસ્તરી રહ્યું છે એ ઝડપે સુરક્ષાના ઉપાયો વિકસાવવાની આવશ્યકતા છે. આ વર્ષે દુનિયાભરના કુલ પાસવર્ડનો આંકડો ૩૦૦ અબજ કરતા વધી જશે એ સંજોગોમાં આટલી મોટી સંખ્યાને સુરક્ષિત રાખવું નિશ્ચિતપણે પડકાર છે. સોશિયલ મીડિયાના એકાઉન્ટનું હેકિંગ મોટાભાગે પાસવર્ડની ચોરી દ્વારા થાય છે. સાઈબર વર્લ્ડના ગઠિયાઓ સારી રીતે એ જાણે છે કે, પાસવર્ડનું તાળું કઈ ચાવીથી ખૂલે છે. એટલા માટે સરળ પાસવર્ડનું અનુમાન કરવું તેમના માટે મુશ્કેલ નથી. સાઈબર વર્લ્ડમાં ૨૧ ટકાથી વધારે ફાઈલો અસુરક્ષિત છે. મતલબ કે, તેમના ઉપર કોઈ લોક નથી. કંપનીઓને પણ કોઈ ડેટા કે ફાઈલ ચોરીનો ખ્યાલ આવતા ત્રણેક મહિના લાગી જાય છે. આધુનિક કંપનીઓના આ હાલ હોય તો સામાન્ય લોકોને તો ડેટા કે ફાઈલ ચોરીનો ખ્યાલ પણ ન આવે એ સ્વાભાવિક છે. આખી દુનિયા ડિજિટલ બની રહી છે પરંતુ આ તેની નબળી બાજુ પણ છે. સાઈબર કાર્ડમ અને ડેટાચોરીને રોકવી આસાન નથી. નૈતિકતાના દાવા કરતી અનેક દેશોની સરકારો પણ પોતાના પ્રતિસ્પર્ધીઓનો ડેટા ચોરવામાં સંકોચ નથી અનુભવતી. ખરેખર તો સરકારોએ પોતે સાઈબર સુરક્ષાનું અભેદ કવચ તૈયાર કરવું જોઈએ. જોકે સાઈબર સુરક્ષા માટે સરકારના ભરોસે બેસી રહેવું પણ હિતાવહ નથી.

manoj1968@yahoo.ca

ARISTO PEST CONTROL
Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI


24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

 Written Guarantee And
Discounted Rates

CALL SANKET TRIVEDI - 647.339.3926
Government Licensed Structural Exterminator

INDEPENDENTLY OWNED AND OPERATED

JAY PATEL
BROKER

647.241.3818
jaypatel1323@gmail.com

"Let Me Make Your Dream Home Into A Reality"
Residential, Commercial & Investment in Real Estate

 Off : 905.456.1000 | Fax : 905.456.1924
295 Queen Street East, Brampton, On., L6W 3R1

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા ક્યોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$8.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$6.50 +Tax



CATERING SPECIAL

\$ 7.99 10 items

+Tax

Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

Franchise
Opportunity
in GTA

Call us for details

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.

ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪

૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

દેશ-વિદેશથી ટોરન્ટો ભણવા આવતા ગુજરાતી
(વેજીટેરીયન) સ્ટુડન્ટ, ભાઈઓ તથા બહેનોની ખાસ
સગવડ માટે તુષાર શાહ તથા ગોવર્ધન થાળ શરૂ કરે છે

ગુજરાત ભવન

જેમાં આપને સ્પેશિયલ રૂમ, શેરીંગ રૂમ, ગુજરાતી વેજીટેરીયન ભોજન,
પ્રાઈવેટ બેડ, Wi Fi ઇન્ટરનેટ વગેરે સગવડો આપવામાં આવશે.



ગુજરાત ભવન

Quarantine
Special
Package

\$73 Per Day



Call : Tushar Shah - 416-434-8121

ગુજરાત ભવન - 416-913-7184

4694 Kingston Road, Scarborough.



ચીખલી પોલીસ મથકમાં બે આરોપીઓએ ફાંસો ખાધો, ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ

નવસારી

ચીખલીમાં ચોરીના બે આરોપીઓએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જો કે પોલીસ સ્ટેશનની અંદર બંને આરોપીઓના શંકાસ્પદ મોતને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, ખુદ નવસારીના ધારાસભ્ય અનંત પટેલે બંને આરોપીઓના શંકાસ્પદ મોતને લઈને પોલીસ સામે સવાલ ઉભા કર્યા છે.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે શકમંદ આરોપીઓને ચીખલી પોલીસ ચોરીના ગુનામાં ગત રોજ ઉઠાવી લાવી

હતી. અને ચીખલી પોલીસ સ્ટેશનના લોકઅપમાં પૂરી દીધા હતા. જો કે બંને આરોપીઓએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવી દીધું હતું. જો કે પોલીસની આપઘાતની આ થિયરી લોકોનાં ગળે ઉતરી રહી નથી.

આ ઘટનાની જાણ થતાં જ મીડિયા પોલીસ સ્ટેશને પહોંચી ગયું હતું. પણ પોલીસ દ્વારા ઘટના રૂમમાં મીડિયા પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અને અધિકારીઓ દ્વારા પોલીસની કામગીરીની તપાસ કરતાં હોવાનું બહાનું કાઢીને મીડિયા કર્મીઓને અંદર પ્રવેશતાં અટકાવ્યા હતા. ઘટનાને 7

કલાકથી વધુ સમય વીતવા છતાં પણ હજુ મીડિયાને પ્રવેશ પર પ્રતિબંધ છે.

આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત ડેપ્યુટી કલેક્ટર પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. ચીખલી પોલીસમાં બે આરોપીઓના શંકાસ્પદ મોતને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 2 શંકમંદ આરોપીના શંકાસ્પદ મોત મામલે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું ઘટના મામલે મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ આદિવાસી સમાજના 19 વર્ષીય બંને યુવકોના આપઘાતને શંકાસ્પદ મોત ગણાવ્યા હતા.

વાઘેચામાં તાપી નદીમાં નાહવા જતાં સુરતના 6 તણાયા, 2 યુવાનના મોત

સુરત

સુરતના 6 યુવાનો ટ્રીપ પર બારડોલીની વાઘેચાની તાપી નદી પર પહોંચ્યા હતા. પણ અહીં 6 યુવાનો ડૂબવા લાગ્યા હતા. જો કે સ્થાનિકોએ 4 યુવાનોને બચાવી લીધા હતા. જ્યારે એક યુવકની લાશને બહાર કાઢી હતી. જે બાદ વધુ એક યુવાનની લાશ બીજા દિવસે મળી આવી હતી.

સુરતના યુવાનો બારડોલી વાઘેચા નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જો કે નદીના પાણીનો પ્રવાહ અને ઊંડાઈનો ખ્યાલ આ યુવાનોને ન હતો. અને આ તમામ યુવાનો તાપી નદીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. જો કે સ્થાનિકોએ

આ દ્રશ્યો જોતાં જ તાબડતોડ મદદ માટે આગળ આવી ગયા હતા. અને સ્થાનિક તરવૈયાઓએ 6 યુવાનોમાંથી 4 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. પણ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં પ્રવિણને બચાવી શકાયો ન હતો. અને તેના મૃતદેહને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત પર્વત પાટિયા વિસ્તારમાં જ રહેતાં પિયુષ ગેહલોત પણ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. જેને કલાકોની શોધખોળ બાદ શોધી કઢાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સહિત ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ધીરુ ગજેરા છોડશે કોંગ્રેસનો સાથ, ભાજપમાં જોડાવવાની તૈયારી

સુરત : ગુજરાતમાં કોંગ્રેસ 2022ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી શરૂ કરે તે પહેલાં જ તેના નેતાઓ તેને અલવિદા કહેવા માંડ્યા છે. સુરતમાં પાટીદાર સમાજના મોટા અગ્રણી અને એક સમયના જનસંઘી ધીરુભાઈ ગજેરા કોંગ્રેસનો સાથ છોડી દેશે તેવું જાણવા મળ્યું છે. ધીરુભાઈ ગજેરા ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈ જાય તેવી હિલચાલ પણ ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપે અત્યાર સુધી રાજકીય નુકસાન વેઠવું પડ્યું છે. આંદોલનને કારણે સંગઠિત થયેલા પાટીદાર સમાજે 2015ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેમની તાકાતનો પરચો ભાજપને દેખાડ્યો હતો.

દેશમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી સુરત પહેલી મનપા બની

પહેલા દિવસે આર્ટ્સ, કોમર્સ, સાયન્સના 1565 વિદ્યાર્થીઓ ગેરહાજર

સુરત

સુરત મહાનગરપાલિકાએ આજે ધોરણ 11ના 24 વર્ગ શરૂ કરવા સાથે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી દેશની પહેલી મહાનગરપાલિકા બની ગઈ છે. મહાનગરપાલિકા સંચાલિત આ સ્કૂલના તમામ 24 વર્ગમાં 1562 વિદ્યાર્થીઓની પૂરેપૂરી હાજરી જોવા મળી હતી. સુરતના લોકોને પ્રાથમિક સુવિધા સાથે સાથે આરોગ્ય ઉપરાંત હવે શિક્ષણમાં પણ આગળ વધી રહી છે. આજે સુરત મહાનગર પાલિકાએ ધોરણ-11ના આર્ટ્સ કોમર્સ અને સાયન્સના 24

વર્ગો શરૂ કર્યા છે. સુરત મહાનગરપાલિકાના સેન્ટર ખાતે વચ્ચુંઅલ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મેયર હેમાલી બોધાવાલાએ કહ્યું હતું કે, વર્ષો પહેલા વાલીઓના વિદ્યાર્થીઓ આર્થિક સંકટામણને કારણે ધોરણ 10 થી આગળ અભ્યાસ કરી શકતા ન હતા. આવો વિદ્યાર્થીઓ માટે મહાનગરપાલિકાએ ધોરણ-11 અને 12ના વર્ગ શરૂ કર્યા છે. સ્થાયી અધ્યક્ષ પરેશ પટેલે કહ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુરતના વિદ્યાર્થીઓ માટે દિશા સૂચક બની રહેશે.

સૂર્યા મરાઠી હત્યા કેસ: આરોપી વીકી યાદવ અમદાવાદથી પકડાયો

સુરત : સુરતના કુખ્યાત સૂર્યા મરાઠીનું તેની જ ઓફિસમાં ઢીમ ઢાળી દેવાની ઘટનામાં અમદાવાદનો રીઢો ગુનેગાર અને ભૂતકાળમાં સુરતના નિલેશ ગજજરની હત્યામાં ઝડપાઈ ચૂકેલા વિકાસ ઉર્ફે વીકી ચંદ્રસિંહ યાદવને ATSએ અમદાવાદમાં તેના ગર નજીક દૂધેશ્વર રોડ ઉરથી ઝડપી લીધો હતો. સૂર્યા મરાઠીની હત્યા બાદ દોઢ વર્ષથી વીકી ભાગતો ફરતો હતો. ગત 12મી ફેબ્રુઆરી-20ની સવારે વેડરોડ પર આવેલી ઓફિસમાં સૂર્યા મરાઠી બેઠો હતો ત્યારે તેના સાગરીતો હાર્દિક પટેલે તેના જેલના સાથીદાર રાહુલ એપાર્ટમેન્ટ, વીકી યાદવ, સાહિલ સિંધી સહિતના સાત જેટલાં ટપોરીઓ સાથે મળી સૂર્યાની ગેમ બનાવી દીધી હતી.

THANK YOU FRONTLINE WORKERS



MORTGAGE DILIGENT
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

5 Yrs Fixed @ 1.84%* High Ratio Only
5 Yrs Variable @ 1.15%* High Ratio Only
3 Yrs Variable @ 0.99%* (Special Promotion)



Rakesh Patel**
Vice President- Commercial.



Pranay Jani *



Nilesh Tailor *



Bala Shah*



Vijay Rana*



Rajesh Khurana, MBA
Principal Broker

Cell : 416-616-1300

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.* FSCO#10252,OAC,E&O.E * - Mortgage Agent, ** - Vice President

* Some conditions apply

ચોટીલામાં બનશે નવી શાળા, કેનેડાની સંસ્થા ઉઠાવશે ખર્ચ

ચોટીલા
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામમાં સરકારે શાળા માટે ફાળવેલી જમીન પર જાણીતા હાસ્ય લેખક ડો. જગદીશ ત્રિવેદીએ શાળાની નવી બિલ્ડિંગનું બાંધકામ શરુ કરાવ્યું છે. શાળાના બાંધકામનો સંપૂર્ણ ખર્ચ કેનેડાની એક સેવાભાવી સંસ્થાએ આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એ માટે ડો. જગદીશ ત્રિવેદીનો તેમણે સંપર્ક પણ કર્યો છે. ગત 16 જુલાઈના રોજ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના હસ્તે શાળાના મકાનનું ભૂમિપૂજન કરાયું હતું. સર્વ શિક્ષા અભિયાનના સુરેન્દ્રનગર જિલ્લા પ્રોજેક્ટ ઈજનેર નિમાવત, અગ્રગણ્ય ઊદ્યોગપતિ અને પ્રજાપતિ સમાજનાં આગેવાન અમરશીભાઈ પ્રજાપતિ, ડો. કલ્પેશ ત્રિવેદી, ચોટીલાના બ્રહ્મ આગેવાન સંજયભાઈ રાજગોર અને નાવા શાળાનાં આચાર્ય તેમજ મોટી સંખ્યામાં વાદી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ શાળાનું ઉદઘાટન 12 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આગામી ઓક્ટોબર મહિના

સુધીમાં શાળાની કામગીરી પુરી કરવાનો લક્ષ્યાંક રખાયો છે. જ્યારે 12 ઓક્ટોબરના રોજ નવી શાળાનું ઉદઘાટન કરાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં વાદી-મદારી લોકોની વસ્તી વિશેષ પ્રમાણમાં છે. તેથી આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધે, વાદી મદારી જાતિના લોકો શિક્ષિત થઈને સમાજ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા ઉમદા આશયથી અહીં શાળા નિર્માણનું બીડુ હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ ઉપાડ્યું છે.
આ અંગે રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળા માટે જમીનની ફાળવણી કરાઈ છે. ડો. જગદીશ ત્રિવેદીએ શાળાના નિર્માણ માટે થનારા ખર્ચ અંગે કેનેડાની સેવાભાવી સંસ્થા IFA (Indian Family Association of Canada)ને રજૂઆત કરી હતી. જે બાદ તે સંસ્થાએ ચોટીલાના નાવા ગામમા શાળાના મકાન માટે થનારો ખર્ચ ઉપાડવા સહમતિ આપી હતી.

રાજકોટમાં લૂંટના આરોપીએ એસિડ પી મોત વ્હાલુ કર્યું

રાજકોટ
રાજકોટમાં એક આંગડિયા પેઢીના કર્મચારીએ મંગળવારના રોજ પોતાની સાથે રૂ.30 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની જાહેરાત કરી હતી. જોકે પોલીસની આકરી પૂછપરછમાં કર્મચારીએ જ પોતે લૂંટનું નાટક રચી પોતાના જ મિત્રને રૂપિયા આપી દીધા હોવાનું સામે આવ્યું હતું. પોલીસ જ્યારે આંગડિયા પેઢીની રોકડ રકમ આરોપીના મિત્ર પાસે લેવા ગઈ ત્યારે પોલીસને જોઈ જતાં ડરીને જેની પાસે રકમ હતી તે કેતન નામના શખ્સે એસિડ પી લીધું હતું. જોકે તેનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. સંજય ભીમાણી આંગડિયા પેઢીમાં કામ કરતો હતો તેના જ લાખો રૂપિયાની લૂંટનું નાટક રચી પેઢી સાથે વિશ્વાસઘાત કર્યો છે. તેવો આરોપ પર મૂકાયો હતો. જે બાદ તેની અટકાયત કરાઈ હતી.

રાજકોટ રાજવી પરિવારની સ્થાવર મિલ્કત મુદ્દે ભાઈ-બહેનમાં ટકરાવ

રાજકોટ
રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના અવસાન બાદ રાજવી પરિવારની કરોડો રૂપિયાની સૃષ્ટાવર મિલ્કત માટેનો આપસી ટકરાવ સપાટી પર આવ્યો છે. દોઢેક વર્ષ પહેલા જ રાજકોટના ઠાકોર તરીકે જેમની તાજપોશી થઈ તે માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજા અને તેમના બહેન અંબાલિકાદેવી વચ્ચે જમીન પર હકક મામલે ચાલતી અંટશ હવે તકરારી કેસ સ્વરૂપે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પહોંચી છે.
ઉત્તરપ્રદેશમાં પરણેલા અંબાલિકાદેવી પુસ્પેન્દ્રસિંહ રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાના પુત્રી છે. તેમણે અગાઉ રાજકોટ (પૂર્વ) મામલતદારની કોર્ટમાં ૩૧-૭-૨૦૨૦ ના રોજ પોતાના ભાઈ-બહેનો વિરુદ્ધ વાંધા અરજીઓ આપી હતી. રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નં. ૧૬૩ પૈકી ૩,૧ની ૧૪ હેક્ટર, સર્વે નં. ૧૬૩ પૈકી ૨ ની ૭૯૯૩ ચો.મી. અને સર્વે નં. ૧૨૯ પૈકી ૩ની

૧૨૧૪ ચો.મી. જમીનમાં ઈ:ધરા રેકોર્ડમાં હકપત્રક ફેરફારના સંદર્ભે ગામ નમુના નંબર ૬ની જે વારસાઈ નોંધો તા. ૩૦ જૂન ૨૦૨૦ ના રોજ ઓનલાઈન દાખલ થઈ હતી તેની ૧૩૫-ડી ની નોટિસને અનુલક્ષીને એ વાંધા અરજીઓ આપી હતી. પોતાના ભાઈ માંધાતાસિંહ, બહેન શાંતિદેવી મનોહરસિંહ જાડેજા, માતા માનકુમારીદેવી અને બીજા બહેન ઉમાકુમારી છત્રસાલસિંહ એ ચારે'ય વિરુદ્ધની વાંધા અરજી સંદર્ભે નોંધ તકરારી રજીસ્ટર લઈને કેસ ચલાવવામાં આવ્યો હતો. સ્વ. મનોહરસિંહ જાડેજાની જમીનના એગ્રિકલ્ચર લેન્ડ સીલિંગ એક્ટ અંગેના કેસોમાં યુનિટ નક્કી થયા તે તમામ સામે અમૂક વારસોએ અપીલ કરતાં સિટી પ્રાંત-૧માં કેસ ચાલુ છે, જ્યારે માધાપર વિસ્તારની જમીનનો આવો જ એક કેસ હવે પ્રાંત-૨ અધિકારી સમક્ષ શરૂ થયો છે. આજે આ કેસ બોર્ડ પર આવતાં એસડીએમ, સિટી-૨ પ્રાંત અધિકારીએ બંને પક્ષને સાંભળ્યાં હતા.

કચ્છી મહારાજ પ્રાગમલજીએ ખરીદી રૂપિયા એક કરોડની લક્ઝરીયસ કાર

ભુજ
ભારતમાં 4 થી અને ગુજરાતને કચ્છમાં પ્રથમ 1 કરોડની ઈલેક્ટ્રોનિક કારનું કચ્છી નવા વર્ષે આગમન કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાનો પર્યાવરણ પ્રેમ, પર્યાવરણની રક્ષા કાજે પેટ્રોલ-ડીઝલથી ચાલતી કારના બદલે 1 કરોડની ઈલેક્ટ્રીક કાર બનાવડાવી છે. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા જે ખૂબ પર્યાવરણ પ્રેમી હતા અને પર્યાવરણને જાળવી રાખવા તથા તેને બચાવવા માટે સતત



પ્રયત્નશીલ રહેતા. હાલના લઈને ખૂબ ચિંતિત હતા માટે આધુનિક યુગમાં ખૂબ પ્રદૂષણનો ફેલાવો થઈ રહ્યો છે. જેને કારણે બેન્ઝની કંપનીને ઈલેક્ટ્રોનિક કાર નો ઓર્ડર આપ્યો હતો. જે આજે કચ્છી નવા વર્ષના દિવસે ભુજના રણજીત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.

સ્થાનકવાસી જૈન સમાજના ગોંડલ સંપ્રદાયમાં તડાં : સમિતિનું વિસર્જન

રાજકોટ
સૌરાષ્ટ્રભરના સ્થાનકવાસી જૈન સંઘોમાં મુખ્ય એવા ગોંડલ સંપ્રદાયમાં અચાનક વિવાદ ઊભો થયો છે. સાધુ - સાધ્વીજીઓનાં વૈવાચ્ય સહિતની જવાબદારી નિભાવતી ગોંડલ, સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિનું રાતોરાત વિસર્જન કરી દેવામાં આવ્યું છે, અને સઘળી જવાબદારી હવેથી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘને પુન: સોંપી દેવામાં આવી છે. જૈન સમાજના જ એક વર્ગમાં એવી ચર્ચા વ્યાપી છે કે તાજેતરમાં શ્રી ધીરજમુનિ મહારાજ અને ત્રણ સાધ્વીજીઓએ કોલકાતાથી અમદાવાદ સુધીનો વિહાર હવાઈ માર્ગે કર્યો એ બાબત આ વિવાદનું મૂળ બની છે! જો કે, સંરક્ષક સમિતિ અને ગોંડલ સંઘ એ બંનેના

સૂત્રધારો આ વાતને ખોટી ગણાવતા ઉમેરે છે કે નાદુરસ્ત તબિયત અને કોરોનાકાળને અનુલક્ષીને પાંચ આગેવાનોની પૂર્વ મંજૂરીથી વિમાનપ્રવાસ થયો હતો તેમજ ચોક્કસ પરિસ્થિતિમાં એવી છૂટ હોય જ છે. વાસ્તવમાં, સાધુ અને શ્રાવક બંને સમિતિની કાર્યપ્રણાલિ સામે અસંતોષ જણાતા અને નિષ્ક્રીયતા માલૂમ પડતાં સંપ્રદાયના ૨૩૮ સાધુ-સાધ્વીજીઓમાંથી સૌરાષ્ટ્ર કેસરી ગુરૂપ્રાણ પરિવારના ૧૪૨ સાધુ - સાધ્વીજીઓએ ગત તા.૧૪મીએ બંને સમિતિનું વિસર્જન કરીને સંપ્રદાયની વ્યવસ્થા ગોંડલ સંઘને સોંપી છે. સંઘના સમર્થકોનું કહેવું છે કે, બહૂમતિથી થયેલા આ ઠરાવ મુજબ હવે વહિવટમાં સમિતિનું કોઈ અસ્તિત્વ રહેતું નથી.

Imperial

PEST CONTROL

Residential • Commercial • Industrial

24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

All Pest Control:
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

10% Off

on your first home service

*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820



મોડાસા નગર પાલિકાના AIMIMના ચાર કાઉન્સિલરે પક્ષ સાથે છેડો ફાડ્યો

36 સભ્યોના બોર્ડમાં 9 કાઉન્સિલરો સાથે પાર્ટી હવે વિરોધ પક્ષના સ્થાને

મોડાસા
મોડાસા નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં સૌપ્રથમવાર એઆઈએમઆઈએમના ૯ ઉમેદવારો કાઉન્સિલર પદે ચૂંટાઈ આવતાં પાલિકામાં મીમ પક્ષ સત્તાવાર વિરોધ પક્ષનું સ્થાન મેળવ્યું હતું. પરંતુ પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ આ એઆઈએમઆઈએમના ૪ મહિલા કોર્પોરેટરો એ પક્ષની નીતી રીતીથી વાઝ આવી પક્ષ સાથે છેડો ફાડવા રાજીનામા

ધર્યા હોવાની ચર્ચાઓ નગરમાં છવાઈ હતી. આ કથિત રાજીનામા પત્રને લઈ સ્થાનિક રાજકારણ ગરમાયું હતું. જોકે ૯ સભ્યો પૈકી એક સાથે ૪ સભ્યો પક્ષમાંથી છેડો ફાડે તેવી સ્થિતિમાં પક્ષાંતર ધારો લાગે કે કેમ? કાન્સિલર પદ સુરક્ષિત રહે કે કેમ? અને રહે તો આ કાઉન્સિલરો કોણે ટેકો આપે? કે પછી અલગ જૂથ બનાવશે? તેવી તરહ તરહની ચર્ચાઓ નગરમાં છવાઈ છે અને હવે આ પ્રકરણે કયો વળાંક આવે

છે તે ઉપર સૌની મીટ મંડાઈ છે. ત્યારે કોંગ્રેસને ફરી એકવાર વિરોધપક્ષના સ્થાને બેસવાની તક સાંપડી શકે? એ શક્યતાઓને લઈ કોંગ્રેસના અગ્રણીઓ મનમાંને મનમાં હરખાઈ ઉઠ્યા છે. ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે જવલંત વિજય પ્રાપ્ત કર્યો હતો. મોડાસા નગરપાલિકાની ૩૬ બેઠકો પૈકી ૧૯ બેઠકો કબ્જે કરી ભાજપએ પાલિકામાં સત્તાના સૂત્રો કબ્જે કર્યા હતા.

નડિયાદમાં વેપારીની પુત્રી બાદ હવે યુવાન પુત્ર પણ સંયમમાર્ગે

નડિયાદ

નડિયાદમાં એક વેપારીના ૨૭ વર્ષના યુવાન પુત્રને દિક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. આ વેપારીની યુવાન પુત્રીએ પણ ૧૦ વર્ષ અગાઉ દિક્ષા સ્વીકારી છે, ત્યારે માતાપિતાએ હવે એકના એક પુત્રને પણ ભારે હૈયે સંયમમાર્ગે આગળ વધવા વિદાય આપી છે. નડિયાદમાં છેલ્લે ૨૦૧૩માં એક શ્રેણીની પુત્રીએ દિક્ષા સ્વીકારી હતી. નડિયાદ શહેરમાં તેલનો વેપાર કરતા દિલીપભાઈ પ્રેમચંદભાઈ શાહ શહેરના કુંથારિયા ચકલા વિસ્તારમાં રહે છે. તેમની મોટી પુત્રી કિમાએ ૨૦૧૧માં દિક્ષા ગ્રહણ કરી છે. તે સંયમ માર્ગે આગળ વધીને

સાધ્વી કાર્ણવદશાશ્રીજી મ.સા બન્યાં છે. બહેનના પગલે જ આગળ વધીને હવે ભાઈ વિરાગ પણ ૧૮મી જુલાઈના રોજ દિક્ષા ગ્રહણ કરવાનો છે. બન્ને સંતાનોએ દિક્ષાનો નિર્ણય જાતે જ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું. દિલીપભાઈ અને તેમનાં પત્ની નિમિતાબહેનને સંતાનના નિર્ણયમાં જ પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. અગાઉ ૨૦૧૩માં નડિયાદના રત્નદીપ પરિવારની પુત્રીએ દિક્ષા ગ્રહણ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જૈન ધર્મમાં દિક્ષાને સર્વોપરી ગણવામાં આવે છે ત્યારે દિલીપભાઈ-નિમિતાબહેનને સંતાનોના નિર્ણયને વધાવી લીધો છે.

સિદ્ધપુરમાં 13 ભૂણ મળી આવતાં ચક્રચાર, પોલીસે શરૂ કરી તપાસ

સિદ્ધપુર

પાટણના સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામેથી સનસનીબેજ સમાચાર સામે આવી રહ્યા છે. તાવડીયા ગામે પાસેથી 13 જેટલાં ભૂણ મળી આવતાં ભારે ચક્રચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી આવ્યા હતા. તો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને આ ભૂણ કોણ ફેંકી ગયું તેની તપાસ શરૂ કરી છે. આજે સિદ્ધપુરના તાવડીયા ગામ પાસેથી સ્થાનિકોને પ્લાસ્ટિકની બોટલોમાં નવજાત શિશુઓનાં ભૂણ મળી આવ્યા હતા. ભૂણને જોતાં જ સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અને આ મામલે પોલીસને જાણ કરી હતી.

સ્વીટી પટેલ કેસમાં PI છેલ્લી ઘડીએ ફસડી પડ્યા, નાર્કો ટેસ્ટનો ઈન્કાર

વડોદરા

વડોદરા PIની પત્ની ગુમ થવાના મામલે આજે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્વીટી પટેલને લઈને 47 દિવસો વીતી ગયા હોવા છતાં પણ કોઈ અતોપત્તો લાગ્યો નથી. તેવામાં આજે સ્વીટીના પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરાવવાનો હતો. આ માટે અગાઉ પીઆઈ રબારીએ મંજૂરી પણ આપી દીધી હતી. પણ જેવા જ પીઆઈને FSLમાં લઈ જવામાં આવ્યા ત્યાં જ પીઆઈ ફસડી પડ્યા હતા. અને નાર્કો ટેસ્ટ માટે ના પાડી દીધી હતી. પીઆઈ



અજય દેસાઈની સ્વીટી પટેલ ગુમ થયાના 47 દિવસો વીતી ગયા છે. આટલાંટલાં દિવસો પસાર થઈ ગયા હોવા છતાં પણ પોલીસ આજ સુધી સ્વીટીને શોધી શકી નથી. તેવામાં આજે પીઆઈ અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો. નાર્કો ટેસ્ટ માટે FSLમાં તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. અજયે તરકટ રચીને ટેસ્ટ માટેની ના પાડી દીધી હતી. નાર્કો ટેસ્ટ પહેલાં કરવામાં આવતી મેડિકલ તપાસ પણ અજય દેસાઈએ કરાવી હતી. અંત ઘડીએ જ અજય દેસાઈએ નાર્કો ટેસ્ટની ના પાડતાં સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

રાજુલાના પરિવારે મા અંબાને 4 કિલો ચાંદીના ઘરેણાં અર્પણ કર્યા

અંબાજી

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરને એક માઈભક્ત દ્વારા ૪ કિલોથી વધુના ચાંદીના સાધનોની ભેટ ધરાવાઈ હતી. જેનો મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વીકાર કરી મંદિરની તિજોરીમાં જમા કરવામાં આવ્યું હતું. રાજુલાના એક માઈભક્ત પરિવાર દ્વારા માતાજીના ચરણોમાં ૪ કિલો ૧૮૦ ગ્રામ ચાંદીના કળશ, આરતી, ઘંટડી, ઝાંઝર, વીજુડી ભેટ ધરવામાં આવ્યા હતા. આ પરિવાર અવાર-નવાર જગત જનની માં અંબાના દર્શનાર્થે આવે છે. આજે આ પરિવાર દ્વારા સૌ પ્રથમ માતાજીની પૂજા-અર્ચના કરી માતાજીના ચરણોમાં આ આભૂષણો ભેટ ધરવામાં આવ્યા હતા. જેની અંદાજિત કિંમત ૨ લાખ ૮૪ હજારથી વધુ થવા જાય છે.

પ્રેમની સજા : છોટાઉદેપુર ખાતે યુગલને માર માર્યો, અરવલ્લીમાં યુવકનું મુંડન

છોટાઉદેપુર

ગુજરાતમાં હજુ થોડા દિવસ પહેલાં જ પ્રેમી સાથે ભાગેલી મહિલાના કપડાં ફાડી પાડીને ખભે બેસાડી ગામમાં ફેરવવાની ઘટનાની સ્વાહી સૂકાઈ નથી. તેવામાં વધુ ગુજરાતમાં વધુ બે તાલિબાની સજાના કિસ્સા સામે આવ્યા છે.



છોટા ઉદેપુરમાં પ્રેમી પંખીડાને તાલિબાની સજા આપી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. પ્રેમી પંખીડાને બેરહેમીપુર્વક ઝાડ સાથે બાંધીને તેમને ઢોર મારવામાં આવે છે. પ્રેમ પ્રકરણને કારણે આ બંને કપલ પર અત્યાચાર આચરવામાં આવ્યો હતો. આ મામલે વીડિયો વાઈરલ થયા બાદ નવ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યા છે. છેલ્લા એકાદ મહિનામાં જ આદિવાસી વિસ્તારોમાં તાલિબાની સજાના ૩-૪ કિસ્સા નોંધાઈ ચૂક્યા છે.

જ્યારે અન્ય જગ્યા અરવલ્લીમાં માલપુરના મેવડા ગામે એક યુવક પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. યુવકને સગીરા સાથે તેણીના પરિવારજનો જોઈ ગયા હતા. અને વીડિયોમાં પરિવારજનો આરોપ લગાવે છે કે શારીરિક સંબંધના ઈરાદે યુવક સગીરાને ફોસલાવીને ડુંગર વિસ્તારમાં લઈ ગયો હતો. અને યુવકને ઝડપી લીધા બાદ તેનું મુંડન કરે છે.

ગુજરાતમાં એકમાત્ર વડોદરાની શ્વેતાએ સ્કાય ડાઈવીંગ માટેનું લાઈસન્સ મેળવ્યું

વડોદરા

એડવેન્ચર અને યુવાનો એકબીજાના પર્યાયવાચી બની ગયા છે. આવા જ એક સાહસની કહાની વર્ષ ૨૦૧૮માં વડોદરાની ૨૮ વર્ષીય શ્વેતા પરમારે શરૂ કરી હતી. ૧૫ હજાર ફૂટ ઉપરથી નીચે કૂદવાના વિચારથી જ લોકોના પગ થરથર કાંપવા લાગે છે ત્યારે શ્વેતાએ ચાર વર્ષમાં એક-બેવાર નહીં પણ ૪૭ વખત જમ્પ કરીને યુનાઈટેડ સ્ટેટ્સ પેરાશૂટ અસોસિએશન તરફથી સ્કાય ડાઈવીંગનું લાઈસન્સ મેળવ્યું છે.

આમ તે આ લાઈસન્સ મેળવનાર ગુજરાતની પ્રથમ યુવતી બની છે. એમ.એસ.યુ.નિ.માંથી બીબીએ અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાનો બિઝનેસ ચલાવતી શ્વેતાએ કહ્યું કે જ્યારે મેં ગોવામાં પેરાસેલિંગ કર્યું ત્યારથી મને આકાશમાં સતત ઉડ્યા રહેવાની ઈચ્છા થઈ હતી તે માટે નાણાની વ્યવસ્થા થતા જ વર્ષ ૨૦૧૬માં મહેસાણામાં સ્કાય ડાઈવીંગનો એક કેમ્પ આવ્યો હતો તેમાં તાલીમ મેળવીને ફક્ત એક જમ્પ કર્યો હતો.

First Flight
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
---	---

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

<p>Brampton (West) 519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, Opposite Vegetables Market. Phone 647-761-1317, 647-657-9631 -----: MON-THU : ----- 2.00 PM to 6.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>Scarborough WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-TUE : ----- 2.00 PM to 6.00 PM : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>Mississauga 2960 Drew Road, Unit-158, Mississauga ON L4T 045 Great Punjab Plaza, Next to Malton Gurudwara. : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 5.00 PM</p>
--	---	--

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com



બિગ બોસમાંથી સલમાન ખાનનું પત્નું કપાશે ?

મુંબઈ : છેલ્લા થોડા સમયથી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સિયાલિટી શો બિગ બોસની ૧૫મી સીઝન વૂટ પર લોન્ચ થવાની ચર્ચા છે. સિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, જે સ્પર્ધકો આ શોમાં ભાગ લેવાના હશે એ લોકોને બિગ બોસના ઘરમાં જતા પહેલા ક્વોરન્ટાઇન કરવામાં આવશે. આ શોને હોસ્ટ કરવા માટે રોહિત શેહી અને ફરાહ ખાનનો સંપર્ક નિર્માતાએ કરવાથી લોકો સમજી રહ્યા છે કે, આ શોમાંથી સલમાન ખાનનું પત્નું કપાઈ જવાનું છે.



સ્પર્દેશ

અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં રાજ કુંદ્રાની ધરપકડ

મુંબઈ

મુંબઈની કાર્ટમ બ્રાંચે સોમવારે રાત્રે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેહીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ કુંદ્રા સામે અશ્લીલ સામગ્રી બનાવવા અને એપ પર પ્રકાશિત કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. રાજ કુંદ્રાને આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસનું કહેવું છે કે રાજ કુંદ્રા સામે તેમની પાસે પૂરતા પુરાવા છે. જણાવી દઈએ કે કાર્ટમ બ્રાંચે અગાઉ રાજ કુંદ્રાને સોમવારે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલીવાર નથી જ્યારે રાજ કુંદ્રા વિવાદોમાં છે, તે ભૂતકાળમાં પણ ઘણા વિવાદોને કારણે હેડલાઈન્સમાં રહ્યો છે.

રાજ કુંદ્રા હાલમાં જ તેની પૂર્વ પત્ની કવિતા વિશે કરવામાં આવેલા ઘટસ્ફોટ અંગે ચર્ચામાં રહ્યો હતો. રાજ કુંદ્રાએ જણાવ્યું હતું કે તેની પૂર્વ પત્ની કવિતાના તેના જીજા સાથે અફેર હતું. તેણે કહ્યું હતું કે, મારી માતાએ મારી ભૂતપૂર્વ પત્ની કવિતા અને મારી બહેનના પતિ વંશને ઘણીવાર વાંધાજનક સ્થિતિમાં રંગે હાથ ઝડપ્યા હતા.



શોર્ટ ફિલ્મો-વેબ સીરીઝમાં કામની લાલચે યુવતીઓ ફસાવાતી

અભિનેત્રી શિલ્પા શેહીના ઉદ્યોગપતિ પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ વધી છે, ફેબ્રુઆરી 2020માં અશ્લીલ ફિલ્મના સંબંધમાં માલવાનીમાં કેસ દાખલ થયાના ચાર મહિના પછી મુંબઈના બેઠવટ પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે ઉભરતી અભિનેત્રીઓને વેબ સિરીઝના સારા પ્રેક્ષકની લાલચ આપીને ઓડિશન માટે આમંત્રણ આપી આખું રેકેટ ચલાવવાતું હતું. રાજની ધરપકડ બાદ અભિનેત્રી અને મોડલ સાગરિકા સોના સુમનનો એક ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેણે ખુલાસો કર્યો છે કે તેને ઓડિશનના નામે અશ્લીલ ઓડિશનની ઓફર મળી હતી, પરંતુ તેણે આ ઓફરને નકારી હતી. આ સાથે જ અભિનેત્રી શર્લિન ચોપડા અને પૂનમ પાંડેએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. મિલિંદ ભારંબેએ જણાવ્યું કે કેટલાક લોકો આ રેકેટમાં ફસાયા છે તેમની કેટલીક યુવતીઓ પોલીસની કાર્ટમ બ્રાંચમાં આવી હતી, જ્યાંથી આ કેસ નોંધવામાં આવ્યો હતો.

શિલ્પાની કોઈ સક્રિય ભૂમિકા સામે આવી નથી : પોલીસ

સંયુક્ત પોલીસ કમિશનર મિલિંદ ભારંબેએ જણાવ્યું હતું કે હજુ સુધી કુંદ્રાની કંપનીમાં શિલ્પાની કોઈ સક્રિય ભૂમિકા સામે આવી નથી. જો કે અમે તેની તપાસ કરી રહ્યા છીએ. કુંદ્રાની ઓફિસમાંથી જે પુરાવા મળ્યા છે તેને આધારે હજુ કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ થઈ શકે છે. આ ઉપરાંત શિલ્પાને તેનું નિવેદન નોંધાવવા માટે ટૂંક સમયમાં બોલાવવામાં આવી શકે છે, તેમ કેટલાક સૂત્રોએ જણાવ્યું હતું.

70 પોર્ન વીડિયો મુંબઈ કાર્ટમ બ્રાંચને મળ્યા

મુંબઈ પોલીસે 21 જુલાઈની સાંજે રાજ કુંદ્રાની મુંબઈ સ્થિત વિચાન ઇન્ડસ્ટ્રી લિમિટેડની ઓફિસ તથા અન્ય જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ઓફિસમાંથી કેટલીક કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. કાર્ટમ બ્રાંચે ઉમેશ કામતે શૂટ કરેલા 70 વીડિયો રિકવર કર્યા છે. ઉમેશ કામતે વિવિધ પ્રોડક્શન હાઉસની મદદથી આ વીડિયો બનાવ્યા હતા.

એક લંડન સુધી ફેલાયેલ છે રાજ કુંદ્રાના તાર

રાજ કુંદ્રાની સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મ બનાવવા બદલ ધરપકડ કરી છે. પોર્ન ફિલ્મ બનાવવા ઉપરાંત રાજ કુંદ્રા પર એપ પર અપલોડ કરવાનો આરોપ છે. મુંબઈ પોલીસ રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરશે. પોલીસનો દાવો છે કે રાજ કુંદ્રાએ તેના એક સંબંધી સાથે મળીને યુકે સ્થિત એક કંપની બનાવી હતી અને તે કંપની જાતે જ ઘણા એજન્ટોને પોર્ન ફિલ્મો માટે કોન્ટ્રાક્ટ આપે છે.

20 હજારમાં બંગલો ભાડે રાખી ફિલ્મ શૂટ કરાતી

રાજ કુંદ્રાની ધરપકડ બાદ ઘણા મોટા રેકેટ બહાર આવ્યા છે. અહેવાલો અનુસાર કુંદ્રાને પકડતાં પહેલાં કાર્ટમ બ્રાંચની ટીમે પાંચ મહિના સુધી કુંદ્રા વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા હતા. મોટા બંગલાને એક દિવસના રંથી રૂપ હજારના ભાડા પર રખાતા હતા. અને તેના માલિક અને કર્મચારીઓને શૂટિંગ દરમિયાન બંગલામાં નહીં રહેવાની શરત મૂકાતી હતી.

હોટશોટ એપ દ્વારા પોર્ન વીડિયોનો બિઝનેસ થતો

કાર્ટમ બ્રાંચે પોર્ન કેસમાં જણાવ્યું કે, રાજ કુંદ્રા જ આ અપરાધનો કિંગપીન હતો. તે હોટશોટ એપ દ્વારા પોર્ન વીડિયોના બિઝનેસનું મેનેજમેન્ટ કરતો હતો. આ ઉપરાંત તેણે વોટ્સએપ ગ્રૂપ પણ બનાવ્યા હતા જેમાં તે બિઝનેસ ડીલ્સ કરતો હતો. થોડા સમય પહેલાં વેબ સિરીઝના નામે અશ્લીલ ફિલ્મો બનાવવાના રેકેટનો ઘટસ્ફોટ થયો હતો.



PayLessTravel
Fly Well ... Pay Less

વિમાની સેવાના બુકીંગ માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ

Call for all your Air Travel Services

- Lowest Prices for Ahmedabad, Vadodara, Mumbai, Delhi
- We will beat or match any online price with better service, call once before booking online
- Best Service
- We sell Travel Insurance

Call us for the Lowest Fares Coming From India to Canada Also

Please Call 905-281-2627

Address : 100 Matheson Blvd. East, Unit-203, Mississauga, ON. L4Z 2G7

Get Updated travel information during COVID time



Tico # 50015262
tico.ca
Travel Industry Council of Ontario

GUARANTEED ACCESS TO PRE-CONSTRUCTION CONDOS IN DOWNTOWN TORONTO & GTA CALL ME NOW!

BUY • SELL • INVEST



Nadir Shah
100% Professional, 0% Attitude Sales Representative
MBA, ACEA (UK)

416.625.3580
nadir.shah@sympatico.ca

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6
T: 416.291.0929 (24/7) F: 416.291.0984

CENTURY 21
Regal Realty Inc. Brokerage
Member Broker

Not intended to solicit buyers or sellers already under a contract.



॥ સંસ્કૃતિ ॥

હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

www.swadesh.news

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

info@swadesh.news

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



રિચર્ડ બ્રોન્સન અને જૈફ બેઝોસની સફળ અંતરિક્ષ યાત્રા બાદ હવે નવા જ ટૂરિઝમનો જન્મ

સ્પેસ ટૂરિઝમ : 5 વર્ષમાં 600 અબજના વેપારનો અંદાજ

દુનિયાના કટેલાક ધનવાનો અને ઉદ્યોગ સાહસિકોને સ્પેસની યાત્રા કરવાનું ઘેલુ લાગ્યું છે. અત્યાર સુધીમાં બે દીગ્ગજ ધનવાન રિચર્ડ અને જૈફ બેઝોસ પોતાની ટીમ સાથે અંતરિક્ષની સફર ખેડીને હેમખેમ પરત ફર્યા છે. આ સાથે જ આગામી દિવસોમાં હવે ટૂરિઝમ સાહસ અને સ્ટેટ્સ સિમ્બોલનો નવો પર્યાય બનશે તે નક્કી છે. વિશ્વના અનેક દેશોએ ટૂરિઝમના વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે. કારણ કે આ બાબત દેશની આર્થિક ગતિવિધિઓ સાથે સંકળાયેલી છે. એક દેશમાં પોતાના જ નાગરિકો પર્યટન સ્થળે આવે તે જરૂરી નથી હોતું. દેશ વિદેશના પર્યટકો પણ એકબીજા દેશમાં જતા હોય છે. જેને કારણે જે તે દેશના અર્થતંત્રને વર્ષે મોટું બળ મળે છે.

૨૧મી સદીના ત્રીજા દશકાની શરૂઆતમાં હવે નવા જ ટૂરિઝમનો જન્મ થયો છે, તેનું નામ છે સ્પેસ ટૂરિઝમ છે. આમ તો સ્પેસ ટૂરિઝમની શરૂઆત ૨૦૦૧માં થઈ હતી. જ્યારે રશિયન ઉદ્યોગપતિ ડેનિસ ટીટો સ્પેસમાં ગયા હતા. એ માટે તેમણે ૨ કરોડ ડોલરનો ખર્ચ કરીને સ્પેસ ટિકિટ ખરીદી હતી. ટીટો એવા પહેલા વ્યક્તિ હતા જે અવકાશયાત્રી-વિજ્ઞાની ન હોવા છતાં સ્પેસમાં જઈ શક્યા હતા. તેમની પાસે પૈસા હતા એટલે જઈ શક્યા. હવે બે દાયકામાં ટેકનોલોજીમાં અકલ્પનિય સુધારો થયો છે અને અદ્યતન ખર્ચો કરનારા લોકોની કમી નથી. એટલે સ્પેસમાં જવાની ટિકિટ બુકિંગ શરૂ થાય તો સંખ્યાબંધ લોકો નામ નોંધાવે તેમ છે. હાલમાં અમેરિકામાં રહેતા અને 50 લાખ ડોલર કરતાં વધારે સંપત્તિ ધરાવતા લોકો પૈકી 40 સ્પેસમાં જવા તૈયાર થયા છે.

આજથી 12 દિવસ પહેલાં રિચાર્ડ બ્રાન્સને અંતરિક્ષની યાત્રા કરીને ઈતિહાસ સર્જ્યો છે. આ પ્રકરણમાં હવે એમેઝોનના સંસ્થાક જૈફ બેઝોસ પણ ઉમેરાયા છે. આગામી દિવસોમાં એલન મસ્કનું નામ પણ તે યાદીમાં ઉમેરાશે.

રિચાર્ડ બ્રાન્સને અચાનક સફળ સ્પેસ ટૂર કરીને બેઝોસના સૌપ્રથમ સ્પેસ ટૂર કરવાના સપનાને રોળી નાંખ્યું હતું. જો કે, આમ છતાં બેઝોસ બીજા જ અઠવાડિયે પોતાની જ કંપની બ્લુ ઓરિજિનના સેફ્ટ સ્પેસ ક્રાફ્ટમાં અંતરિક્ષની સફર ખેડી ગત મંગળવારે હેમખેમ પરત ફર્યા હતા. ટૂરિઝમથી આપણે વાકેફ છીએ, પણ સ્પેસ વિશે લોકોની વિવિધ માન્યતાઓ છે. હકીકતે ૮૦-૧૦૦ કિલોમીટર ઊંચેનું વાતાવરણ અવકાશ ગણાય, તેની નીચેનું આકાશ કહેવાય. અવકાશ માટે અંગ્રેજી શબ્દ સ્પેસ છે. આમ તો એ પણ અવકાશ જ છે. પણ એને બાહ્યાવકાશ (આઉટર સ્પેસ)



કહેવાય. ધરતીથી ૧૦૦ કિલોમીટર ઊંચેની કાલ્પનિક સીમાને આકાશ-અવકાશ વચ્ચેની રેખા માનવામાં આવી છે. આકાશની સીમા સાવ ફિક્કસ નથી હોતી. બ્રાન્સન ૧૦૦ કિલોમીટર સુધી પહોંચ્યા ન હતા, ૮૬-૮૫ કિલોમીટર (૨૮૨,૭૭૩ ફીટ) સુધી જ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ગુરુત્વાકર્ષણની અસર એટલી ઓછી થઈ ગઈ હતી કે પ્રવાસીઓ હવામાં તરતા થઈ ગયા હતા. હવામાં તરતા થઈ જવાય એટલા ઊંચેનો પ્રવાસ સ્પેસ ટ્રાવેલ કહેવાય. ૧૧મી જુલાઈએ બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રાન્સને પોતાના જ રોકેટમાં સવાર થઈને સ્પેસ ટ્રાવેલ-અવકાશ પ્રવાસ કર્યો હતો. હવે આ બંને માંધાતાઓના સ્પેસ પ્રવાસને કારણે સ્પેસ ટૂરિઝમને વેગ મળવાની આશા છે. સ્પેસ ટૂરિઝમ એ આગામી યુગનો નવો બિઝનેસ હશે. તેમાં

પ્રાસંગિક
ધવલ શુક્લ

અબજ ડોલર (અંદાજે ૬૦૦ અબજ રૂપિયા)ને આંબવાની શક્યતા છે. મોટી કંપનીઓ તો જાણે ઓછી છે, પરંતુ સ્પેસ ટૂરિઝમને સપોર્ટ કરતી અનેક કંપનીઓ સક્રિય થઈ છે. થોડા સમય પહેલા એક સર્વે થયો હતો. જેમાં અમેરિકામાં જેમની પાસે ૫૦ લાખ ડોલર કરતાં વધારે સંપત્તિ છે એવા ૪૦ ટકા ધનપતિઓ સ્પેસમાં જવા તૈયાર હોવાનું નોંધાયું હતું. અમેરિકી અવકાશ સંશોધન સંસ્થા નાસાએ પણ ખાનગી કંપનીઓ રોકેટ વિકસાવે અને અવકાશમાં જતી થાય એ માટે પ્રોત્સાહન આપવાનું વલણ દાખવ્યું છે. હાલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં નાસાનો સામાન પહોંચાડવાનું કામ ઈલોન મસ્કની કંપની સ્પેસ-એક્સના રોકેટ કરી રહ્યા છે.

હવે આ બિઝનેસ શરૂ થવાની તૈયારીમાં છે. તેથી આ ટૂરિઝમના ધંધામાં ઝંપલાવવા મુખ્યત્વે 3

એક સમયે યુરોપ-અમેરિકાનો પ્રવાસ કરવો એ દુનિયાભરના ધનવાનો માટે સ્ટેટ્સ સિમ્બોલ ગણાતો હતો. પરંતુ હવે સ્પેસ ટૂરિઝમ આ સ્થાન મેળવી લેશે

સિક્કો જમાવવા માટે વિવિધ કંપનીઓ મેદાને પડી ચૂકી છે. આગામી પાંચ વર્ષમાં આ વેપાર ૬૦૦ અબજ રૂપિયાએ પહોંચવાનો છે.

માર્કેટ્સ એન્ડ માર્કેટ નામની વૈશ્વિક એજન્સીએ સ્પેસ ટૂરિઝમ અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલ પ્રમાણે પાંચ વર્ષ એટલે કે, ૨૦૨૬ સુધીમાં સ્પેસ ટૂરિઝમનો બિઝનેસ ૭.૭

હરિકો છે. જેમાં રિચાર્ડ બ્રાન્સન, જૈફ બેઝોસ તથા એલન મસ્કને ગણી શકાય તેમ છે. ઉદ્યોગપતિ બ્રોન્સન પોતાના સ્પેસ શિપમાં એક વખતમાં ૬ મુસાફર લઈ જવા માંગે છે અને દરેક માટે અંદાજે અઢી લાખ ડોલરની ટિકિટ રાખવાની ઈચ્છા છે. બ્રોન્સન ખરા વેપારી છે, કેમ કે ૨૦૧૮માં પ્રવાસે જશું એવું ૨૦૧૭માં કહ્યું હતું. એટલું જ નહીં

૨૦૧૭ સુધીમાં જ તેમણે અઢી લાખ ડોલરની એક એવી ૭૦૦ ટિકિટો વેચી પણ નાખી છે. જો કે, કોરોનાને કારણે તેમનું આયોજન પાછું ઠેલાયું છે. પણ ૨૦૨૨માં તો બ્રોન્સન પોતાની કંપની વર્જિન ગ્લેક્ટિક દ્વારા ૧૫૦ નાગરિકોને સ્પેસ પ્રવાસ કરાવવાનું લક્ષ્ય રાખે છે.

જ્યારે પ્રવાસ માટે ધરતીનો વિકલ્પ શોધતા જૈફ બેઝોસ પોતાની જેમ દુનિયાના અનેક નાગરિકોને સ્પેસમાં લઈ જવા માંગે છે. ૨૦ તારીખે તેની સાથે જનારા એક વ્યક્તિએ હરાજમાં ૨.૮ કરોડ ડોલર આપી સ્પેસ ટ્રાવેલની સિટ ખરીદી હતી. બેઝોસે બ્લુ ઓરિજિન નામે કંપની સ્થાપી છે જેમાં તૈયાર થયેલા રોકેટમાં જ સવાર થઈને પ્રવાસીને સ્પેસમાં મોકલી શકાય છે. ભવિષ્યમાં અવકાશયાત્રીઓ માટે તેઓ ૨ લાખ ડોલર સુધીની ટિકિટ વેચવાનું આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત એલન મસ્ક પણ સ્પેસ ટૂરિઝમના બિઝનેસમાં ઘણા આગળ વધી ચૂક્યા છે. તેમની સ્પેસ એક્સ કંપની છેક મંગળ પર જઈ શકાય એવું રોકેટ તૈયાર કરી રહી છે. મસ્કનું આયોજન નાના અવકાશ પ્રવાસનું નહીં પણ છેક મંગળ સુધી લઈ જવાનું છે. મંગળયાત્રાની શરૂઆત તેઓ ૨૦૨૪થી શરૂ કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. આ માટે એમની પાસે નક્કર આયોજનો છે અને અબજો ડોલર ખર્ચો રહ્યા છે.

ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈસરોની જગતમાં સારી એવી નામના છે. સમાનવ સ્પેસ ટ્રાવેલ ભારત માટે દુરની વાત છે. પરંતુ ભારત સરકારે સ્પેસ સેક્ટર ખાનગી કંપનીઓ માટે ખોલી નાખ્યું છે. એટલે કોઈ અદ્યતન નાણા ધરાવતી કંપનીને મન થાય તો બેઝોસ-મસ્કની માફક એ સ્પેસ ટૂરિઝમ કંપની શરૂ કરી શકે છે. જેમાં તે કંપની પરદેશી રોકેટ ભાડે લઈને ભારતીયોને પ્રવાસ કરાવી શકે છે. અત્યારે સ્પેસ ટૂરિઝમ લોકોને પરીકથા જેવી કલ્પના લાગતી હોય કે પછી કદાચ વાસ્તવિકતાથી દૂરની વાત લાગતી હોય. પણ હકીકત એ છે કે ૧૯૮૦માં રાઈટ બંધુઓએ પ્રથમ વિમાન ઉડાવ્યું ત્યારે લોકોને કલ્પના ન હતી કે હવાઈયાત્રાનો જમાનો આવશે. જગતભરના ધનવાનો માટે સ્પેસ ટૂરિઝમ સાહસનું નવું સરનામું બનશે એ નક્કી છે. અત્યારે જે સ્થિતિ છે એ જોતાં સ્પેસ ટૂરિઝમ સામાન્ય લોકો કરી શકશે નહીં, પરંતુ ધનવાનો વચ્ચે તેની સ્પર્ધા જામવાનું નક્કી છે. એક સમયે યુરોપ-અમેરિકાનો પ્રવાસ કરવો એ દુનિયાભરના ધનવાનો માટે સ્ટેટ્સ સિમ્બોલ ગણાતો હતો. પરંતુ હવે સ્પેસ ટૂરિઝમ આ સ્થાન મેળવી લેશે એવી શક્યતા છે.



SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES



CANADA IMMIGRATION

Specialized in :

Entrepreneur/Investor Business/
Self Employed/Farm Owner

- LMIA/WORK PERMIT
- EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- FEDERAL SKILLED WORKER/SKILLED TRADE
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS
- DETENTION REVIEWS
- CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL APPLICATIONS



AMI MEHTA
IMMIGRATION PRACTITIONER

**BUSINESS IMMIGRATION
TO CANADA REQUIRES
3 CR NET WORTH/
1.5 CR INVESTMENT/
BUSINESS OWNERSHIP/
MANAGEMENT EXP**

**REJECTED
CASES WELCOME**

**ONLINE IELTS
SPOKEN ENGLISH
CLASSES ON ZOOM**

**SUPER VISA INSURANCE / TRAVEL INSURANCE
/ PR 90 DAYS INSURANCE**

94- 499 MAIN STREET SOUTH, SHOPPERS
WORLD MALL, BRAMPTON, ONT

416-745-2466
905-230-7855

101-102 SIDDHARTH COMPLEX, BESIDES
EXPRESS HOTEL, ALKAPURI, VADODRA-390007

91-9428973911
91-9512157817

Email.: info@siis.ca

Website.: www.siis.ca



“ગુરુ એસા કીજીયે જૈસે પુનમકા ચંદ, તેજ તપે બાલે નહીં, ઉપજાવે આનંદ.”



પૂનમના ચંદ્રમાને નિહાળતા હૃદય આનંદિત થઈ જાય છે. પૂર્ણરૂપે ખીલેલા ચંદ્રમાની શીતળતા જીવનને સુખથી ભરી દે છે. તેવી જ રીતે ગુરુ સ્વ પ્રતિભાથી વિકસિત પૂનમના ચંદ્ર છે. જે શિષ્યના હૃદયને આત્મજ્ઞાનના પ્રકાશથી ઉજ્જવળ કરે છે.

આપણે અષાઠ સુદ પૂર્ણિમાને “ગુરુપૂર્ણિમા” કે “વ્યાસપૂર્ણિમા” તરીકે ઓળખીએ છીએ અને ગુરુપ્રત્યેનો સમર્પણ ભાવ વ્યક્ત કરીએ છીએ.

મહર્ષિ વેદવ્યાસજી “ભવિષ્યોત્તર પુરાણમાં કહે છે કે “અષાઠ શુક્લ પૂર્ણિમાને મારા જન્મદિવસ તરીકે ઉજવશો. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો” ગુરુ-શિષ્યનો સંબંધ “ પૂર્વજ અને વંશજ જેવો છે. આપણે આ સંબંધને ક્યારેય ભૂલી શકતા નથી.

સ્વામી રામકૃષ્ણ પરમહંસ કહે છે કે, “ કુલ ખીલે છે તેની તે જાહેરાત નથી કરતું, પણ તેની સુવાસથી જ ભમરાઓ આકર્ષિત થઈને જ આવે છે.

ગુરુ-શિષ્યના અતુટ સંબંધ વિશે કબીરજીએ કહ્યું હતું કે,

“ગુરુ કૂમહાર શિષ્ય કુંભ હૈ, ગઠી ગઠી કાઠે ખોટ,

અંતર બાંદ સહાર દે બાહર બાંદે ચોટ”...

જેમ કુંભાર માટીના ઘડાને સંપૂર્ણ આકાર આપવા માટે અંદરથી એક હાથનો ટેકો આપે છે અને બહારથી હળવી ટપલીઓ મારે છે તેવું જ ગુરુનું શિષ્ય પ્રત્યેનું વર્તન હોય છે.

ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી, ગુરુ વિના સુખ, સમૃદ્ધિ, અને ભવસાગર તરવો દુષ્કર છે.

રામચરિત માનસમાં બાલકાંડમાં તુલસીદાસજી કહે છે કે, “ગુરુ બિન ભવ નિધિ તરે ન કોઈ જો વિરંધિ શંકર સમ હોઈ” ગુરુ વિના ભવસાગરને કોઈ તરી શકતું નથી ભલેને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ જ કેમ ન હોય!..

પૂજ્ય પ્રમુખ સ્વામી ગુરુ વિશે કહેતા હતા કે, “ ઉપનિષદનો સાચો અર્થ એ છે કે ગુરુની પાસે બેસવું અને ગુરુના રાજીયા પ્રમાણે વર્તવું. આમ કરનારનો બેડો પાર થઈ જાય છે”. અંતમાં એટલું જ કહીશ કે,

“ગુરુ બિન જ્ઞાન ન ઉપજે,
ગુરુ બિન મિલે ન ભેદ,
ગુરુ બિન સંશય ના મીટે,
ભલે પઠ જાઓ ચારો વેદ”.

ગુરુની પ્રેમની વાણી.

(રાગ:- સુહાની ચાંદની રાતે.ફિલ્મ-મુક્તિ).

અમોને યાદ રહી જશે, ગુરુની પ્રેમ આશિષો
અમોને યાદ રહી જશે. પુરાણોમાં અમર બની ગયો
એકલવ્ય તો, ગુરુની મૂર્તિની પાસે તીરંદાજી ચલાવતો,
ગુરુ કાજે અંગૂઠાની કુરબાની યાદ રહી જશે..
ગુરુની પ્રેમની વાણી અમોને યાદ રહી જશે.
* કદીયે ના ભુલાયે જિંદગીમાં ગુરુ પૂર્ણિમા,
ભરીદો જ્ઞાનનો સાગર, અમારી ઊર્મિઓમાં, ગુરુની
લાગણીઓની સરિતા, યાદ રહી જશે..
ગુરુની પ્રેમની વાણી, અમોને યાદ રહી જશે.

ડો.જયેન્દ્ર નાયક. (એમ. એ,એમ.એડ, એમ.ફિલ.પીએચ.ડી.સંગીત વિશારદ, અમદાવાદ, મોબાઈલ: ૯૪૨૭૭ ૦૪૯૯૪)

કોન્ફિડન્સ સાથે જાતે મેકઅપ કરી મેળવો એકમદ આકર્ષક લુક

મેકઅપ કરવો કોને ન ગમે? પરંતુ મેકઅપ કરવાથી સુંદર લાગવાને બદલે બહુરૂપી જેવા લાગીશું તો? એવો ડર ઘણી મહિલાઓને લાગતો હોય છે. પરિણામે તે મેકઅપ કરવાનું ટાળે છે અને બિંદી, કાજલ તથા લિપસ્ટિકથી જ કામ ચલાવી લે છે. મેકઅપથી હવે ગભરાવાની જરૂર નથી. તમે સરળ સ્ટેપને અપનાવીને લાઈટ મેકઅપ જાતે જ સરળતાથી કરી શકશો.



સ્ટેપ-૧

મેકઅપ કરતાં પહેલાં ચહેરાને ફેસવોશથી અથવા ક્લીન્સરથી સારી રીતે સાફ કરી લો. એ પછી કોઈ સારી ક્યોલિટીનું ટોનર લગાવો. જો ટોનરનો ઉપયોગ ન કરતાં હોવ તો મોઈરાઈઝર જરૂર લગાવો.

સ્ટેપ-૨

મોઈરાઈઝર લગાવ્યા બાદ ચહેરાની ત્વચાને મેળ ખાતું ફાઉન્ડેશન લગાવવાનું છે. ફાઉન્ડેશનને હથેળીમાં લઈ આંગળીનાં ટેરવાં વડે ચહેરા ઉપર ટપકાં કરો. એ પછી હાથથી તેને સ્પ્રેડ કરી દો. હવે સ્પંજની મદદથી ચહેરા પર સેટ કરો. ફાઉન્ડેશન લગાવ્યા પછી ચહેરા પર કન્સીલર લગાવો. એનાથી ચહેરાનો રંગ એકસમાન લાગશે અને ડાઘ-ધબ્બા છુપાઈ જશે. ફાઉન્ડેશન અને કન્સીલર તમારી સ્કિન ટોનને એકદમ મળતો આવવો જરૂરી છે.

સ્ટેપ-૩

ફાઉન્ડેશન પછી કાજલ અને આઈલાઈનર લગાવો. જો તમે પહેલી વખત મેકઅપ કરી રહ્યાં હોવ તો લિક્વિડને બદલે પેન્સિલ આઈલાઈનરનો ઉપયોગ કરો. પેન્સિલ આઈલાઈનર લગાવવામાં સરળ રહેશે. પેન્સિલ આઈલાઈનરમાં અત્યારે અનેક શેડ્સ ઉપલબ્ધ છે. તમારા ડ્રેસને મેળ ખાતી આઈલાઈનર પણ તમે લગાવી શકો છો. એવું ન કરવું હોય તો બ્લેકને બદલે બ્રાઉન લાઈનર લગાવો એ વધુ સુંદર લાગશે. લાઈનર લગાવ્યા બાદ તમે ઈચ્છો તો મસ્કરા લગાવી શકો. મસ્કરા લગાવવાથી તમારી આંખોનો લુક બદલાઈ જશે.

સ્ટેપ-૪

મેકઅપ કરતી વખતે ગાલને નજરઅંદાજ ન કરવા જોઈએ. ગાલ પર બ્લશર લગાવવાથી મેકઅપનો ગ્લો આવે છે. તમારી સ્કિન ફેર હોય તો પિંક કલરના બ્લશરનો ઉપયોગ કરો. જો સ્કિન શ્યામ હોય તો બ્રાઉન બ્લશરનો ઉપયોગ કરો. બ્લશર હંમેશાં બ્રશની મદદથી જ કરો. તેને ગાલ ઉપર ગોળાકાર ફેરવો.

સ્ટેપ-૫

મેકઅપમાં લિપસ્ટિક બહુ મહત્વની છે. હોઈ ઉપર લિપસ્ટિક લગાવતાં જ ચહેરો ખીલી ઊઠે છે. જો તમે પહેલી વખત મેકઅપ કરી રહ્યાં હોવ તો લાઈટ શેડ લિપસ્ટિક અથવા ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કરી શકો. લિપસ્ટિક જો બ્રશથી લગાવવામાં આવે તો લાંબા સમય સુધી ટકશે અને લુક પણ સુંદર લાગશે.

ક્રીપ્ટો કરન્સી શું છે?



ક્રીપ્ટો કરન્સીને આપને બીટ કોઈનના નામે ઓળખીએ છે. જે ૧૨ વર્ષ પહેલાં એટલે કે જાન્યુઆરી ૨૦૦૯ના રોજ સાતોશી નામાંમોતો દ્વારા રજૂ થયો હતો. ક્રીપ્ટો કરન્સી એક રીતે ડિજિટલ કરન્સી છે. કારણકે આ કરન્સી આજ સુધી કોઈ પણ વ્યક્તિએ હાથમાં પકડી નથી એટલે તેને વર્ચુઅલ કરન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્રીપ્ટો કરન્સીનો ઈતિહાસકાર ડેવિડ ચોમ છે જે એક ક્રીપ્ટોગ્રાફર છે. આ રીતે ઘણાં ક્રીપ્ટોગ્રાફર છે જે અલગ-અલગ ક્રીપ્ટો કરન્સી રજૂ કરે છે. બીટ કોઈન બાદ ઈથેરીયમ, તેથર, બીનાન્સ કોઈન, કારડાનો, XRP, ડોગકોઈન, USD કોઈન, પોલકાડોટ અને યુનિસ્વેપ જેવી ક્રીપ્ટો કરન્સી પ્રચલિત થઈ છે. ક્રીપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટમેન્ટ એક રીતે શેર માર્કેટ જેવું જ છે. જેમાં ઈન્વેસ્ટ કરવા માટે ઘણી એપ્લિકેશન ઉપલબ્ધ છે. જેમાં તમે રૂપિયાના બદલામાં ક્રીપ્ટો કરન્સીમાં ઈન્વેસ્ટ કરી શકો છો.

ડોગકોઈન બાદ હવે બેબી ડોગ કોઈન રજૂ થવા જઈ રહ્યો છે. જે ડોગકોઈન ના બાળક તરીકે ઓળખાશે.

જેનો ખુલાશો એલોન મસ્ક એ કર્યો છે. જેના વિષે માત્ર ટવીટ કરતા જ આ કોઈનની વેલ્યુ બે ગણી થઈ ગઈ હતી. જ્યારે લોકોને એક બાજુ ક્રીપ્ટો કરન્સી પર વિશ્વાસ કરવો ખુબ મુશ્કેલ છે. કારણકે ઘણી ગવર્નમેન્ટએ ક્રીપ્ટો કરન્સીને પોતાના દેશમાં બેન/પ્રતિબંધિત કરી છે. અને બીજી બાજુ એલોન મસ્કના ટવીટ પર વિશ્વાસ કરીને ઘણા લોકો બીટ કોઈન અને ડોગકોઈનમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે. જ્યારે તે ખુદ ટેસ્લા કાર ના બદલામાં ક્રીપ્ટો કરન્સીનું પેમેન્ટ સ્વીકારવાનું ઈનકાર કરી ચુક્યા છે. એલોન મસ્કના ટવીટ થી ઘણીવાર ક્રીપ્ટો કરન્સીની વેલ્યુમાં ઘણો ફરક જણાયો છે. જે એક સમયે વધ્યો પણ છે અને મોટો ઘટાડો પણ નોંધાયો છે.

હાલમાં ક્રીપ્ટો કરન્સીની ઘણી એપ્લિકેશન પ્રોમોશન ઓફર આપી લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરવું કે ન કરવું એ તમારા હાથમાં છે. જેથી તમારે બહુ સમજદારીથી નિર્ણય લેવો જરૂરી બને છે.

@beinghumanmj



DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Gratitude Program

Every Thursday 9 PM

Join-today-on-ZOOM!

: Classes Available :

One to One Individual and Therapeutic



Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta

અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારી વિરુદ્ધ રાજ્યના બિલ્ડરો-રાજકારણીઓને ધમકીના ૧૪ ગુના

અમુલના એમ.ડી, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા તથા બિલ્ડરોને ફોન પર ધમકી આપી હતી

અમદાવાદ: બેંગ્લોરથી ટ્રાન્સફર વોરન્ટને આધારે અમદાવાદ લવાયેલા ગેંગસ્ટર રવિ પૂજારી વિરુદ્ધ કાર્મ બ્રાંચમાં ૧૦ તથા પાલડી, આણંદ અને ગાંધીનગરમાં ચાર મળીને કુલ ૧૪ ગુના નોંધાયેલા છે. જેમાં જુદા જુદા બિલ્ડરોને ખંડણી માટે ધમકીભર્યા ફોન કર્યા હતા. તે સિવાય રાજકારણીઓને પણ તેણે ફોન કરીને ધમકી આપી હતી. રવિ પૂજારી સામે બિલ્ડરો અને હોટેલ માલિકો પાસે કરોડોની ખંડમી માંગવાના તથા રાજકારણીઓને ધમકી આપવાના કુલ ૧૪ ગુના નોંધાયેલા છે.

પૂજારીને બોરસદની કોર્ટે આપ્યા રિમાન્ડ

આણંદ : કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીની કાર્મ બ્રાન્ચે બેંગ્લોરથી અટકાયત કર્યા બાદ અમદાવાદ ખાતે લવાયો હતો. જ્યાં ગેંગસ્ટર રવિ પૂજારી સહિતના સાગરીતોએ વર્ષ 2017માં બોરસદના અપક્ષ કાઉન્સિલર ઉપર ફાયરિંગ કર્યું હોઈ સોમવાર રાત્રિના સુમારે તેને બોરસદ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં વોરન્ટની કાર્યવાહી પૂર્ણ કરી રાત્રિના સુમારે અમદાવાદ પરત લઈ જવાયો હતો. બાદમાં આજે રીમાન્ડની માંગણી માટે સાંજના સુમારે તેને પુનઃ બોરસદની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી સહિતને અમદાવાદ કાર્મ બ્રાન્ચે ઝડપી પાડયો છે. તેના વિરુદ્ધ ગુજરાતભરમાં 30 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

ખેતી બેન્કની ચંટણીમાં ભાજપના બે નેતા આમનેસામને આવી ગયા

ધીરેન ચૌધરીના કૌભાંડ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ

અમદાવાદ : સાતમી અને આઠમી ઓગસ્ટે થનારી ખેતી બેન્કની ચંટણીમાં ભાજપના જ બે નેતાઓ આમનેસામને આવી ગયા છે. તેમાં કસ્ટોડિયન નિમાયા તે પૂર્વ ચેરમેન તરીકે સેવા આપનાર ધીરેન ચૌધરી અને સહકારી ક્ષેત્ર સાથે લાંબા ગાળાથી સંકળાયેલા રામજીભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. આમ સહકારી ક્ષેત્રની અગ્રણી બેન્કના ટોચનો હોદ્દો મેળવવા માટે ભાજપના જ ઉમેદવારો આમનેસામને આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચૂંટણીના આ સંગ્રામમાં પૂર્વ પ્રમુખ

ધીરેન ચૌધરીએ જ્ઞાતિવાદ આચરીને મોટું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરવામાં આવી છે. મુખ્યમંત્રીને કરવામાં આવેલી લેખિત ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે ધીરે ચૌધરીએ મોટી સંખ્યામાં ભરતી કરવામાં જ્ઞાતિવાદ આચર્યો છે. બેન્કને નુકસાન થાય તે રીતે મનસ્વી ભરતીઓ કરી છે. ભરતીમાં પસંદગી પામેલા સભ્યો પાસેથી નાણાં લઈને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. ધીરેન ચૌધરી બોર્ડમાં સ્થાન ધરાવતા કોન્ગ્રેસના સભ્યોને પણ ભરતીમાં ચોક્કસ જગ્યાઓ ફાળવી આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

કસ્ટમ્સ વિભાગ 100 કિલોથી વધુ સોનાને હવે વેચવા કાઢશે

અમદાવાદ: દાણચોરીથી પકડાયેલા ૧૦૦ કિલોથી વધુ સોનું વેચવા કસ્ટમ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. કસ્ટમ વિભાગ દ્વારા આશરે ૩૦ જેટલા કેસોમાં ૧૦૦ કિલોથી વધુ સોનાનો જથ્થો કબજે કર્યો હતો. આ સોનાનો જથ્થાની કિંમત આશરે ૫૦ કરોડથી વધુની કિંમતનો થાય છે. જેમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી દોઢ વર્ષ પહેલાં રૂ. ૧,૩૦૦ કરોડનું આશરે ચાર હજાર કિલોગ્રામ જેટલું સોનું અત્યંત સિફતપૂર્વક શહેરમાં ઘુસાડવાના કેસના પકડાયેલા આરોપીઓ દ્વારા ૧૩૦૦ કરોડનું સોનું ઘુસાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.

ગુજરાતમાં હજુ ૨૫% વરસાદ : ગત વર્ષની સરખામણીએ ૧૨% ઓછો

અમદાવાદ: ગુજરાતમાં આગામી ૨૩ જુલાઈથી સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ સુધી ચોમાસાની શરૂઆત સાધારણ રહી છે. ગત વર્ષે ૨૦ જુલાઈ સુધી ગુજરાતમાં ૧૧.૮૦ ઈંચ સાથે મોસમનો ૩૬.૦૮% વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ આ વર્ષે હજુ સુધી ૮.૧૪ ઈંચ સાથે મોસમનો ૨૪.૬૪% વરસાદ નોંધાયો છે. આમ, ગત વર્ષની સરખામણીએ હજુ ૧૧.૪૪% ઓછો વરસાદ છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૂરૂપની બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જેમાં રાહત કમિશનરે જણાવ્યું કે, 'રાજ્યમાં ૨૦ જુલાઈ સુધી અંદાજે ૨૦૬.૮૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જે છેલ્લા ૩૦ વર્ષના રાજ્યની સરેરાશ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૨૪.૬૪% છે. ' બીજી તરફ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 'ગત સપ્તાહે રાજ્યમાં સારો વરસાદ થયો છે. ૨૩ જુલાઈથી સમગ્ર રાજ્યમાં

સારા વરસાદની સંભાવના છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. ' હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી ૨૧થી ૨૪ જુલાઈ સુરત-ડાંગ-નવસારી-વલસાડ, ૨૫ જુલાઈએ બનાસકાંઠા-પાટણ-સાબરકાંઠા-વડોદરા-ભરૂચ-સુરત-ડાંગ-તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જૂન માસ દરમિયાન ૪.૭૩ ઈંચ જ્યારે જુલાઈના ૨૦ દિવસમાં ૩.૪૦ ઈંચ વરસાદ નોંધાયેલો છે. રાજ્યમાં સહેજપણ વરસાદ નોંધાયો ન હોય તેવો એકપણ તાલુકો નથી.

નર્સ બનવા US ગયેલી ગુજરાતની દીકરી આર્મીમાં બજાવી રહી છે ફરજ

અમદાવાદ : USAની આર્મીમાં મૂળ ગુજરાતી યુવતી લક્ષ્મી ચૌહાણ ફરજ બજાવતી થઈ ગઈ છે. આ યુવતીને ખૂબ જ નાની ઉંમરે USAની આર્મીમાં જોડાવવાનું સૌભાગ્ય મળ્યું છે. અમદાવાદમાં ધોરણ 12 સાયન્સમાં પાસ થઈને લક્ષ્મીતાએ નર્સિંગનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું, જો કે, આ માટે તે દેશમાં નહીં પરંતુ વિદેશ જવા ઈચ્છતી હતી. આજ કારણે તે અમદાવાદથી USA ગઈ હતી. આ સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. જે બાદ તેણીએ મેડીકલનો અભ્યાસ

શરૂ કર્યો હતો. આ દરમિયાન એટલે કે 2017માં તેને યુએસએનું ગ્રીન કાર્ડ મળી ગયું હતું. ભારતથી અમેરિકા પહોંચ્યા બાદ પણ લક્ષ્મીતાએ ક્યારે USAની આર્મીમાં જવાનું વિચાર્યું ન હતું. પરંતુ વર્ષ 2017માં લક્ષ્મીતાએ ગ્રીન કાર્ડ મળ્યા બાદ તેને USA આર્મીમાં જવાની તક મળી અને તે તેણી ઝડપી લીધી હતી. લક્ષ્મીતાએ USA આર્મીમાં જોડાવવા માટે એક અરજી અરજી કર્યા પછી પરીક્ષા પાસ કરી હતી.



ગુજરાતમાં ત્રણ કરોડથી વધુ લોકોનું રસીકરણ થયું

અમદાવાદ: ગુજરાતમાં ૨૪ જૂન બાદ પ્રથમવાર એક જ દિવસમાં ૪ લાખથી વધુ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક હવે ૩.૦૧ કરોડને પાર થઈ ગયો છે. ઉત્તર પ્રદેશમાંથી ૪.૧૫ કરોડ, મહારાષ્ટ્રમાંથી ૪.૦૧ કરોડ લોકો કોરોના વેક્સિન લઈ ચૂક્યા છે. ગુજરાતમાંથી ૨.૩૧ કરોડ લોકો કોરોના વેક્સિનનો એક ડોઝ જ્યારે ૭૦.૧૮ લાખ લોકો બંને ડોઝ લઈ ચૂક્યા છે. આ સ્થિતિએ રાજ્યમાં કૂલ્લી વેક્સિનેટેડ ૧૪% લોકો છે.

સંક્ષિપ્ત સમાચાર

વાઈબ્રન્ટ ગુજરાત પહેલા ઉદ્યોગપતિઓ સાથે બેઠક

અમદાવાદ : કોરોનાના કારણે પાટનગર ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત પર ગ્રહણ લાગ્યું હતું. આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત યોજાય તેવા ઉજ્જવળ સંજોગો છે જેના કારણે રાજ્ય ઉદ્યોગ વિભાગમાં અત્યારથી ધમધમાટ શરૂ થયો છે. ઉદ્યોગ વિભાગના સનદી અધિકારીઓએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ ઉપરાંત વેપારી મહામંડળો સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. આ વખતે વાઈબ્રન્ટ ગુજરાતમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મુખ્ય હેતુ રહેશે. ગુજરાતમાં કોરોનાની ગતિ લગભગ મંદ પડી છે. આ જોતાં વાઈબ્રન્ટ ગુજરાત બાન્યુઆરી-22માં નિયત સમયે યોજાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જેના કારણે અત્યારથી ગુજરાત સરકારમાં વાઈબ્રન્ટ ગુજરાતનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, સૂત્રોના મતે, ગુજરાતમાં મૂડીરોકાણ માટે કયા કયા દેશને આમંત્રિત કરવા એ મુદ્દે પણ આયોજન થઈ રહ્યું છે. સાથે સાથે કયા સનદી અધિકારીને કયા દેશમાં મોકલવા તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે.

અમદાવાદથી 20થી વધુ ફ્લાઈટનો પ્રારંભ

અમદાવાદ: છેલ્લા એક મહિનામાં જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિવિધ એરલાઇન્સ દ્વારા ૨૦થી વધુ ફ્લાઈટ શરૂ કરાઈ છે. કોરોનાના કેસમાં વધારો થતાં એપ્રિલ મહિનાથી મુસાફરોની સંખ્યામાં સતત ઘટાડો થવા લાગ્યો હતો અને જેના પગલે મોટાભાગની ફ્લાઈટ તેની ક્ષમતા કરતાં ૬૦% ખાલી જઈ રહી હતી. આ સ્થિતિને લીધે મોટાભાગની એરલાઇન્સે તેમના અનેક સેક્ટરની ફ્લાઈટને બંધ કરી દીધી હતી. પરંતુ છેલ્લા એક મહિનાથી મુસાફરોની સંખ્યામાં વધારો થતાં એરલાઇન્સ દ્વારા અગાઉ બંધ કરાયેલી ફ્લાઈટ ફરી શરૂ કરાઈ છે. અમદાવાદથી જે નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે તેમાં ઉદ્દેપુર, જયપુર, પૂણે, લેહ, ધર્મશાલા, શ્રીનગર, જમ્મુ,કાનપુર, ગ્વાલિયર, કોચી, જોધપુરનો સમાવેશ થાય છે.

ઓનલાઇન ઠગાઈ કરતી આફ્રિકન ગેંગ

વડોદરા: વડોદરાના વેપારી સાથે ઓનલાઇન રૂ.૧૯ લાખની ઠગાઈ કરવાના ગુનામાં પકડાયેલી આફ્રિકન ઠગ ટોળકીના પાંચ સાગરીતોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. ટોળકીએ ગુજરાતમાં ૧૫ થી વધુ લોકોને શિકાર બનાવ્યા હોવાની વિગતો ખૂલી છે. લક્ષ્મીપુરાના વેપારીને સીપીયુનો સ્કેપ સસ્ત્રામાં આપવાની ઓનલાઇન ઓફર કરી રૂ.૧૯ લાખ ટ્રાન્સફર કરાવી લેનાર આફ્રિકન ઠગ ટોળકી પાંચ વર્ષથી દિલ્લીમાં હોવાની અને ભાડાના ફેલેટમાં રહેતી હોવાની વિગતોના આધારે સાયબર સેલની ટીમે પાંચ સાગરીતોને ઝડપી પાડ્યા હતા. જેમાં બેન્ગામિન કૌકો નદરી તેમજ તેના ચાર સાગરીતો કમ્પુ ઇમ્પ્રુવિન,કિટ્ટી જેક્સ દેવલુઇસ, માર્ટિન કોપેટ,ઇલ હાઇજી મહેમન ટૌફેનનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં એકવેરિયમ અને રોબોટિક ગેલરી

અમદાવાદના સાયન્સસિટી ખાતે 260 કરોડના ખર્ચે નિર્માણ પામેલી એકવેરિયમ ગેલરી અને 127 કરોડના ખર્ચે બનેલી રોબોટિક ગેલરીનું મોદી દ્વારા વરચુઅલ લોકાર્પણ કરાયું હતું. સાયન્સસિટી ખાતે 127 કરોડ રૂપિયાના ખર્ચે 11,512 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલરી બનાવાઈ છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. પ્રવેશદ્વાર પર વિશાળ ટ્રાન્સફોર્મરથી રોબોટની પ્રતિફિત મુકવામાં આવી છે. જ્યારે મુલાકાતીઓ રિસેપ્શન પર પહોંચે તો ત્યાં પણ ખાસ રોબોટ મુકાયા છે. અહીં એક રેસ્ટોરન્ટ પણ તૈયાર કરાયું છે. જેમાં બધા ઓર્ડર રોબોટ જ લેશે અને રોબોટ દ્વારા જ ફૂડ સર્વ કરવાનું આયોજન છે. રોબોટ ગેલરીની મુલાકાત દરમિયાન મુલાકાતીઓ સાથે રોબોટ જ વાતચીત કરશે. સાયન્સસિટીમાં બનાવેલા એકવેરિયમ ગેલરીમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓની માછલી મુકવામાં આવી છે.

વિઠ્ઠલનાથજીનો વરઘોડો મંદિર પરિસરમાં જ ફર્યો

વડોદરા: વડોદરામાં છેલ્લા 212 વર્ષથી યોજાતો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો કોરોના મહામારીના પગલે આ વર્ષે પણ યોજાયો ન હતો. અને માત્ર મંદિર પરિસરમાં રથયાત્રા યોજી હતી વડોદરાના માંડવી રોડ સ્થિત ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો યોજાય છે જેમાં ભગવાન ખાસ ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગર યાત્રાએ નીકળતા હતા પરંતુ ચાલુ વર્ષે પણ આ યાત્રા યોજાઈ નથી. આજે મંદિરમાં ગણતરીમાં ભક્તોની હાજરી વચ્ચે ભગવાન વિઠ્ઠલનાથજી રથમાં બીરાજમાન થયા હતા જ્યાં રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા ખાસ પૂજા અને આરતી કરવામાં આવી હતી અને મંદિર પરિસરમાં રથને પ્રસ્થાન કરાવ્યો હતો. દર વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજી દેવ પોઠી એકાદશીના દિવસે માંડવી રોડ મંદિર ખાતેથી રથમાં બિરાજમાન થાય છે.

વડોદરાની વિદ્યાર્થીનીની વિમેન્સ એશિયન ચેમ્પિયનશિપના રાષ્ટ્રીય કેમ્પમાં પસંદગી

વડોદરા: શહેરની ખાનગી સ્કૂલમાં ધો.૧૦માં ભણતી ખુશી શાહ અને ધો.૧૧માં ભણતી અવિશી પ્રસાદની પસંદગી જોડનમાં રમાનારી અંડર ૧૬ વિમેન્સ એશિયન ચેમ્પિયનશિપના રાષ્ટ્રીય કેમ્પમાં પસંદગી થઈ છે. આ બંને વિદ્યાર્થીનીઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની રાજ્યકક્ષાની બિન-નિવાસી બાસ્કેટબોલ એકેડમીમાં બાસ્કેટબોલની તાલીમ લઈ રહી છે. તેમના કોચે કહ્યું કે બંને ખેલાડીઓ ખૂબ ચપલ અને મહેનતુ છે આ અગાઉ પણ તેઓએ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપેલ છે. આ બંનેનું તા.૪થી ૧૧ ઓક્ટોબર દરમિયાન રમાનાર એશિયન ચેમ્પિયનશિપના રાષ્ટ્રીય ઈન્ડિયા કેમ્પમાં પસંદગી થઈ છે.



બંદૂકની ગોળીઓ પર કોઈનાં નામ-સરનામાં હોતાં નથી!

૧ મે ૧૯૬૦ ગુજરાત તા.રાજ્યનો સ્થાપના દિન છે. ગુજરાત આજે સમૃદ્ધ છે. સુખી છે. મોડલ સ્ટેટ છે. ગુજરાતની એક આગવી અસ્મિતા છે. ગુજરાતની પ્રજાની એક આગવી ખુમારી છે. આવા ગુજરાતની સમૃદ્ધિની ભીતરની કથા પણ ગુજરાતની પ્રજાની ખુમારીને ઉજાગર કરતી અનેક આરોહ-અવરોહથી ભરપૂર છે. ૧૯૫૬ના સમયગાળામાં ગુજરાતને મોરારજી દેસાઈની દ્વિભાષી રાજ્યની ફોર્મ્યુલાથી અલગ 'ગુજરાત' રાજ્ય બનાવવા માટે જે સંઘર્ષ થયો તેની ગાથા લોહિયાળ અને નાટ્યાત્મક ઘટનાઓથી ભરપૂર છે. ગુજરાત રાજ્યની રચના આંદોલન વખતે ગુજરાતના સર્વોચ્ચ ગણાતા મોરારજી દેસાઈ ગુજરાત અને મહારાષ્ટ્રનું સંયુક્ત એવું દ્વિભાષી રાજ્ય બને તેના આગ્રહી હતા. કેટલાકે કોંગ્રેસ છોડી દીધી હતી. આખા ગુજરાતમાં જબરદસ્ત ઉત્તેજના અને મોરારજી દેસાઈ સામે પ્રચંડ રોષ હતો.

ભાષાવાર પ્રાંતરચના

બ્રિટિશરોએ તેમની વહીવટી સરળતા માટે દેશના જે કૃત્રિમ ભાગલા ઊભા કરેલ એ ભાગલાઓમાંની વિવિધભાષી પ્રજાને એથી પોતાની અસ્મિતા રૂંધાતી લાગતી હતી. આ કૃત્રિમ ભાગલા દૂર કરીને ભાષાવાર પ્રાંત રચનાનો લોકાગ્રહ વધતો જતાં ભારતની રાષ્ટ્રીય મહાસભા અથવા કોંગ્રેસ પણ સત્તાપ્રાપ્તિ સાથે જ ભાષાવાર પ્રાંતો રચવાનો ઠરાવ ઈ.સ. ૧૯૨૧માં સ્વીકાર્યો અને એ ધોરણે પક્ષની પ્રાંતિક સમિતિઓની રચના અપનાવી. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ ઈ.સ. ૧૯૫૩માં કોંગ્રેસના હૈદરાબાદ અધિવેશનમાં ભાષાવાર પ્રાંતરચનાનો ઠરાવ સર્વનુમતે પસાર કરવામાં આવ્યો.

ગુજરાતની અસ્મિતાનો પ્રશ્ન


ગુજરાતના અલગ રાજ્યની આશા ત્યારથી બંધાવા માંડી અને તેની અસ્મિતાને સંકોરવાનો અને પુનઃ જ્વલંત બનાવવાનો ઉત્સાહ પ્રજાના સર્વ વર્ગોમાં ફરી વળ્યો. પરંતુ રાજ્ય રચનાના આ ગાડાને મોરારજી દેસાઈએ એમ કહી ઘોંચમાં નાખી દીધું કે મુંબઈ જેવું વિકસિત બહુભાષી શહેર

કોઈ એકભાષી રાજ્યનો ભાગ ન બની શકે. આ અંગે પ્રજામાં ઉત્તાપ જાગતાં કેન્દ્ર સરકારે વચલો માર્ગ કાઢ્યો કે મહારાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત એવાં ત્રણ અલગ રાજ્યો પાડીને મુંબઈ સાથે બોરીવલી તાલુકો અને ઘણા જિલ્લાનાં કેટલાંક ગામો જોડી તેનું અલગ રાજ્ય કેન્દ્રીય શાસન નીચે મૂકવું અને ત્રણે રાજ્યોની હાઈકોર્ટ એક રાખવી, પરંતુ આની વિપરીત અસર ઊભી થવા પામી. મહારાષ્ટ્રમાં એવી માન્યતા જોર પકડવા માંડી કે ગુજરાતીઓ જ મુંબઈના મહારાષ્ટ્રમાં સમાવેશની આડા આવે છે. કાકાસાહેબ ગાડગીલે તો એટલે સુધી કહી નાખ્યું કે, મુંબઈને મહારાષ્ટ્રથી અલગ પાડવાનું મૂડીવાદીઓએ (એટલે કે ગુજરાતીઓએ) કાવતરું રચ્યું છે. મોરારજી દેસાઈએ પકડી રાખેલા દ્વિભાષી રાજ્યને તો બધેથી જાકારો મળી ચૂક્યો હોઈને વડા પ્રધાન નેહરુએ તા. ૧૭-૧-૧૯૫૬ના રોજ આકાશવાણી પરથી સ્પષ્ટ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત, વિદર્ભ સહિત મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર અલગ પાડવામાં આવશે.

ગુજરાતે આ જાહેરાત વધાવી લીધી પણ મહારાષ્ટ્ર મુંબઈ જતું કરવા તૈયાર નહોતું. ગુજરાતે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને અન્ય સંબંધિત પ્રદેશો સાથે પોતાની અસ્મિતાના વ્યાપ માટે મહાગુજરાત સીમા સમિતિ પણ રચી કાઢેલી. આ સીમા સમિતિએ ડુંગરપુર-વાંસવાડા ગુજરાતી હોવાનો હેવાલ તૈયાર કરી સીમા સમિતિને સોંપેલો. કેમ કે ત્યાંની વાગડી બોલી ગુજરાતીને મળતી આવે છે, ત્યાં વેપારીઓ ચોપડા પણ ગુજરાતી લિપિમાં લખે છે. વળી ડાંગ પર મહારાષ્ટ્રના દાવા સામે તે ગુજરાતી હોવાનો સંશોધિત હેવાલ બહાર પાડવા જે પ્રતિનિધિ મંડળ ડાંગ ગયેલું તેમાં માનવવંશશાસ્ત્રીય હકીકતો અને માનવમિતિ શાસ્ત્રાનુસાર પ્રત્યક્ષ અંગ માપન દ્વારા મહારાષ્ટ્રનો દાવો નાપાયાદાર હોવાનો હેવાલ રજૂ થયો હતો. પરંતુ આ બધું ચાલતું હતું ત્યાં તા. ૮-૮-૧૯૫૬નાં અખબારોમાં એવા સમાચાર પ્રગટ થયા કે, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના મતભેદોને લઈને દ્વિભાષી રાજ્ય રચનાનો ઠરાવ લોકસભામાં પસાર

કરવામાં આવ્યો છે. અલગ મહાગુજરાતની રચનામાં રાજ્યતા ગુજરાત માટે આ આઠમી ઓગસ્ટનો દિવસ સમગ્ર ગુજરાત પર એક વજાઘાત સમાન નીવડ્યો. તે દિવસે જે બનાવો બન્યા, સરકારે જે હિંસાચારની શરૂઆત કરી તે સામે પ્રજાની લાગણી સંતોષવા બહાર પડવાને બદલે ગુજરાતના કોંગ્રેસીઓએ જાણે સરકારની શરણાગતિ સ્વીકારી લીધી.

જેલનો સિલસિલો
૭મી ઓગસ્ટ, ૧૯૫૬



મોરારજી દેસાઈએ પકડી રાખેલા દ્વિભાષી રાજ્યને તો બધેથી જાકારો મળી ચૂક્યો હતો તે સમયે વડા પ્રધાન નેહરુએ તા. 17-1-1956ના રોજ આકાશવાણી પરથી સ્પષ્ટ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાત, વિદર્ભ સહિત મહારાષ્ટ્ર અને મુંબઈ શહેર અલગ પાડવામાં આવશે. ગુજરાતે આ જાહેરાત વધાવી લીધી પણ મહારાષ્ટ્ર મુંબઈ જતું કરવા તૈયાર નહોતું.

એટલે મહાગુજરાતના જંગનો પ્રથમ દિવસ. આ જ દિવસે સરકારે દ્વિભાષી રાજ્યની ઘોષણા કરીને ગુજરાતની પ્રજા ઉપર લપડાક મારી હતી, જેથી જંગનાં મંડાણ શરૂ થયાં. બપોરે કેટલાક વિદ્યાર્થીઓનું ટોળું અમદાવાદમાં ભદ્રના કિલ્લાના વિસ્તારમાં અઢી કલાક સુધી ઠરાવ લોકસભામાં પસાર

દેખાવો યોજાયા. ઓગસ્ટ મહિનો ચળવળનો મહિનો સાબિત થશે એવાં અંધાણ દેખાવા લાગ્યાં.

૮મી ઓગસ્ટ, ૧૯૫૬
૮મીનાં દૈનિકોમાં દ્વિભાષી રાજ્ય રચવાના ઠરાવની સત્તાવાર જાહેરાત થઈ. જેમાં જણાવવામાં આવ્યું કે, લોકસભાએ ૨૪૧ વિરુદ્ધ ૪૦ મતથી દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો છે. આમ આઠમી ઓગસ્ટ સમગ્ર ગુજરાત ઉપર એક વજાઘાત સમાન નીવડી. શહેરની તમામ કોલેજોમાં

ત્રિકમલાલ પટેલ, મગનભાઈ રણછોડભાઈ પટેલ, દેવીપ્રસાદ રાવળ, જમનાશંકર પંડ્યા, કે. ટી. શાહ, મનુભાઈ પટેલ અને બીજા કાર્યકરો હાજર હતા. કોંગ્રેસી નેતાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ. ઉગ્ર મિજાજ યુવકોએ પથ્થરબાજી ચાલુ કરી. કોંગ્રેસ ભવનના વરંડામાં ઊભેલી પોલીસે ચેતવણી આપ્યા વિના પહેલી ગોળી બપોરના ૨.૧૦ વાગે છોડી અને ગોળીબાર ચાલુ થયો. જેમાં કૌશિક ઈન્દુલાલ વ્યાસ, સુરેશ જયશંકર ભટ્ટ, પૂનમચંદ, ડી. જી. દારાસ્વામી અને અબ્દુલ એમ પાંચ યુવાનો ત્યાં જ ઢળી પડ્યા. કુલ ગોળીબાર ૩૬ થયા. ૧૦૫ જણ ઘવાયા. બાજુમાં ગુજરાત ક્લબ છે. ત્યાંથી વકીલો તોફાનના સ્થળે આવી પહોંચ્યા. તેમણે શાંત થવા વિદ્યાર્થીઓને વિનંતી કરી પણ તેમનો પ્રયત્ન વ્યર્થ ગયો. અંતે જાનહાનિ થઈ. સાંજે ૫.૩૦ રતિલાલ ખુશાલદાસ પટેલના પ્રમુખપદે લાલ દરવાજા ખાતે નાગરિકોની સભા થઈ, સભા પછી એક નાગરિક મૃત્યુ પામ્યો. શહેરના આ બનાવ પછી પોલીસ અને પ્રજા વચ્ચેનો સંઘર્ષ વ્યાપક બન્યો. રાત્રે દરિયાપુર પોલીસ ચોકીને આગ લગાડાઈ. સાંજ સુધીમાં ૧૬ જેટલા વિદ્યાર્થીઓની ધરપકડો થઈ.

૯મી ઓગસ્ટ

અમદાવાદ શહેર એ ગુજરાતના આંદોલન અને જાહેર જીવનનું એક ધબકતું હૃદય છે. હંમેશાં અમદાવાદમાં જે કંઈ બને છે તેનો પ્રતિભાવ આખા ગુજરાતમાં પડે છે. અમદાવાદમાં થયેલ ગોળીબાર વર્ષાની અસર સમગ્ર ગુજરાતમાં થઈ. આ ગોળીબારમાં હિન્દુઓ અને મુસ્લિમોનાં લોહી એક જ સ્થળે રેડાયાં અને તેથી મહાગુજરાતની લડતમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું હવામાન આપોઆપ ઊભું થયું. ચીનુભાઈ શેઠ, અમૃતભાઈ હરગોવિંદદાસ શેઠ, વિદ્યાબહેન નીલકંઠ આચાર્ય, એસ. વી. દેસાઈ વગેરે અગ્રણીઓએ પ્રજાને શાંત રહેવા અને તોફાનોથી દૂર રહેવા અપીલ કરી. રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળની સભા લો કોલેજમાં સવારે નવ વાગે મળી. જેમાં હરિહર ખંભોજા, કરસનદાસ

પરમાર, ચીમનલાલ પટેલ, પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ વગેરે કાર્યકરો હાજર હતા. ગઈકાલના બનાવને 'શહીદ દિન' મનાવવાનું નક્કી થયું અને 'મહાગુજરાત પગલાં સમિતિ'ની રચના કરવામાં આવી જેમાં ૧૫ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં રતિલાલ ખુશાલદાસ પટેલ, બ્રહ્મકુમાર ભટ્ટ, કરસનદાસ પરમાર, હિંમતલાલ શુક્લ, માર્ટીન શાસ્ત્રી, દાદુભાઈ અમીન, જયંતી દલાલ વગેરે હતા. પાછફથી બુઝર્ગ અગ્રણી ફકીરજી નેતા ઈન્દુલાલ યાજ્ઞિકનું નેતૃત્વ લડતને મળ્યું. વિદ્યાર્થીઓને શહીદ વિનોદ કિનારીવાલાની ખાંભીને બપોરે ૧૨ વાગ્યે અંજલિ આપી. બધાએ મહાગુજરાત માટે શપથ લીધા. અમદાવાદના વકીલ મંડળ દ્વારા પોલીસનાં આવાં પગલાંની તુરંતમાં સ્વતંત્ર ન્યાયી તપાસ કરવા મુખ્ય પ્રધાનને વિનંતી કરવામાં આવી.

ઠાકોરભાઈ બોલ્યા

જેમ ગોળીબાર થતા ગયા, ટિયરગેસના ટેટા ફૂટતા ગયા તેમ લોકો તારના થાંભલા, દૂધની કેબિનો અને બસનાં છાપરાં તોડીને રસ્તામાં અંતરાય નાખતા અને પોલીસ ગાડીઓને રોકતા. ઈટ-રોડાનો મારો ચલાવી, ગેરીલા લડાઈ લડતા. કોંગ્રેસ ભવન પર થયેલા ગોળીબારથી શહીદ થયેલા પાંચ યુવાનોની ઘટના બાદ કોંગ્રેસ અગ્રણી ઠાકોરભાઈ દેસાઈ બોલ્યા હતા : 'બંદૂકની ગોળીઓ ઉપર નામ-સરનામાં લખેલાં હોતાં નથી, તેથી કોને ગુનેગાર કે નિર્દોષ ગણવો તે કહી શકાય નહીં.' ઠાકોરભાઈ દેસાઈના આ નિવેદન બાદ ગુજરાતની પ્રજામાં ઉશ્કેરાટ વધ્યો. આ બાજુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ઠાકોરભાઈ કલાકે કલાકે મોરારજીભાઈને પરિસ્થિતિનો ખ્યાલ આપતા હતા. તે જ પ્રમાણે જવાહરલાલ નેહરુ અમદાવાદના તોફાન અંગે માહિતી મેળવવા અમદાવાદ સાથે સંપર્ક જાળવી રહ્યા હતા.

દેવેન્દ્ર પટેલ

સંપર્ક

+91 98792 07102

જાણવા જેવું

ચોમાસા પર અસર કરતું અલનીનો શું છે?

અલનીનોની અસરથી વરસાદ ઓછો પડ્યાના સમાચાર તમે વાંચ્યા હશે. વરસાદની વાતમાં અલનીનો ઉલ્લેખ ઘણીવાર થાય છે. આ અલનીનો શું છે તે જાણો છો ? સ્પેનીશ ભાષામાં 'અલનીનો' એટલે ખ્રિસ્તનું બાળક પરંતુ અહીં વાત હવામાનની છે. દક્ષિણ અમેરિકાના પેરુ દેશના દરિયાકાંઠે દર પાંચ કે છ વર્ષે ગરમ પાણીના પ્રવાહ પેદા થાય છે. નિયમિત સમયાંતરે ક્રિસ્મસ વખતે જ આ પ્રવાહ પેદા થાય છે. એટલે તેનું નામ ખ્રિસ્તનું બાળક પડ્યું. આ પ્રવાહ આખી દુનિયાના હવામાન પર અસર કરે છે. પેસિફિક સમુદ્ર પર વહેતાં વ્યપારી પવનો પૂર્વથી પશ્ચિમ તરફ જતાં હોય છે અને વાદળોને એશિયાના દેશ તરફ ધકેલતાં હોય છે. આ વાદળો જ ભારત સહિત એશિયાના દેશોમાં વરસાદ લાવે છે.

આપણા શરીરનો આધાર : અસ્થિપિંજર

માનવ શરીરના દરેક અંગ અને અવયવની રચનામાં સલામતી, શક્તિનો ઉપયોગ તેમજ જરૂરિયાતની અહુત ગણતરી જોવા મળે છે. શરીરને આધાર અને આકાર બનાવતી રાખવા માટે શરીરમાં સખત હાડકાં હોય છે. બંને હાથમાં ૫૪, પગમાં ૫૩, ખોપરી ૨૮, ચહેરામાં ૧૪, પાંસળીઓ ૨૪ અને કરોડમાં ૩૩ સહિત પુખ્ત માણસના શરીરમાં ૨૦૬ હાડકાં હોય છે. હાડકાં લગભગ ૪૦ ટકા કેલ્શિયમ, ૪૧ ટકા ઓક્સિજન અને ૧૮ ટકા ફોસ્ફરસના બનેલા પોલા હોય છે. તેના પોલાણમાં બોનમેરો હોય છે જ્યાં લોહીના કણો બને છે. હાડપિંજર માત્ર આધાર નથી પરંતુ માણસને હાલવા ચાલવા તેમજ વજન ઊંચકવા જેવી તમામ ક્રિયાઓમાં ઉપયોગી છે. શરીરના હાડકાં ૨૩૦ સાંધી વડે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આ સાંધાઓ પણ જરૂરિયાત પ્રમાણે આકારના હોય છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: અનેક ગામડાં સંપર્ક વિહોણા, NDRFની ટીમો તૈનાત

મુંબઈ

ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. વરસાદને કારણે મુંબઈ, સાંગલી, અકોલા વગેરે અનેક વિસ્તારો જળમગ્ન ગયા છે. આ સાથે ઘણી નદીઓ પણ બેકાઈ વહી રહી છે. અમરાવતીની સૌથી મોટી નદી સિપણાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, જેના કારણે પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું હતું.

છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા ગામોમાં પૂરને કારણે સંપર્ક તૂટી ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. એડમિનિસ્ટ્રેશન ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી છે. રાજ્યમાં એરફોર્સ-નેવીની સાથે એનડીઆરએફ ટીમોને પણ બચાવ કાર્ય માટે મોકલવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ વરસતા તંત્ર એલર્ટ પર છે.



ભારતમાં 2020માં 1.30 કરોડ વખત આકાશી વીજળી પડી, 815ના મોત

નવી દિલ્હી

નવી દિલ્હી: ભારતમાં 2019ની તુલનાએ 2020માં વીજળી પડવાની ઘટનામાં 23 ટકા વધારો જોવા મળ્યો છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં વીજળી પડવાની વધુને વધુ ઘટના સામે આવી. જ્યારે બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વીજળી પડવાથી સૌથી વધુ લોકોના જીવ ગયા. સોમવારે જારી કરવામાં આવેલા અર્થનેટવર્કસના રિપોર્ટ મુજબ ભારતમાં 3.90 કરોડ વખત આકાશી વીજળી પડી. તેમાં એક કરોડથી વધુ વખત જમીન સાથે અથડાઈ. આકાશી વીજળી જમીન સાથે ટકરાય ત્યારે જાનમાલને નુકસાન થવાની સંભાવના વધારે રહે છે. દેશમાં વીજળી પડવાની ઘટનાઓમાં જુદા-જુદા ભાગોમાં 815ના જીવ ગયા હતા.

ભારતમાં કોરોનાના કેસ ફરી ૪૦ હજારને પાર, 507 લોકોના મોત

નવી દિલ્હી

દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વચ્ચે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી એક વાર ઉછાળો જોવા મળી રહ્યો છે. દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૪૦ હજારને પાર પહોંચી ગઈ છે. તેની સાથે જ એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ૧૨ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મોત નોંધાયું નથી. ૨૮ રાજ્ય એવા છે જ્યાં મૃત્યુઆંક ૧૦થી ઓછો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ

મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૧,૩૮૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૦૭દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૨,૫૭,૭૨૦ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૪૧,૭૮,૫૧,૧૫૧ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૨૨,૭૭,૬૭૯ લોકોને રસી આપવામાં આવી છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ૩ કરોડ ૪ લાખ ૨૯ હજાર ૩૩૯ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૮,૬૫૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

કલાસીફાઈડ / Classified

A COUPLE OR SINGLE PERSON NEEDED FOR HOUSEKEEPING
A couple or a single person needed for housekeeping jobs in Longlac (Northern Ontario).
Please contact Amit at 519 590 5410 or feneloninn@yahoo.com

HIRING

Couple or 2 Students Required Full Time for Subway & Gas Station at Deep River, ON. Help will be Provided in PR Process Contact :-Ph. 613-852-1510

મુખ્યમંત્રી પદેથી હટવાનો અણસાર આપતા યદિયુરપ્પા બેંગલુરુ

કર્ણાટક ભાજપમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા ધમાસાણનો જલ્દી અંત આવે તેમ લાગી રહ્યું છે. સતત શક્તિ પ્રદર્શન કરી રહેલા હાલના સીએમ યેદિયુરપ્પાએ પોતે એવું નિવેદન આપ્યું છે જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે, તેઓ હવે સીએમ પદથી હટી રહ્યા છે. તેમણે કહ્યું છે કે, ભાજપનું હાઈકમાન્ડ જે આદેશ આપશે તેનું પાલન કરીશ અને મારા સમર્થનમાં સમર્થકોએ દેખાવો કરવાની જરૂર નથી. યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, અમારી સરકારના બે વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૬ જુલાઈએ એક કાર્યક્રમ યોજાવાનો છે.

એ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડુ જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરીશ. ભાજપને સત્તામાં પાછું લાવવાની મારી ફરજ છે. પાર્ટી કાર્યકરો અને સંતોને આ માટે સહયોગ કરવાનો આગ્રહ કરું છું. ૭૮ વર્ષીય યેદિયુરપ્પા કર્ણાટકના લિંગાયત સમુદાયમાંથી આવે છે.

“શિક્” (બંદગીમાં અલ્લાહની સાથે બીજા કોઈને ભાગીદાર બનાવવું) એક મહાપાપ(ગુનાહે કબીરાહ)

મનુષ્ય પોતાના જીવનમાં જે કાર્યો કરે છે, તે કાર્યોમાં સદ્કાર્યો નો પણ સમાવેશ થાય છે અને નહારા કાર્યોનો પણ. નહારા કાર્યોમાં એવા કાર્યો પણ હોય છે, જેની ગણના “નજીવા નહારા કૃત્યો” એટલે કે “નજીવા પાપ” (ગુનાહે સગીરાહ)માં થાય છે, અને અમુક એવા નહારા કાર્યો પણ હોય છે જેની ગણના “મોટા નહારા કૃત્યો” એટલે કે “મહાપાપ” (ગુનાહે કબીરાહ)માં થાય છે.

મહાપાપો (ગુનાહે કબીરાહ)માં એક મહાપાપ(ગુનાહે કબીરાહ) “શિક્” છે. “શિક્” એટલે કે પાલનહાર અલ્લાહની સાથે બીજા કોઈ ને ભીગદાર કે જોડીદાર બનાવવું. “શિક્” ઈસ્લામ ધર્મમાં અને મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદ અનુસાર મહાપાપ (ગુનાહે કબીરાહ) ગણવામાં આવે છે. આનું કારણ એ છે કે આ બ્રહ્માંડનો સર્જક કેવળ પાલનહાર અલ્લાહ જ છે અને તેણે જે જે વસ્તુઓનું સર્જન કરેલ છે તે તેણે એકલાએજ કરેલ છે, અને બીજા કોઈની પણ એ સર્જનમાં ન દખલગીરી છે અને ન કોઈની સહાય.

જેવી રીતે કુરાન મજીદના પ્રકરણ ૧૧૨ સુરાહ ઈબલાસ(તવહીદ-એકેશ્વરવાદ)માં પણ પાલનહાર અલ્લાહની ઓળખ અનુપમ, અનન્ય અને અજોડ તરીકે આપવામાં આવેલ છે, તે અનુસાર તેના જેવો બીજો કોઈ નથી અને તેનો કોઈ ભાગીદાર કે જોડીદાર નથી. એકેશ્વરવાદ (તવહીદ)ના પાયારૂપ આ પ્રકરણ ૧૧૨ સુરાહ ઈબલાસમાં કહેવામાં આવેલ છે કે :-

“તે અલ્લાહ એક છે, અલ્લાહ કોઈનો ગરજવાન નથી, પરંતુ સૌ તેના જ ગરજવાન છે. તેને કોઈ સંતાન નથી, અને ન તે કોઈનું સંતાન છે, અને તેના સમાન બીજો કોઈ નથી (તે અનુપમ, અનન્ય અને અજોડ છે.)” (પ્રકરણ ૧૧૨, શ્લોક ૧ થી ૪)

ઉપર મુજબ પાલનહાર અલ્લાહની અનુપમ ઓળખ અનુસાર તે “એક જ” છે અને તેના જેવો કોઈ બીજો નથી, તેથી ઉપાસના(બંદગી)ને લાયક કેવળ તેજ છે અને ન કે કોઈ બીજો. તે અનુસાર બંદગી કેવળ તેની જ કરવી



મુસ્લિમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદના બોધવચનો પર આધારિત

જોઈએ અને તેને છોડીને બીજા કોઈની બંદગી કરવી એ મહાપાપ (ગુનાહે કબીરાહ) છે અને આ મહાપાપને “શિક્”નું નામ આપવામાં આવેલ છે.

તે અનુસાર “શિક્” એટલે અલ્લાહની સાથે બીજા કોઈને ભાગીદાર કે જોડીદાર બનાવવું અથવા તેને છોડીને બીજા કોઈની ઉપાસના (બંદગી) કરવી અથવા તેને છોડીને કોઈ બીજા પાસે સહાય માંગવી કે યાચિકા (દુવા) કરવી. આ સર્વે કૃત્યો માટે શ્રદ્ધાળુઓને મનાઈ કરવામાં આવેલ છે, અને આ આદેશો વિષે કુરાન મજીદમાંના અસંખ્ય બોધવચનો માંથી ચાર બોધવચનો આ પ્રમાણે છે :-

“મેં જીન્નાતો અને મનુષ્યોનું સર્જન આ સિવાય બીજા કોઈ કામ માટે નથી કર્યું કે તેઓ મારી બંદગી કરે.” (પ્રકરણ ૫૧, શ્લોક ૫૬)

“અને તારા પાલનહારે (રબે)નિશ્ચય (હુકમ)કરી

દીધો છે કે તમે કોઈની બંદગી ન કરો, પરંતુ કેવળ તેની (અલ્લાહની) જ.” (પ્રકરણ ૧૭, શ્લોક ૨૩)

“તમારા પાલનહારે (રબે) કહી દીધેલ છે કે તમે મને સાદ દો (પોકારો), હું તમારી યાચિકા (દુવા) કબુલ કરીશ.” (પ્રકરણ ૪૦, શ્લોક ૬૦)

“(હે અલ્લાહ), અમે તારીજ બંદગી કરીએ છીએ, અને તારી જ સહાય ઈચ્છીએ છીએ.” (પ્રકરણ ૧, શ્લોક ૪)

ઉપરના ચાર બોધવચનોમાં આપેલ આદેશ અનુસાર બંદગી કેવળ અલ્લાહની જ કરવી જોઈએ અને સહાય કેવળ તેના પાસેથી માંગવી જોઈએ.

કુરાન મજીદમાંના બોધવચનો અનુસાર પાલનહાર અલ્લાહનો કોઈ ભાગીદાર કે જોડીદાર કે મદદગાર નથી, તે વિષેના અસંખ્ય બોધવચનો માંથી એક બોધવચન આ પ્રમાણે છે,

“અને (હે પયગંબર), કહો કે પ્રશંસા તો એ અલ્લાહ માટે જ છે, જેણે ન કોઈને પુત્ર બનાવ્યો, ન કોઈ તેની સત્તા (બાદશાહી)માં તેનો ભાગીદાર (જોડીદાર) છે, અને ન તે વિવશ છે કે કોઈ તેનો મદદગાર હોય. અને તેની મહાનતા વર્ણવો, પુર્ણ કક્ષાની મહાનતા” (પ્રકરણ ૧૭, શ્લોક ૧૧૧)

કુરાન મજીદ અનુસાર શિક્ને એક મહા પાપ (ગુનાહે કબીરાહ) ગણવામાં આવેલ છે. આ વિષે કુરાન મજીદમાંનું એક બોધવચન આ પ્રમાણે છે :-

“(હે પયગંબર), એ સમયને યાદ કરો જ્યારે લુકમાન(હકીમ) પોતાના પુત્રને શિખામણ આપી રહ્યો હતો, ત્યારે તેણે પોતાના પુત્રને કહ્યું કે “એ પુત્ર, અલ્લાહ સાથે કોઈને ભાગીદાર(જોડીદાર) બનાવીશ નહીં, ખરેખર શિક્ એક મહા પાપ અને જુલમ છે.” (પ્રકરણ ૩૧, શ્લોક ૧૧૩)

બંદગીમાં અલ્લાહની સાથે બીજા કોઈને ભાગીદાર બનાવવું કે તેને છોડીને અન્ય કોઈની બંદગી કરવી કે તેને છોડીને અન્ય કોઈથી સહાય માંગવી એટલે કે શિક્ કરવું એ એટલું મોટું પાપ (ગુનાહે કબીરાહ) છે કે કુરાન મજીદમાં તે વિષે કહેવામાં આવેલ છે કે પાલનહાર અલ્લાહ અન્ય પાપો(ગુનાહો) ક્ષમા કરી શકે છે, પણ શિક્ જેવું મહા પાપ (ગુનાહે કબીરાહ) ક્યારે પણ ક્ષમા નથી કરતો. આ વિષે કુરાન મજીદમાંના બે બોધવચનો આ પ્રમાણે છે :-

“ખરેખર પાલનહાર અલ્લાહ શિક્ના ગુનાહને ક્ષમા નથી કરતો. આ સિવાય જે કંઈ ગુનાહો છે, તે જેના માટે યાદ છે, તેને ક્ષમા કરી દે છે. અલ્લાહની સાથે જેણે કોઈ બીજાને ભાગીદાર (જોડીદાર) ઠેરવ્યો, તેણે તો ઘણું જ મોટું જુઠ ઘડી કાઢ્યું અને ઘણા જ સખત અને મોટા ગુનાહનું કાર્ય કર્યું.” (પ્રકરણ ૪, શ્લોક ૪૮)

“ખરેખર અલ્લાહને ત્યાં માત્ર શિક્ માટે જ ક્ષમા નથી. આના સિવાય બીજું બધું જ અલ્લાહ ક્ષમા કરી શકે છે, જેને તે ક્ષમા કરવા યાદે. જેણે અલ્લાહની સાથે કોઈને ભાગીદાર(જોડીદાર) ઠેરવ્યો, તે તો ભટકી જવામાં ઘણો આગળ નીકળી ગયો.” (પ્રકરણ ૪, શ્લોક ૧૧૬)

ઉપરના બે બોધવચનો અનુસાર શિક્ જેવા મહાપાપ માટે અલ્લાહ પાસે ક્ષમાનો કોઈ અવકાશ નથી. માટે શ્રદ્ધાળુઓએ આવા મહાપાપથી બહુ જ દુર રહેવું જોઈએ અને બંદગીમાં અલ્લાહની સાથે કોઈ અન્યનો સમાવેશ ન કરવો જોઈએ અને સહાય પણ કેવળ તેની પાસેથી જ માંગવી જોઈએ.



ભારતમાં કોરોનાથી 50 લાખ લોકોના મોત થયા: અમેરિકાના સ્ટડીમાં દાવો

નવી દિલ્હી

ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. સંસદના ચોમાસુ સત્રમાં પણ તેને લઈને હંગામો ચાલી રહ્યો છે. કોરોનાના સંક્રમણના મામલામાં ભારત દુનિયામાં બીજા સ્થાને અને મોતના કેસમાં ત્રીજા સ્થાને છે. સરકારના આંકડા પ્રમાણે ભારતમાં 4.18 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે પણ અમેરિકામાં થયેલા એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતમાં કોરોનાના કારણે 34 થી 39 લાખ લોકોના મોત થયા છે. આ આંકડો ભારત સરકારના સત્તાવાર આંકડા કરતા 10 ગણો વધારે છે.



રિપોર્ટ તૈયાર કરવામાં ચાર વર્ષ સુધી પીએમ મોટીના આર્થિક સલાહકાર રહી ચુકેલા અરવિંદ સુબ્રમણ્યમનો પણ સમાવેશ થાય છે. વોશિંગ્ટનની સંસ્થા સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા હાથ ધરાયેલા સ્ટડીમાં સરકારી

આંકડા, આંતરરાષ્ટ્રીય અનુમાન, સેરોલોજિકલ રિપોર્ટ અને ઘરોમાં થયેલા સર્વેને આધાર બનાવીને તારણ કાઢવામાં આવ્યું છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, જાન્યુઆરી 2020થી જુન 2021 વચ્ચે ભારતમાં કુલ 50 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતના વિભાજન બાદ આ સૌથી મોટી માનવ ત્રાસદી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પહેલી લહેર અનુમાન કરતા વધારે ઘાતક હતી અને બીજી લહેરમાં હજારો લોકો ઓક્સિજન, બેડ અને વેક્સીનના અભાવે મોતને ભેટ્યા હતા.

ચંટણી પરી છતાં બંગાળમાં હિસા, ટીએમસીના ત્રણ કાર્યકરની હત્યા

કોલકાતા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ભલે ભારે બહુમતીથી ફરી સીએમ બન્યા હોય પણ ચૂંટણી બાદ ચાલી રહેલી હિંસાને રોકવામાં તેઓ નિષ્ફળ ગયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ટીએમસીના ત્રણ કાર્યકરોની હત્યાથી ચકચાર મચી ગઈ છે.

જેના પગલે હજી પણ રાજ્યમાં રાજકીય હિંસામાં લોકોનું લોહી રેડાઈ રહ્યું છે. લેટેસ્ટ મામલામાં ૨૧ જુલાઈના રોજ શહીદ દિવસની ઉજવણી વચ્ચે ઉત્તરી પરગણા જિલ્લામાં એક ટીએમસી કાર્યકરની ગોળીઓ મારીને હત્યા કરી દેવાઈ છે. ૩૮ વર્ષીય કાર્યકરની ઓળખ શુભ્રાજીત

દત્ત તરીકે થઈ છે. દરમિયાન હત્યામાં સ્થાનિક બિઝનેસમેન બાબુલાલનું નામ આવી રહ્યું છે. બુધવારે રાતે આ કાર્યકર પાર્ટી કાર્યાલય પરથી પાછો ફરી રહ્યો હતો ત્યારે બે બાઈક પર આવેલા યુવકોએ પાછળથી તેના પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેના પગલે શુભ્રાજીતનું સ્થળ પર જ મોત થયું હતું. લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ લઈ આવ્યા હતા. જોકે ડોક્ટરોએ તેને મરેલો જાહેર કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે સ્થાનિક કાર્યકરોનો બિઝનેસમેન બાબુલાલ સાથે ઝઘડો થયો હતો. જેમાં તેને ઈજા થઈ હતી અને હાલમાં તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.

પંજાબ વિવાદ પર વિરામ! સિદ્ધુના રાજ્યભિષેકમાં આવશે CM અમરિંદર

ચંડીગઢ

પંજાબ કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુ વિરુદ્ધ કેપ્ટન અમરિંદર સિંહની લડાઈ પર હવે બ્રેક લાગી શકે છે. સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા બાદ શુક્રવારે (23 જુલાઈ) તેમનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે. સૂત્રો કહે છે કે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ નવજોતસિંહ સિદ્ધુના રાજ્યાભિષેક કાર્યક્રમમાં હાજરી આપશે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમ પાર્ટી હાઈકમાન્ડની દખલગીરી બાદ થયો હતો. સૂત્રો

દ્વારા જાણવા મળ્યું છે કે પંજાબના પ્રભારી હરીશ રાવત મુખ્યમંત્રીની સાથે કોંગ્રેસ ભવન જશે જ્યાં સમારોહ યોજનાર છે. સિદ્ધુને પાર્ટીની લગામ સોંપવામાં આવે તે પહેલાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આ પાર્ટીમાં સીએમ અમરિંદર સિંહ તમામ ધારાસભ્યો સાથે જોડાશે. સિદ્ધુ હાલના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ જાખડની જગ્યા લેશે. છેલ્લા કેટલાક સમયથી સિદ્ધુ અને અમરિંદર સિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અમૃતસર (પૂર્વ)ના ધારાસભ્યએ તાજેતરમાં જ મુખ્ય પ્રધાન પર તોછડાઈને લઈને પ્રહાર કર્યા હતા.

ચીને શિનજિયાંગ પ્રાંત સરહદ નજીક નવું હવાઈમથક વિકસાવવાની તૈયારી શરૂ કરી

ભારતીય સરહદ નજીક 400 કિ.મી.નું અંતર ઓછું કરવાનો ચીનનો પ્રયાસ

મુંબઈ

ભારતને લગતી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ફાઈટર એરક્રાફ્ટના સંચાલનમાં રહેલી ખામીઓ દૂર કરવા ચીન શિનજિયાંગ પ્રાંતના શાક્યે નગરમાં પૂર્વીય લડાખ નજીક લડાયક વિમાનો ખડકી શકાય તેના માટે નવું વિમાનમથક વિકસાવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ નવું મથક મોજૂદ કાશગર અને હોગન મથકો વચ્ચે સ્થિત રહેશે. અહીંથી

જ લાંબા સમયથી ભારતીય સરહદે લડાયક વિમાનોના ઉડાન ભરાઈ રહ્યા છે. નવા હવાઈમથકથી આ વિસ્તારમાં પોતાના હવાઈ દળમાં રહેલી ટ્રૂટીઓ પૂરાઈ જવાની ચીનને અપેક્ષા છે.

શાક્યે શહેરમાં એક હવાઈ મથક હાલ મોજૂદ છે જેને લડાયક વિમાનોના સંચાલન માટે અપગ્રેડ કરવામાં આવશે. આ મથક લડાયક વિમાનોના સંચાલન માટે આગામી થોડા સમયમાં તૈયાર થઈ જશે અને તેના માટેના કાર્યને ઝડપી બનાવાયું છે.

નિષ્ણાંતોના મતે એલએસી નજીક ચીનના હાલના હવાઈ મથકો વચ્ચે લગભગ 400 કિ.મી.નો ગેપ છે જે શાક્યેમાં બની રહેલા નવા હવાઈ મથકથી ઓછો થઈ જશે. ભારતીય એજન્સીઓ ચીન નજીક બાહાહોટીમાં ઉત્તરાખંડ સરહદ નજીકના હવાઈ મથક પર પણ બારીકાઈથી નજર રાખી રહી છે. અહીં ચીને સેંકડોની સંખ્યામાં માનવ રહિત વિમાનો (ડ્રોન) ખડક્યા છે જે આ વિસ્તારમાં સતત ઉડાણ ભરી રહ્યા છે.

UPમાં 30 હજાર રૂપિયા લેવા માટે પતિ જીવતો હોવા છતાં 21 મહિલાઓ વિધવા

અગાઉ ગોરખપુર, બલરામપુર, ચિત્રકૂટ, કાનપુરમાં આવા કૌભાંડ સામે આવ્યા હતા

નવી દિલ્હી

ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોની સાંઠગાંઠ ઉત્તર પ્રદેશ સરકારની વધુ એક લાભકારી યોજનામાં કૌભાંડ કર્યું છે. આ વખતે ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોએ રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજનામાંથી સરકારી ધન હડપી લીધું છે. 30 હજાર રૂપિયા માટે 21 મહિલાઓને વિધવા બનાવી દીધી છે, જ્યારે હકીકતમાં તેમના પતિ જીવત છે. ઉત્તર પ્રદેશ સરકારે રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજનાની શરૂઆત



કરી છે. આ યોજનામાં ગરીબી રેખા નીચે રહેતા પરિવારના કમાઉ મુખિયાનું 60 વર્ષની ઉંમર પહેલા કસમયે મોત થાય તો તેની પત્નીને 30,000 રૂપિયાની સહાયતા રાશિ મળે છે. ભ્રષ્ટ

અફસરો અને દલાલોએ ગરીબ વિધવા મહિલાઓને મળતી આ 30,000 રૂપિયાની રકમ હડપ કરી લીધી છે. લખનૌના સરોજની નગર ખાતે આવેલા બંધરા અને ચંદ્રાવલ ગામમાં 2019-20 અને 2020-21ના વર્ષમાં કુલ 88 લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, લાભ મેળવનારી આ મહિલાઓમાંથી 21 મહિલાઓ એવી હતી જેમનો પતિ જીવત છે અને મહિલાઓએ ખોટી રીતે સહાય મેળવી.

દેશમાં મ્યુકર માયકોસિસના કુલ 45,432 કેસ, 4252 મોત

નવી દિલ્હી

15 જુલાઈ સુધીમાં દેશમાં મ્યુકરમાયકોસિસના 45,432 કેસ નોંધવામાં આવ્યા છે. જે પૈકી 21,085 લોકોની સારવાર ચાલી રહી છે અને 4252 લોકોનાં મોત થયા છે તેમ રાજ્યસભાને આજે જણાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે મોટા ભાગના મ્યુકરમાયસીસના દર્દીઓ (84.4 ટકા) કોરોનાના દર્દીઓ હતાં. કોરોનાની બીજી લહેરમાં મ્યુકરમાયસિસના કેસોમાં વૃદ્ધિ જોવા મળી હતી. મ્યુકરમાયસિસના કેસોની સંખ્યા



મોકલવા કેન્દ્ર સરકારે રાજ્યોને કોવિડ-19 ઈન્ડિયા પોર્ટલ પર પહોંચાડવાનું જણાવ્યું હતું. જેના કારણે કેન્દ્ર સરકાર અઆ ડેટાનું વિશ્લેષણ કરી રાજ્યો માટે જરૂરી નિર્દેશ જારી કરી શકે. આ રોગના ઉપચાર માટે એમ્ફોટેરિસિન-બી નામની દવાનો ઉપયોગ કરવામાં આવે છે.

ફ્રાન્સથી વધુ 3 રાફેલ ભારત આવ્યા, દેશમાં રાફેલની સંખ્યા 24 થઈ

નવી દિલ્હી

રાફેલ યુદ્ધ વિમાનોની સાતમી ખેપમાં ત્રણ વધારે વિમાન ફ્રાન્સથી ઉડાન ભરીને લગભગ આઠ હજાર કિલોમીટરનું અંતર કાપીને ભારત પહોંચ્યા છે. આ વિમાનોને ભારતીય વાયુસેનાની રાફેલ વિમાનોની બીજી સ્કવોડ્રનમાં સામેલ કર્યા છે. ફ્રાન્સથી આવેલા આ વિમાનોને હવાઈ માર્ગમાં સંયુક્ત આરબ અમીરાતની વાયુસેનાએ ઈંધણ ઉપલબ્ધ કરાવ્યું. ભારતીય વાયુસેનાએ ટ્રિવટ કર્યું કે ફ્રાન્સના ઈસ્ત્રેસ એયર બેઝથી ઉડીને ક્યાંય રોકાયા વગર ત્રણે રાફેલ વિમાનો થોડા સમય પહેલા ભારત પહોંચ્યા છે. હવાઈ માર્ગમાં વચ્ચે મદદ કરવા માટે ભારતીય વાયુસેના યુએઈની વાયુસેનાને ધન્યવાદ આપે છે.

સ્વીસ બેંકમાં ભારતીયોની જમા રકમનો આંકડો 20,700 કરોડ

નવી દિલ્હી

સ્વીસ સત્તાવાળાઓએ નાણા મંત્રાલયને આપેલી માહિતી મુજબ સ્વીસ બેંકોમાં ગ્રાહકોની જમા કર્મર ડિપોઝીટ જરૂરી નથી કે સ્વીટ્ઝરલેન્ડમાં જ હોય આ રકમ તેની વિદેશી બ્રાન્ચોમાં પણ હોઈ શકે છે તેમ નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું છે. સ્વીસ નેશનલ બેંક(એસએનબી)એ આપેલા નવા ડેટા અનુસાર સ્વીસ બેંકોમાં ભારતીય લોકો અને કંપનીઓ દ્વારા સ્વીસ બેંકોમાં જમા કરાવેલ રકમ

૨૦૨૦માં વધીને ૨.૫૫ અબજ સ્વીસ ફ્રેન્ક(૨૦,૭૦૦ કરોડ રૂપિયા) થઈ ગઈ હતી. જે છેલ્લા ૧૩ વર્ષની સૌથી વધુ છે. રાજ્યસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે તાજેતરના મીડિયા અહેવાલોના સંબંધમાં સ્વીસ સત્તાવાળાઓએ સ્વીસ બેંકિંગ સેક્ટરનું સંપૂર્ણ ચિત્ર રજૂ કર્યું છે. આ અહેવાલ એસએનબીના વાર્ષિક બેંકિંગ સ્ટેટિસ્ટિક્સ આધારે રજૂ કરવામાં આવ્યો છે. ગયા મહિને ભારતીય નાણા મંત્રાલયે સ્વીસ સત્તાવાળાઓ પાસેથી વિગતો માગી હતી.

ઓક્સિજનથી મોત નથી તેવું કહેનાર સરકાર સામે કેસ થવો જોઈએ: શિવસેના

નવી દિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયું હતું કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઈનું મોત થયું નથી. જોકે વિપક્ષો હવે સરકારને આ મુદ્દે ઘેરી રહ્યા છે ત્યારે શિવસેનાએ પણ સરકાર પર હુમલો કર્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું છે કે, મારી પાસે શબ્દો નથી, ઓક્સિજનની અછતના કારણે પોતાના સ્વજનો ગુમાવનારા લોકોની આ નિવેદન સાંભળીને શું સ્થિતિ થઈ હશે તે વિચારી શકાય તેવું નથી. સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ. કારણ કે સરકાર જુદું બોલી રહી છે.

ભારત સહિત વિશ્વના દેશોમાં ડેલ્ટાનો કહેર, 28 દિવસમાં 75 ટકા કેસ નોંધાયા

ડેલ્ટા વેરિયન્ટથી પ્રભાવિત થતાં દેશોની યાદીમાં સતત ઉમેરો થઈ રહ્યો છે

જિનેવા

ભારતમાં ઘાતક નીવડેલી કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિયન્ટ દુનિયાભરના દેશો પર કહેર વર્તાવી રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના તાજેતરમાં સામે આવેલા રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે, વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન અસરકારક રીતે ચાલી રહ્યું હોવા છતાં ડેલ્ટા વેરિયન્ટના કેસો વધી રહ્યા છે. ડેલ્ટા વેરિયન્ટના ઝડપથી ફેલાવાને લીધે ભારત, ચીન, રશિયા, ઈઝરાયેલ અને બ્રિટન સહિત

અનેક દેશોમાં વિતેલા ૨૮ દિવસમાં ૭૫%થી વધુ કેસમાં ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમણ સામે આવ્યું છે. ૨૦ જુલાઈએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની વૈશ્વિક મહામારી પર સામે આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ડેલ્ટા વેરિયન્ટથી પ્રભાવિત થતાં દેશોની યાદીમાં સતત ઉમેરો થઈ રહ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, ડેનમાર્ક, ભારત, ઈન્ડોનેશિયા, ઈઝરાયેલ, પોર્ટુગલ, ચીન, ડેનમાર્ક, રશિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા અને બ્રિટન સહિતના અનેક દેશો સામેલ

છે. રિપોર્ટ દર્શાવે છે કે, વિતેલા સાત દિવસમાં સૌથી વધુ ૩,૫૦,૨૭૨ કેસ ઈન્ડોનેશિયામાંથી સામે આવ્યા છે, બ્રિટનમાં પણ આવી જ ગંભીર સ્થિતિ છે જ્યાં સાત દિવસમાં ડેલ્ટા વેરિયન્ટના ૨,૮૬,૪૪૭ નવા કેસ ૪૧%ના વધારા સાથે સામે આવ્યા છે. અમેરિકામાં ૨,૧૬,૪૩૩ નવા કેસ ૬૮%ના વધારા સાથે સામે આવ્યા છે. આ સિવાય બ્રાઝીલમાં ૨,૮૭,૬૧૦ નવા કેસ ૧૪%ના ઘટાડા સાથે અને ભારતમાં ૨,૬૮,૮૪૩ નવા કેસ ૮%ના ઘટાડા સાથે સામે આવ્યા છે.

ફાન્સ પ્રમુખ મૈક્રો સહિત ૧૪ દેશના વડાઓનો જાસૂસી થયાની આશંકા

બોસ્ટન

ઈઝરાયેલના એનએસઓ ગૂરપના જાસૂસી સ્પાયવેર પીગાસસના ક્લાયન્ટ્સ દ્વારા ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મૈક્રો સહિત ૧૪ દેશોના વર્તમાન અથવા ભૂતપૂર્વ વડાઓની પણ જાસૂસી કરાઈ હોવાની એન્સ્ટ્રી ઈન્ટરનેશનલે આશંકા વ્યક્ત કરી છે. એન્સ્ટ્રીના મહામંત્રી એન્સ કોલમાર્ટ જણાવ્યું હતું કે, પીગાસસ જાસૂસીના અસાધારણ ઘટસ્ફોટે સમગ્ર વિશ્વના નેતાઓને હથમચાવી દીધા છે. એન્સ્ટ્રીએ લીક કરેલા ૫૦,૦૦૦ ફોન નંબરોની યાદીમાં સંભવિત ટાર્ગેટ્સમાં અનેક દેશોના વડાઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ

આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસા અને ઈરાકના સાલિહ, મોરોક્કોના રાજા મોહમ્મબદ-૬ અને ત્રણ દેશોના વર્તમાન વડાપ્રધાનો પાકિસ્તાનના ઈમરાન ખાન, ઈજિપ્તના મુસ્તફા મેડબૌલી અને મોરોક્કોના અલ ઓથમાનીના ફોન નંબર્સ પણ યાદીમાં સામેલ છે. પોસ્ટે કહ્યું છે કે કોઈપણ દેશના વડાઓએ એનએસઓના મિલિટરી ગ્રેડ પીગાસસ સ્પાયવેરથી તેમના સ્માર્ટફોનની જાસૂસી થઈ છે કે નહીં તેની તપાસ કરાવવા માટે ફોનને ફોરેન્સિક ટેસ્ટિંગ માટે મોકલવા નથી. ૩૭ ફોન્સ ટેપ થયા હોવાનું અથવા તેને ટેપ કરવાનો પ્રયાસ થયો હોવાનું તપાસમાં જણાયું છે.

તાલિબાનીઓ કાબુલ પાસે પહોંચ્યા રાષ્ટ્રપતિના મહેલ પાસે રોકેટ હુમલો

કાબુલ

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓ ધીરે ધીરે આગળ વધી અનેક વિસ્તારો પર કબજો કરવા લાગ્યા છે. એવામાં તાલિબાની આતંકીઓએ હવે રોકેટ હુમલા પણ શરૂ કરી દીધા છે. આવો જ રોકેટ હુમલો અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિના કાબુલ સ્થિત નિવાસ સ્થાન પાસે કરવામાં આવ્યો હતો. જ્યારે ઈદની નમાઝ ચાલી રહી હતી ત્યારે જ આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા માટે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિએ તાલિબાન પર આરોપો લગાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં મંગળવારે ઈદની

નમાઝ ચાલી રહી હતી, આ દરમિયાન જ ભવન પાસે રોકેટનો વરસાદ થવા લાગ્યો હતો. જોકે કોઈ મોટી જાનહાની નહોતી સર્જાઈ કેમ કે રોકેટ નિશાન ચુકી ગયા હતા અને ભવનની પાસે જઈને પડ્યા હતા. ઈદની નમાઝમાં રાષ્ટ્રપતિ અશરફ ઘની અને દેશના અન્ય નેતાઓ તેમજ અધિકારીઓ હિસ્સો લઈ રહ્યા હતા. આ હુમલો તાલિબાન દ્વારા કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. તાલિબાની આતંકીઓ હવે કાબુલની બિલકુલ નજીક પહોંચી ગયા છે અને ગમે ત્યારે કાબુલ પર પણ કબજો કરી શકે છે.

ચીનના હેનાનમાં ૨૪ કલાકમાં ૧૮ ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર, ૨૫ મોત

બેઈજિંગ

મધ્ય ચીનના હેનાન પ્રાંતના ઝેંગઝોઈ શહેરમાં ૧,૦૦૦ વર્ષમાં પહેલી વખત સાંભેલાધાર વરસાદ ખાબકતાં આવેલા પૂરમાં ૧૨ સબવે પ્રવાસીઓ સહિત ૨૫ લોકોનાં મોત નીપજ્યાં છે અને ૧૦ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. વિશ્વના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંના એક ઝેંગઝોઈમાં પૂરના કારણે બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ ઈંચ વરસાદ ખાબકતા ઝેંગઝોઈ જળબંબાકાર થઈ ગયું છે. મૂશળધાર વરસાદના કારણે પૂર આવતાં શહેરમાં અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ છે, શહેરના સબવે સહિતના વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે. પૂર નિયંત્રણ વિભાગે સેકન્ડ હાઈએસ્ટ લેવલ-૨ ચેતવણી જાહેર કરી છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ



ટાઈમ્સના અહેવાલ મુજબ પૂરના કારણે ૨૫ લોકોનાં મોત થયા છે અને સાત લાખતા છે. ઝેંગઝોઈડોંગ રેલવે સ્ટેશને ૧૬૦થી વધુ ટ્રેન અટકાવી દેવાઈ છે અને ઝેંગઝોઈમાં એરપોર્ટ પર ૨૬૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ છે.

યુરોપમાં પૂરનો પ્રકાપ યથાવત : મૃત્યુઆંક વધીને ૧૮૦ને પાર, જર્મનીમાં સૌથી વધુ

બર્લિન

પશ્ચિમ યુરોપમાં વિનાશકારી પૂરને કારણે થયેલો મૃત્યુઆંક વધીને ૧૮૦ થઈ ગયો છે. પૂરનું પાણી ઘટી ગયા પછી બચાવકર્મીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યાં છે. પોલીસે પશ્ચિમ જર્મનીના રાઈલેન્ડ-પેલિટિનેટ રાજ્યમાં પૂરથી ખૂબ જ અસરગ્રસ્ત અહરવિલર મૃતકોની સંખ્યા ૧૧૦થી વધારે બતાવવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા હજુ પણ વધવાની શક્યતા છે. જર્મનીના સૌથી વધુ વસ્તીવાળા ઉત્તરી રાઈન-વેસ્ટફલિયા રાજ્યમાં ૪૫ લોકોનાં મોતના અહેવાલને સમર્થન આપવામાં આવ્યું છે. જેમાં ચાર ફાયર વિભાગના કર્મચારીઓ છે. જ્યારે બીજી તરફ બેલ્જિયમમાં પૂરને કારણે ૨૭ લોકોનાં મોત થયા છે. જર્મની, લેધરલેન્ડ અને બેલ્જિયમમાં વરસાદ રોકાઈ



ગયો છે પણ પશ્ચિમ અને મધ્ય યુરોપના કેટલાક ભાગોમાં તોફાન અને વરસાદ ચાલુ છે. જર્મની-ચેક સરહદ વિસ્તાર અને જર્મનીના દક્ષિણ પૂર્વ વિસ્તાર તથા ઓસ્ટ્રિયાના સરહદી વિસ્તારોમાં પૂર આવ્યું હતું

સાઉદી અરામકોનો ડેટા લીક, કંપની પાસે 5 કરોડ ડોલરની ખંડણી મગાઈ

દુબઈ

સાઉદી અરબની સરકારી ઓઈલ કંપની સાઉદી અરામકોએ બુધવારે તેનો ડેટા લીક થયો હોવાનું અને આ લીક ડેટા માટે પાંચ કરોડ યુએસ ડોલરની ખંડણી મગાઈ હોવાનું કબૂલ્યું છે. સાઉદી અરામકોએ કહ્યું કે, થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટર્સ દ્વારા કંપનીનો મર્યાદિત ડેટા પરોક્ષ રીતે રીલીઝ કરાયો હોવાનું તેના ધ્યાનમાં આવ્યું છે. જોકે, કંપનીએ તેની સાઈબર સિક્યોરિટી તોડીને ડેટા લીક થયાનો ઈનકાર કર્યો છે. સાઉદી કૂડ ઓઈલ કંપનીએ કયા કોન્ટ્રાક્ટર પાસેથી ડેટા લીક થયો અથવા હેક થયો તે અંગેની માહિતી

આપી નથી. અરામકોએ જણાવ્યું હતું કે, કંપનીનો મર્યાદિત ડેટા અમારી સીસ્ટમ તોડીને લીક કરાયો નથી તે બાબતની અમે પુષ્ટી કરી છે. વધુમાં લીક ડેટાથી અમારી કામગીરી પર કોઈ અસર પડી નથી અને કંપનીએ તેની સાઈબર સિક્યોરિટી મજબૂત હોવાનું જણાવ્યું છે. ડાર્કનેટ પર એક પેજ પર દાવો કરાયો છે કે એક ખંડણીખોર અરામકોનો એક ટેરાબાઈટ મૂલ્યનો ડેટા ધરાવે છે. એક ટેરાબાઈટ એટલે ૧,૦૦૦ ગીગાબાઈટ્સ. આ પેજે અરામકા પાસે લીક ડેટા જાહેર નહીં કરવા માટે ક્રિપ્ટોકરન્સીમાં પાંચ કરોડ યુએસ ડોલરની ખંડણી માગી છે.

અમેરિકાના પોર્ટલેન્ડમાં ગોળીબારની ઘટનાઓમાં બેનાં મોત, સાત ઘાયલ

પોર્ટલેન્ડ

અમેરિકામાં ઓરેગનના પોર્ટલેન્ડ શહેરમાં ગોળીબારની અલગ અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોત થયા છે અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ શહેરમાં છેલ્લા છ મહિનાઓમાં હિંસક ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. પોર્ટલેન્ડના મેયર ટેડ હીલ્સે ગોળીબારની આ ઘટનાઓને મહામારી ગણાવી હતી અને જણાવ્યું હતું કે તે પોર્ટલેન્ડ પોલીસ બ્યુરોમાં વધુ અધિકારીઓ અને સંશોધનોને તૈનાત કરવાના પ્રયત્નો કરશે. મિનિયાપોલિસમાં અશ્વેત જ્યોર્જ ફ્લોયર્ડનું પોલીસ કાર્યવાહીમાં મોત થયા પછી પોલીસની બર્બરતા અને વંશીય અન્યાયની વિરુદ્ધ પોર્ટલેન્ડમાં છેલ્લા કેટલાક મહિનાઓથી દેખાવો ચાલી રહ્યાં છે.

આગામી 24 જુલાઈએ ધરતી સાથે અથડાઈ શકે છે વિશાળ એસ્ટેરોઈડ

લંડન

કોરોના સંકટ, વાવાઝોડું, પૂર અને ભૂકંપના કારણે દરેક બાજુથી આફત અનુભવાઈ રહી છે. આ બધા વચ્ચે હવે એક સ્ટેડિયમ જેટલો વિશાળ એસ્ટેરોઈડ ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે અને 24 જુલાઈના રોજ તે ધરતી સાથે અથડાઈ શકે છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ તેને ખૂબ જ ખતરનાક ગણાવ્યો છે. આ વિશાળ એસ્ટેરોઈડ 8 કિમી પ્રતિ સેકન્ડ એટલે આશરે 28,800 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેની

ધરતી તરફ આગળ વધવાની ગતિ એટલી વધારે છે કે, જો કોઈ ગ્રહ કે વસ્તુ કોઈ એસ્ટેરોઈડ સાથે અથડાય તો તબાહ થઈ જાય. એસ્ટેરોઈડ નિયર અર્થ ઓબ્જેક્ટ (એનઈઓ) 20 મીટર પહોળો છે અને તે 28,70,847,607 કિમી દૂરથી પણ દેખાશે, જે પૃથ્વી અને ચંદ્રમા વચ્ચેના કુલ અંતરનું 8 ગણું છે. એનઈઓ 24 જુલાઈની રાતે અપોલો નામની કક્ષામાંથી પસાર થશે. જોકે તેની પૃથ્વી સાથે અથડાવાની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં વૈજ્ઞાનિકોએ તેને સંભવિત ખતરનાક એસ્ટેરોઈડની શ્રેણીમાં રાખ્યો છે.

બ્રિટનમાં લીક ડોક્યુ.ની સ્ટોરી કરનારા પત્રકારને 14 વર્ષની સજા થશે

લંડન

બ્રિટનમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં ફેરફાર તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં લીક ડોક્યુમેન્ટ દ્વારા સ્ટોરી ફાઈલ કરનાર પત્રકારોને ૧૪ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. એટલું જ નહીં તેમની સાથે વિદેશી જાસૂસ જેવું વર્તન કરવામાં આવશે. અહીંના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની ઓફિસને ટાંકીને છપાયેલા એક અહેવાલ અનુસાર વિદેશી જાસૂસો પર સંકેતો કરવા માટે બનાવવામાં આવેલા નવા કાયદા અંતર્ગત દોષિત સાબિત થયેલા આવા પત્રકાર જે લીક ડોક્યુમેન્ટ્સને હેન્ડલ કરે છે તેઓ તેમનો બચાવ પણ નહીં કરી શકે. આ અંગે સરકારનું કહેવું છે કે જ્યારે આ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા.

યજમાન જાપાનના વિજય સાથે ટોક્યો ગેમ્સનો પ્રારંભ

જાપાને ઓસ્ટ્રેલિયાને 8-1થી, અમેરિકાએ ઇટાલિને 2-0થી તથા કેનેડાએ મેક્સિકોને 4-0થી પરાજય આપ્યો હતો

કોરોના વાઈરસની મહામારીના કારણે એક વર્ષ સુધી સ્થગિત થયા બાદ ગેમ્સને સતત ૨૬ કરવાના ચોમેરથી થયેલા દબાણની વચ્ચે આખરે જાપાનની રાજધાની ટોક્યો ખાતે ઓલિમ્પિકનો મહિલા સોફ્ટબોલ, બેઝબોલ અને ફૂટબોલની ઈવેન્ટ સાથે પ્રારંભ થઈ ગયો હતો. જોકે ઓલિમ્પિકની સત્તાવાર શરૂઆત ૨૩મી જુલાઈથી થવાની છે, પરંતુ પ્રત્યેક ઓલિમ્પિકમાં કેટલીક

રમતોનો પ્રારંભ ઉદ્ઘાટન સમારંભ પહેલાં જ કરી દેવામાં આવે છે. ૨૦૦૮ની બેઈજિંગ ઓલિમ્પિક બાદ પ્રથમ વખત સોફ્ટબોલને સામેલ કરવામાં આવી છે. ૨૦૦૮માં જાપાને જ આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોરોના વાઈરસનાં સંક્રમણનાં જોખમને ધ્યાનમાં રાખીને ખાલી સ્ટેડિયમ વચ્ચે રમાયેલા ઓપનિંગ મુકાબલામાં જાપાને ઓસ્ટ્રેલિયાને ૮-૧થી પરાજય આપ્યો હતો.

બુધવારના અન્ય મુકાબલામાં અમેરિકાએ ઈટાલીને ૨-૦થી તથા કેનેડાએ મેક્સિકોને ૪-૦થી પરાજય આપીને પોતાના અભિયાનનો વિજયી પ્રારંભ કર્યો હતો. ટોક્યોથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર ફૂકુશિમા શહેરમાં આ ઈવેન્ટ્સ યોજાઈ હતી. કોરોનાના કારણે ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે અને ગેમ્સ પૂરી થાય ત્યાં સુધી તે અમલમાં રહેશે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં ચાર નવી રમતો જોડાશે, બેની વાપસી થશે

કોરોનાના ઓછાયા વચ્ચે યોજાનારા ટોક્યો ઓલિમ્પિક્સમાં આ વખતે કુલ ૩૩૯ મેડલ જીતવા માટે રમતવીરો પોતાની અજમાયશ કરશે અને તેના કારણે ટોક્યો ગેમ્સ અત્યાર સુધીની સૌથી મોટી ઓલિમ્પિક ગેમ્સ બની રહેશે. ટોક્યો ઓલિમ્પિક્સથી ચાર નવી ગેમ ઓલિમ્પિક્સમાં જોડાશે, જેમાં સ્કેટબોર્ડ, સર્ફિંગ, સ્પોર્ટ્સ ક્લાઇમ્બિંગ અને કરાટેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બે જૂની ગેમ જે થોડા સમયથી ઓલિમ્પિક્સમાંથી બાકાત હતી તે બેઝબોલ અને સોફ્ટબોલની વાપસી થશે. પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સના કાર્યક્રમમાં સ્કેટબોર્ડ અને સર્ફિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બંને રમતોને ૨૦૨૪માં યોજાનારા પેરિસ ઓલિમ્પિક્સમાં સામેલ કરવાની પણ મંજૂરી મળી ગઈ છે. સ્કેટબોર્ડમાં પાર્ક અને સ્ટ્રીટ એમ બે કેટેગરીમાં સ્પર્ધા રમાશે.

ટોક્યો ઓલિમ્પિક્સ વિલેજની ભવ્યતા સૌથી અનેરી

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ તેમજ એથલેટ જાપાનના પાટનગરમાં પહોંચી રહ્યા છે. ખેલાડીઓ જ્યાં રોકાયા છે તે ટોક્યો ગેમ્સ વિલેજની ભવ્યતા કંઈક અલગ જ છે આ ગેમ્સ વિલેજની ત્રણ તરફે સમુદ્ર છે અને આ વિલેજમાં ૧૮ માળ ધરાવતી ૨૧ ભવ્ય ધમારતો છે. ગેમ્સ વિલેજમાં ૪ લાકડાઓ વડે એક શોપિંગ સેન્ટર બનાવાયો છે. જેમાં ૧૦ હજાર લાકડાના મોટા ટુકડાઓનો ઉપયોગ કરાયો છે. આ લાકડાના ટુકડાઓ જાપાનની ૬૩ નગર પાલિકા અને પંચાયતો દ્વારા આપવામાં આવ્યા છે. જે લાકડાનો ટુકડો જ્યાંથી આવ્યો છે તેના પર તેને દાન કરનારા સ્થળોનું નામ લખાયેલું છે અને જેવી ગેમ્સ



પુરી થશે કે તે પછી આ લાકડાના ટુકડાઓ તેમને પરત મોકલી દેવાશે. ગેમ્સ વિલેજની ૨૧ બિલ્ડિંગમાં કુલ મળીને ૧૮૦૦૦ એથલેટ્સ અને સપોર્ટ સ્ટાફના સભ્યો રહી શકે તેવી વ્યવસ્થા છે. તેના દરેક રૂમ એસીયુક્ત છે અને તેમાં બે બેડ અને બે કબાટ મુકવામાં આવ્યા છે. આ ગેમ્સ વિલેજ પાછળ કુલ ૩૬ અબજ રૂપિયાનો ખર્ચો કરાયો છે. ઓલિમ્પિક પુરો થયા પછી આ બિલ્ડિંગને ફ્લેટમાં ફેરવીને સામાન્ય લોકોને રહેવા માટે પુલ્લા મુકવામાં આવશે. ગેમ્સ વિલેજમાં બે માળનો ડાઇનિંગ હોલ પણ તૈયાર કરાયો છે, કે જેથી ભોજન કરી શકાય. સાથે જ તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ડાઇનિંગ ટેબલો પર ફાઇબર ગ્લાસ લગાવાયા છે.

નોવાક જોકોવિચ પાસે ગોલ્ડન સ્લેમનો ઇતિહાસ રચવાની તક

રમતોના સૌથી મોટા મહાકુંભનું આયોજન ટોક્યોમાં થઈ રહ્યું છે અને આ ટોક્યો ઓલિમ્પિક્સમાં સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ પાસે ગોલ્ડન સ્લેમનો ઇતિહાસ રચવાની એક મોટી તક આવી છે. મહત્વની વાત એ છે કે તેના બે મુખ્ય પ્રતિસ્પર્ધી અને બિગ થ્રીમાં સામેલ રાફેલ નડાલ તેમજ રોજર ફેડરર ટોક્યો ઓલિમ્પિક્સમાં રમવાના નથી. વળી હાલમાં જોકોવિચ જે ફોર્મમાં છે તેને ધ્યાને લેતા ગોલ્ડન સ્લેમ પુરો કરતાં તેને કોઈ રોકી શકે તેવી સંભાવના દેખાતી નથી. જો જોકોવિચ ટોક્યો ઓલિમ્પિક્સ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતી લેશે તો પછી તેણે વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ યુએસ ઓપન જીતવાની જરૂર રહેશે અને વર્ષની ચારેય ગ્રાન્ડસ્લેમની સાથે ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતીને તે ગોલ્ડન સ્લેમ પુર્ણ કરી શકશે.


ટોક્યો ઓલિમ્પિક્સમાં કોરોનાનો ફફડાટ, ત્રણ 'પોઝિટીવ' ખેલાડીઓ બહાર




ટોક્યો: મહામારી વચ્ચે યોજાઈ રહેલી ટોક્યો ઓલિમ્પિક્સમાં હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્રણ જુદા-જુદા દેશોના ખેલાડીઓને કોરોના પોઝિટીવ રિપોર્ટ બાદ સ્પર્ધામાં ભાગ લીધા વિનાજ ઓલિમ્પિક રમતોત્સવ છોડવો પડ્યો છે. ચિલીની ટેકવોન્ડો ખેલાડી ફેર્નાન્ડા એગ્યુઈરે, નેધરલેન્ડની સ્કેટબોર્ડની ખેલાડી સેન્ડી જેકોબ્સ અને ચેક રિપબ્લિકના ટેબલ ટેનિસ ખેલાડી પાવેલ સિરૂસેકને કોરોનાનું સંક્રમણ લાગતા ટોક્યો ઓલિમ્પિક છોડવા માટે મજબૂર બનવું પડ્યું હતું. ટોક્યો ઓલિમ્પિક્સમાંથી કોરોનાના કારણે ખસી જનારા આ શરૂઆતી ખેલાડીઓ છે. જાપાનીઝ સરકારના નિયમ અનુસાર કોરોનાગ્રસ્ત વ્યક્તિને ૧૪ દિવસના ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે. જેના કારણે આ ત્રણેય ખેલાડીઓ હવે ૧૪ દિવસ ક્વોરન્ટાઈન રહેશે અને ઓલિમ્પિકમાં તેમની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે નહીં.

60 વર્ષ પછી છ ગુજરાતી સ્પર્ધકની હાજરી


છેલ્લા ૬૦ કરતાં વધુ વર્ષોથી રમતોના મહાકુંભ એવી ઓલિમ્પિક ગેમ્સમાં ગુજરાત સતત ગેરહાજર જ રહ્યું છે. જો કે ટોક્યો ઓલિમ્પિક્સમાં જાણે કે એ ૬૦ વર્ષની કસર નીકળી રહી હોય તેમ ત્રણ મહિલા ખેલાડી મુખ્ય ઓલિમ્પિક્સમાં, જ્યારે બીજી ત્રણ મહિલા ખેલાડીઓ પેરાલિમ્પિક્સમાં ભાગ લઈ રહી છે. અને તેના કારણે ૬૦ વર્ષ પછી ઓલિમ્પિક્સમાં ગુજરાતની હાજરી પુરાશે અને સંભવતઃ આ ગુજરાતી ખેલાડીઓમાંથી કોઈ મેડલ પણ જીતી લાવી શકે છે, ૧૯૬૦માં યોજાયેલા રોમ ઓલિમ્પિક્સમાં હોકી ટીમમાં રમેલા ગોવિંદરાવ સાંવતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને હવે માના પટેલ, અંકિતા રૈના, ઈલાવેનિલ વલારીવન, પારૂલ પરમાર, ભાવિના પટેલ અને સોનલ પટેલ ઓલિમ્પિકમાં ભાગ લેવા પહોંચી ગયા છે.



21 વર્ષીય આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલે યુનિવર્સિટી ક્વોટા પર ટોક્યો ઓલિ.માં ક્વોલિફાઇ થઇને ગુજરાતનું ગોરવ વધાર્યું છે, મૂળ અમદાવાદની માના પટેલ 100 મીટર બેક્સ્ટ્રોક સ્વીમીંગમાં ભાગ લેશે. માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ થનારી દેશની પ્રથમ મહિલા સ્વિમર બની છે.



શૂટિંગમાં ચર્ચાતુ એક નામ ઇલાવેનિલ વલારીવનનું છે. મૂળે દક્ષિણ ભારતીય પરંતુ અમદાવાદમાં સ્થાયી થયેલી ઇલાવેનિલે છેલ્લા કેટલાય સમયથી શૂટિંગમાં જોરદાર સફળતા મેળવી છે. તામિલનાડુના કુડાલોરમાં જન્મેલી ઇલાવેનિલ બાળપણથી જ પરિવાર સાથે અમદાવાદમાં સ્થાયી થઈ છે.




છેલ્લા કેટલાક સમયથી ટેનિસ તખ્તે સિંગલ્સ અને ડબલ્સમાં એક નામ સતત ચર્ચામાં રહ્યું છે અને તે છે ગુજરાતની અંકિતા રૈનાનું. અંકિતા રૈના ભારતની ટોચની ખેલાડી છે. આ વર્ષે ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ થયેલી અંકિતા સાનિયા મિર્ઝાની ડબલ્સ પાર્ટનર તરીકે રમવાની છે.




ઉંમર અને શારીરિક વિષમતાઓ છતાં પારૂલ પરમાર પેરા બેડમિન્ટનના વર્લ્ડ સર્વિસ ડાઉ કેટેગરીમાં છેલ્લા એક દાયકાથી નંબર વન છે અને 47 વર્ષની ઉંમરે પહોંચવા છતાં પારૂલ હજુ રમતમાં સક્રિય છે. પારૂલના પ્રભુત્વનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બીજી ક્રમાંકિત માનસી જોષીથી તે 1000 પોઇન્ટ આગળ છે.



ભાવિના પટેલ



પારૂલ પરમાર



સોનલ પટેલ



સોનલ પટેલ

ડ્રગ્સનું સેવન કરનાર ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડર ઓલિમ્પિકમાંથી સસ્પેન્ડ



ઓલિમ્પિક પહેલાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે. ૨૩મી જુલાઈએ સત્તાવાર રીતે ગેમ્સનું ઉદ્ઘાટન થાય તે પહેલાં ઓસ્ટ્રેલિયાના હોર્સ રાઇડરને પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડર જેમી કમ્બોન્ડ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે અને તેણે કોકેનનું સેવન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ તેને અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. આ મામલો એક મહિનાનો જૂનો છે પરંતુ આ કાર્યવાહી ઓસ્ટ્રેલિયા તરફથી કરવામાં આવી છે. ૨૬મી જૂને તેનો ડોપ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ૩૬ વર્ષીય જેમીની ઓલિમ્પિકમાં પ્રથમ વખત ભાગ લેવાનો હતો. ઓસ્ટ્રેલિયન હોર્સ રાઇડિંગ સંસ્થા એક્વેસ્ટેરિયન ઓસ્ટ્રેલિયાએ જેમીના સસ્પેન્શનની માહિતી આપી હતી. જેમીના એ-સેમ્પલ રિપોર્ટમાં તેણે કોકેન મેટાબોલાઇટનું સેવન કર્યું હોવાનું માલૂમ પડ્યું હતું.

સંક્ષિપ્ત સમાચાર

પાક. વન-ડે બાદ ટી-20 શ્રેણી પણ હાર્યું
ઇંગ્લેન્ડ ત્રીજી મેચમાં ત્રણ વિકેટે જીત્યું
માન્યેસ્ટર: લેગ સ્પિનર આદિલ રાશિદે કારકિર્દીનો બેસ્ટ સ્પેલ નાખતા ઇંગ્લેન્ડે ત્રીજી અને અંતિમ ટી20 ઇન્ટરનેશનલ મેચમાં પાકિસ્તાનને ત્રણ વિકેટ હરાવીને ત્રણ મેચની શ્રેણીને ૨-૧થી જીતી લીધી હતી. આ સાથે પાકિસ્તાને ઇંગ્લેન્ડમાં વન-ડે બાદ ટી20 શ્રેણી પણ ગુમાવી છે.

ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ: શ્રીલંકા સામે સતત નવમી સિરીઝ જીતી
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બાદ હવે શ્રીલંકાને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઇન્ડિયા પહેલા પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા હરાવવા સંયુક્ત નંબર વન ટીમ હતી. હવે શ્રીલંકા સામે ૯૩મો વન-ડે જીતી સતત ૯મી સીરીઝ જીતી રેકોર્ડ સર્જ્યો છે.

કોરોનાને માત આપ્યા બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં જોડાયો ઋષભ પંત
નવી દિલ્હી: ચાર દિવસ પહેલા બીસીસીઆઈએ 15 જુલાઈએ ઘોષણા કરી હતી કે પંત અને તાલીમ સહાયક દયાનંદ ગરાની બંને કોરોના પોઝિટિવ છે. વૃદ્ધિમાન સાહા હજુ ક્વોરન્ટિન છે. જો કે બુધવારે તેનો રિપોર્ટ નેગેટીવ આવતા તે ફરી ટીમમાં જોડાયો હતો.

24 જુલાઈએ ઓલિમ્પિક હોકીમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે જંગ

ટોક્યો: ટોક્યો ઓલિમ્પિક ગેમ્સની વિધિવત શરૂઆત શુક્રવારથી થઈ રહી છે. એવામાં ભારતીય એથલેટ્સની ટીમ ટોક્યો પહોંચી ગઈ છે. આ વખતે ભારતના ૧૨૭ ખેલાડીઓએ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં દેશના ૧૧૭ ખેલાડીઓએ ક્વોલિફાય કર્યું હતું. ભારત આ વર્ષે પોતાની ઓલિમ્પિક ભાગીદારીના ૧૦૦મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

વીરેંદ્રાજીનો કાર્યક્રમ
 - ૨૪ જુલાઈ : સવારે ૬:૦૦ કલાકે: મિક્સ ટીમ એલિમિનેશન
 - ૨૬ જુલાઈ : સવારે ૬:૦૦ કલાકે : મેન્સ ટીમ એલિમિનેશન
 - ૨૭ થી ૩૧ જુલાઈ સવારે ૬:૦૦ કલાકે: પુરુષ -મહિલા વ્યક્તગત એલિમિનેશન બપોરે ૧:૦૦ કલાકે : મેડલ મેચ

એથલેટિક્સનો કાર્યક્રમ
 - ૩૦ જુલાઈ - સવારે ૫:૩૦ કલાકે: પુરુષોની ૩૦૦૦ મીટર સ્ટીપલચેજ હીટ
 - સવારે ૭:૨૫ કલાકે : પુરુષોની ૪૦૦ મીટર હર્ડલ રેસ રાઉન્ડ ૧ હીટ
 - સવારે ૮:૧૦ કલાકે : મહિલા ૧૦૦ મીટર રાઉન્ડ ૧ હીટ
 - સાંજે ૪:૩૦ કલાકે : મિશ્રિત ૪ બાય ૪૦૦ મીટર રિલે રાઉન્ડ ૧ હીટ
 - ૩૧ જુલાઈ - સવારે ૬:૦૦ કલાકે : મહિલા ડિસ્ક્સ થ્રો બપોરે ૩:૪૦ કલાકે : પુરુષોની લાંબી કૂદ બપોરે ૩:૪૦ કલાકે : મહિલાઓની ૪૦૦ મીટર સેમીફાઇનલ સાંજે ૬:૨૫ કલાકે : ૪ બાય ૪૦૦ મીટર રિલે ફાઇનલ
 - ૧ ઓગસ્ટ - સાંજે ૫:૦૦ કલાકે: પુરુષોની ૪૦૦ મીટર હર્ડલ દોડ સેમીફાઇનલ
 - ૨ ઓગસ્ટ - સવારે ૬:૫૦ કલાકે : પુરુષોની લાંબા જમ્પ ફાઇનલ સવારે ૭:૦૦ કલાકે : મહિલા ૨૦૦ મીટર રાઉન્ડ ૧ હીટ બપોરે ૩:૫૫ કલાકે : મહિલાઓની ૨૦૦ મીટર સેમીફાઇનલ સાંજે ૪:૩૦ કલાકે : મહિલા ડિસ્ક્સ થ્રો ફાઇનલ સાંજે ૫:૪૫ કલાકે : પુરુષોની ૩૦૦૦ મીટર સ્ટીપલચેજ ફાઇનલ
 - ૩ ઓગસ્ટ - સવારે ૫:૫૦ કલાકે : મહિલા ભાલા ફેંક સવારે ૮:૫૦ કલાકે : પુરુષ ૪૦૦ મીટર હર્ડલ રેસની ફાઇનલ બપોરે ૩:૪૫ કલાકે : પુરુષો શોટ પુટ સાંજે ૬:૨૦ કલાકે : મહિલા ૨૦૦ મીટર ફાઇનલ
 - ૪ ઓગસ્ટ - સવારે ૫:૩૫ કલાકે : પુરુષ ભાલા ફેંક
 - ૫ ઓગસ્ટ - સવારે ૭:૩૫ કલાકે : મેન્સ શોટ પુટ ફાઇનલ બપોરે ૧: કલાકે : પુરુષ ૨૦ કિમી રેસ વોક ફાઇનલ
 - ૬ ઓગસ્ટ - સવારે ૨:૦૦ કલાકે : પુરુષ ૫૦ કિમી રેસ વોક ફાઇનલ બપોરે ૧:૦૦ કલાકે : મહિલા ૨૦ કિમી રેસ વોક ફાઇનલ સાંજે ૪:૫૫ કલાકે : પુરુષ ૪ બાય ૪૦૦ મીટર રિલે રાઉન્ડ ૧ હીટ સવારે ૫:૨૦ કલાકે : મહિલા ભાલા ફેંક ફાઇનલ
 - ૭ ઓગસ્ટ - સાંજે ૪:૩૦ કલાકે : પુરુષ ભાલા ફેંક ફાઇનલ સાંજે ૬:૨૦ કલાકે : પુરુષ ૪ બાય ૪૦૦ મીટર રિલે ફાઇનલ

બેડમિન્ટનનો કાર્યક્રમ
 - ૨૪ જુલાઈ - સવારે ૮:૫૦ કલાકે : મેન્સ ડબલ્સ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ એ સવારે ૯:૩૦ કલાકે : પુરુષ સિંગલ્સ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ ડી
 - ૨૫ જુલાઈ - સવારે ૭:૧૦ કલાકે : મહિલા સિંગલ્સ ગ્રૂપ સ્ટેજ - ગ્રૂપ બી
 - ૨૬ જુલાઈથી ૨૯ જુલાઈ - સવારે ૫:૩૦ કલાકે : ગ્રૂપ સ્ટેજ મેચ

- ૨૯ જુલાઈ - સવારે ૫:૩૦ કલાકે : પુરુષ ડબલ્સ ક્વાર્ટર
 - ૩૦ જુલાઈ - સવારે ૫:૩૦ કલાકે: મહિલા સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ બપોરે ૧૨:૦૦ કલાકે : પુરુષ ડબલ્સ સેમીફાઇનલ
 - ૩૧ જુલાઈ- સવારે ૫:૩૦ કલાકે : પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલ બપોરે ૨:૩૦ કલાકે : મહિલા સિંગલ્સ સેમીફાઇનલ બપોરે ૨: ૩૦ કલાકે : મેન્સ ડબલ્સ ફાઇનલ
 - ૧ ઓગસ્ટ - સવારે ૯: ૩૦ કલાકે : પુરુષ સિંગલ્સ સેમીફાઇનલ સાંજે ૫: ૦૦ કલાકે : મહિલા સિંગલ્સ ફાઇનલ
 - ૨ ઓગસ્ટ - ૪: ૩૦ કલાકે : પુરુષ સિંગલ્સ સેમીફાઇનલ

બોક્સિંગનો કાર્યક્રમ
 - ૨૪ જુલાઈ - સવારે ૮ કલાકે: વિમેન્સ વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ ૩૨ - ૯.૫૪ કલાકે: મેન્ટ વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ ૩૨
 - ૨૫ જુલાઈ - સવારે ૭:૩૦ કલાકે: મહિલા ફ્લાઈવેટ રાઉન્ડ ઓફ ૩૨ - સવારે ૮:૪૮ કલાકે: પુરુષોનો લાઇટવેટ રાઉન્ડ ઓફ ૩૨
 - ૨૬ જુલાઈ - સવારે ૭:૩૦ કલાકે: પુરુષોનો ફ્લાઈવેટ રાઉન્ડ ઓફ ૩૨ - ૯.૦૬ કલાકે સવારે: મેન્સ મિડલવેટ રાઉન્ડ ઓફ ૩૨
 - ૨૭ જુલાઈ - ૭.૩૦ કલાકે સવારે: મેન્સ વેલ્ટરવેટ રાઉન્ડ ઓફ ૧૬ - ૯.૩૬ કલાકે સવારે: વિમેન્સ લાઇટવેટ રાઉન્ડ ઓફ ૩૨ - ૧૦.૦૯ કલાકે સવારે) ૩૨નો મહિલાઓનો વેલ્ટરવેટ રાઉન્ડ
 - ૨૮ જુલાઈ - ૮:૦૦ ટૂંક: મહિલાઓની મિડલ વેઇટ રાઉન્ડ ૧૬
 - ૨૯ જુલાઈ - ૭:૩૦: પુરુષોનું મિડલ વેઇટ રાઉન્ડ ૧૬ - ૮: ૩૩ વાગ્યે: પુરુષોનું સુપર હેવીવેઇટ રાઉન્ડ ૧૬ - ૯:૩૬ વાગ્યે : વિમેન્સ ફ્લાયવેઇટ રાઉન્ડ ૧૬
 - ૩૦ જુલાઈ - ૭.૩૦ કલાકે સવારે: મહિલા લાઇટવેટ રાઉન્ડ ઓફ ૧૬

દોડેસવારીનો કાર્યક્રમ
 - ૩૦ જુલાઈ - સવારે ૫ કલાકે: ઇવેન્ટિંગ ઇન્ડિવિજ્યુઅલ ક્વોલિફાયર

તલવારબાજીનો કાર્યક્રમ
 - ૨૬ જુલાઈ - ૫.૩૦ કલાકે સવારે: મહિલા સાબ્રે વ્યક્તિગત ટેબલ દુર સાંજે ૪.૨૦ કલાકે: મહિલા સાબ્રે વ્યક્તિગત મમેડલ મેચ

ગોલ્ફનો કાર્યક્રમ
 - ૨૯ જુલાઈ- ૧ ઓગસ્ટ સવારે ૪ કલાકે: મેન્સ ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રોકપ્લે
 - ઓગસ્ટ ૪-૭ - ૪ કલાકે સવારે: મહિલા વ્યક્તિગત સ્ટ્રોકપ્લે

જિમનાસ્ટિક્સનો કાર્યક્રમ
 - જુલાઈ ૨૫ - ૬.૩૦ કલાકે સવારે: મહિલા કલાત્મક જિમનાસ્ટિક યોગ્યતા
 - ૨૯ જુલાઈથી ૩ ઓગસ્ટ - બપોરે ૨ કલાકે: મહિલા કલાત્મક જિમનાસ્ટિક ઓલ-રાઉન્ડ અને ઇવેન્ટ્સ ફાઇનલ

હોકીનો કાર્યક્રમ
 - ૨૪ જુલાઈ - સવારે ૬.૩૦ કલાકે: પુરુષ ગ્રુપ-એ: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ

- ૫.૧૫ કલાકે સાંજે: મહિલા ગ્રુપ-એ: ભારત વિરુદ્ધ નેધરલેન્ડ
 - ૨૫ જુલાઈ - સાંજે ૩ કલાકે: પુરુષ ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
 - ૨૬ જુલાઈ - સાંજે ૫.૪૫ કલાકે: મિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ જર્મની
 - ૨૭ જુલાઈ - સવારે ૬.૩૦ કલાકે: પુરુષ ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ સ્પેન
 - ૨૮ જુલાઈ - સવારે ૬.૩૦ કલાકે: મહિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ બ્રિટન
 - ૨૯ જુલાઈ - ૬ કલાકે સવારે: પુરુષ- ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ આર્જેન્ટીના
 - ૩૦ જુલાઈ - ૮.૧૫ કલાકે સવારે: મહિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ આયર્લેન્ડ સાંજે ૩ કલાકે: પુરુષ ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ જાપાન
 - ૩૧ જુલાઈ : સવારે ૮.૪૫ કલાકે: મહિલા ગ્રુપ-એ, ભારત વિરુદ્ધ આફ્રિકા
 - ૧ ઓગસ્ટ - સવારે ૬ કલાકે: પુરુષ ક્વાર્ટર ફાઇનલ- જો ટીમ ક્વોલિફાય કરે તો
 - ૨ ઓગસ્ટ - સવારે ૬ કલાકે: મહિલા ક્વાર્ટર ફાઇનલ- જો ક્વોલિફાય થાય તો
 - ૩ ઓગસ્ટ - સવારે ૭ કલાકે: પુરુષોની સેમિફાઇનલ
 - ૪ ઓગસ્ટ - સવારે ૭ કલાકે: મહિલાની સેમિફાઇનલ
 - ૫ ઓગસ્ટ - સવારે ૭ કલાકે: પુરુષોનો બ્રોન્ઝ મેડલ મેચ - ૩.૩૦ કલાકે: પુરુષોની ગોલ્ડ મેડલ મેચ
 - ૬ ઓગસ્ટ - સવારે ૭ કલાકે: મહિલાઓની બ્રોન્ઝ મેડલ મેચ - બપોરે ૩.૩૦ કલાકે: મહિલાઓની ગોલ્ડ મેડલ મેચ

જુડોનો કાર્યક્રમ
 - ૨૪ જુલાઈ સવારે ૭.૩૦ કલાકે: મહિલા ૪૮ કિલો એલિમિનેશન રાઉન્ડ ઓફ ૩૨

રોઈંગનો કાર્યક્રમ
 - ૨૪ જુલાઈ - સવારે ૭.૫૦ કલાકે: મેન્સ લાઇટવેટ ડબલ સ્કલ્સ હીટ

નોકાયાનનો કાર્યક્રમ
 - જુલાઈ ૨૫ - ૮.૩૫ સવારે: મહિલા લેવર રીડાયલ- રેસ ૧
 - ૧.૦૫ કલાકે સવારે: મેન્સ લેવર- રેસ ૧
 - જુલાઈ ૨૭ - ૧૧.૨૦ કલાકે સવારે: પુરુષોની ૪૯૪મર- રેસ ૧

શૂટિંગનો કાર્યક્રમ
 - ૨૭ જુલાઈ - ૫.૩૦ કલાકે સવારે: ૧૦ મીટર અર પિસ્તોલ મિશ્રિત ટીમ યોગ્યતા - ૯.૪૫ કલાક સવારે: ૧૦ મીટર એચર રાઇફલ મિશ્રિત ટીમ યોગ્યતા - સવારે ૧૧.૪૫ કલાકે: ૧૦ મીટર એર રાઇફલ મિક્સ ટીમ બ્રોન્ઝ મેડલ મેચ - ૧૨.૨૦ બપોરે: ૧૦ મીટર એર રાઇફલ મિક્સ ટીમ ગોલ્ડ મેડલ મેચ
 - ૨૯ જુલાઈ - સ.૫.૩૦ કલાકે: મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ ક્વોલિફિકેશન પ્રેસિશન
 - ૩૦ જુલાઈ: સ. ૫.૩૦ કલાકે: મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ ક્લોવિ. રેપિડ - સવારે ૧૧.૨૦ કલાકે: મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ ફાઇનલ
 - ૩૧ જુલાઈ - સ. ૮.૩૦ કલાકે: મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન યોગ્યતા - બપોરે ૧૨.૩૦ કલાકે: મહિલાઓની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ફાઇનલ - ૨ ઓગસ્ટ - સવારે ૮ કલાકે: પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન યોગ્યતા - ૧.૨૦ કલાક બપોરે: પુરુષોની ૫૦ મીટર રાઇફલ ૩ પોઝિશન ફાઇનલ
 (નોંધ : સ્પર્ધાના તમામ સમય જાપાનના સમય અનુસાર છે)

HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.

CENTURY 21
Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- 👉 Free Staging
- 👉 Free Professional Photography & virtual tour
- 👉 Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- 👉 Free Comparative Market Analysis
- 👉 Team of Professional for same price as hiring a single realtor
- 👉 Over 15 years of combined experience

- ◆ No Pressure
- ◆ No Obligation
- ◆ Just Answers to Your Questions...Its that Simple!



**1210 Radom
St Unit 502, Pickering**

**JUST SOLD
106%
of the asking price!**



**5580 Sheppard Ave E.
Unit 1004, Toronto**


**Just Purchased
for Buyer Client
below asking price!**

You have Nothing to Loose...Call us for a Free Consultation on How to Get Started.


**Use The Advantage of a Team,
Because...Teamwork Makes Your Dreams Work !**

Shamim & Amin Kharodia
Broker of Record / Sales Representative
teamkharodia@gmail.com
300-2855 Markham Rd Toronto ON M1X 0C3
D: (647) 501-6786 | D: (647) 308-2941
F : (416) 298-8303 | P: (647) 666-8676

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



CLUB CERAMIC



Lapoto Finish



Matt Fiish

પોર્સેલિન
ટાઈલ્સ શરૂ થાય
છે ફક્ત
\$ 0.89 થીPorcelain tiles starting from
\$0.89 per square
feet onlyCeramic tiles starting from
\$0.50 per square
feet onlyસિરામિક
ટાઈલ્સ શરૂ
થાય છે
\$ 0.50 થી

- ◆ Porcelain & Ceramic tiles at Direct factory price
- ◆ Price match guarantee + we will beat price with additional 5% discount
- ◆ Tiles available for Floor, Wall and Outdoor Parking

- ◆ પોર્સેલિન ટાઈલ્સ અને સિરામિક ટાઈલ્સ ફેક્ટરી ભાવે મળશે
- ◆ અમારા ભાવની ખાત્રી કરી શકો છો. વધારાના ૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે
- ◆ ફ્લોર, દિવાલ અને આઉટડોર પાર્કિંગની ટાઈલ્સ મળશે

-: Available Size :-

24" * 24" | 12" * 24" | 24" * 48" | 4" * 8" | 4" * 12"

MONTREAL

3590, Rue Griffith, Saint Laurent, QC, H4T 1A7
Phone: +1-514-260-2242 /
+1-514-813-3850

OTTAWA

Unit #4+5, 200 Colonnade Road,
Nepean, ON, K2E 7M1
+1-613-601-1474

MISSISSUAGA

5030 Maingate Drive, Unit#1, Mississauga, L4W 1X5
Phone: +1 (647) 527-6030 /
+1-514-813-3850<https://clubceramic.com> Email : sales@clubceramic.com

MOTEL for SALE

NIRAJ PANCHOLI, REALTOR®

ASQ CQT (Toronto) Mechanical Engineer (Ahmedabad)

Cell: 647-866-2790

Email: ncpancholi@gmail.comWebsite: <https://niraj-pancholi.c21.ca/>Multi Award Winner Agent Since 2011, Proven Result through Honesty & Experience
Outstanding Achievement Award of Excellence: every year since 2011 to 2021 ...
Among TOP 75 PRODUCER IN CANADA & CENTURION PRODUCER AWARDS and many more ...Selling BUSINESS, COMMERCIAL & RESIDENTIAL PROPERTIES since 2011
Visit my website for NEW & UPDATED Exclusive & MLS listings**MOTEL KING : Specializing in Selling Motels: LIST & SELL with confidence**18 Room Motel Near Pembroke - \$925,000
1.5 hrs from Ottawa / 4 hrs from GTA14 Room Motel Near Ottawa - \$999,000
Within the city, 4 rooms with full kitchenette
Low operating costs. All amenities near by42 Room Motel Near Timmins - \$1,300,000
On Hwy 11, Within the city, indoor corridor27 Room Motel in Thunder Bay - \$1,999,000
60 Room Motel in Thunder Bay - \$2,000,000Small to Mid-Size Motels in Northern Ontario
Price: \$1,300,000 to \$2,000,00030+ Room Motel Near Sudbury - \$2,000,000
VTB available, 40% down payment require from buyerOther 15 to 40 Room motels coming up for sale
Price: \$1M to \$3.5M - Buyers with 40% down, get readyRecently SOLD Motels Near
Welland, London, Sarnia, North Bay, Cochrane, Sudbury**Motel Job or Working Partner opportunity**

@ Experienced Motel Operator: to run motel in northern Ontario, English & computer knowledge require. Good salary.

@ Working Partner: willing to invest minimum \$200K, offering 25% to 50% partnership + management salary to run the motel in north

SERIOUS BUYERS: you must need about 35% down payment & to sign buyer representation agreement.
Call for personal meeting to see motel's financial & to discuss mortgage options. Private finance available.

Century 21 People's Choice Realty Inc., 120 Matheson Blvd E, Unit 103, Mississauga, L4Z 1X1 Office Ph.: 905-366-8100